દૈનિક
મુંબઈ સમાચાર
સૌરાષ્ટ્ર આવૃત્તિ
૨૦૪ વર્ષ
R.N.I. No. GUJ GUJ /2013/58486 *
મુંબઈથી પ્રસિદ્ધ થતું ■ સ્થાપના: ૧ જુલાઈ ૧૮૨૨ ■ પુસ્તક: ૨૦૪ ■ Volume 68 ■ Issue 296 ■ વિક્રમ સંવત ૨૦૮૨
માર્ગશીર્ષ વદ-૧૨ ■ મુંબઈ ■ MUMBAI SAMACHAR ■ www.bombaysamachar.com ■ 16 December 2025, Tuesday ■ REGD.No. MCS/058/2018-20
મંગળવાર, ૧૬ ડિસેમ્બર ૨૦૨૫, કિંમત ₹ ૧૦.૦૦ | તરોતાજા પૂર્તિ | LIKE & FOLLOW: /Mumbaisamachar4u

દૈનિક મુંબઈ સમાચાર
સૌરાષ્ટ્ર આવૃત્તિ
૨૦૪ વર્ષ
R.N.I. No. GUJ GUJ /2013/58486 ★
મુંબઈથી પ્રસિદ્ધ થતું ■ સ્થાપનાઃ ૧ જુલાઈ ૧૮૨૨ ■ પુસ્તકઃ ૨૦૪ ■ Volume 68 ■ Issue 296 ■ વિક્રમ સંવત ૨૦૮૨
માર્ગશીર્ષ વદ-૧૨ ■ મુંબઈ ■ MUMBAI SAMACHAR ■ www.bombaysamachar.com ■ 16 December 2025, Tuesday ■ REGD.No. MCS/058/2018-20
મંગળવાર, ૧૬ ડિસેમ્બર ૨૦૨૫, કિંમત ₹ ૧૦.૦૦
તરોતાજા પૂર્તિ
LIKE & FOLLOW: /Mumbaisamachar4u

ચાર-ચાર બંગડીવાળી સિંગરની આંતરજ્ઞાતીય સગાઈ થતા પરિવારના બહિષ્કારના નિર્ણયને પગલે...

વિરોધ કરનારા સમાજના આગેવાનો ‘મક્કમ’, સિંગરે પણ આપ્યો જવાબ

કિંજલ દવે અને ઔદિચ્ય બ્રહ્મ સમાજ સામસામે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ચાર-ચાર બંગડી જેવા પોપ્યુલર ગીતોની ગુજરાતી સિંગર કિંજલ દવે તાજેતરમાં વિવાદોનું કેન્દ્ર બની છે. થોડા સમય પહેલા તેણે ગુજરાતી બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજના નહીં હોવાથી અને સગાઈ આંતરજ્ઞાતિય હોવાથી ઔદિચ્ય બ્રહ્મ સમાજે સખત વિરોધ નોંધાવ્યો હતો. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ સમાજનો નિર્ણય આશ્ચર્યજનક છે. સમાજના નિર્ણય અંગે સિંગરે એક અંગે વીડિયો મારફત જવાબ આપ્યો હતો. આ (જુઓ પાનું ૨) ▶▶

‘મુંબઈ સમાચાર’નો શું છે મત?

કોઈ પણ સમાજ પોતાની પરંપરાનું પાલન કરે એ યોગ્ય છે, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કરે તો એ કોઈ ગુનો નથી, તેથી તેના માટે સમાજે પરિવારનો બહિષ્કાર કરવો યોગ્ય નથી. કોઈની સાથે સંબંધ બાંધવાનો નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય છે અને એ માટે એ વ્યક્તિ તથા તેના પરિવાર સામે ફતવો કાઢવો ન જોઈએ. આવા ફતવાને સનાતન ધર્મમાં કોઈ સ્થાન નથી. સમાજનો આ નિર્ણય તો આપખુદશાહી છે. સનાતન પરંપરામાં પણ આવા કઠોર નિર્ણયોને સ્થાન મળ્યું નથી એ વાત હકીકત છે. સિંગર કિંજલ દવેનો મુદ્દો સમગ્ર સમાજ જ નહીં, પરંતુ ગુજરાતની જનતા અને સભ્યસમાજ માટે આત્મમંથન કરવા જેવો છે. ■

૧૫ જાન્યુઆરીએ બીએમસીની ચૂંટણી

સાથે બીજી પાલિકાઓમાં પણ ઈલેક્શનઃ ૧૬મીએ પરિણામ

મુંબઈઃ વિધાનસભા ચૂંટણીના એક વર્ષ બાદ મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરીએ વધુ એક રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળશે, જ્યારે સૌથી સમૃદ્ધ મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની ૨૯ પાલિકામાં મતદાન થશે.

આ ચૂંટણી શાસક મહાયુતિ અને વિપક્ષ એમવીએમાંથી મોટાભાગના શહેરી વિસ્તારોમાં કોની લોકપ્રિયતા વધુ છે તેની કસોટી કરશે.

બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ૨૨૭ સહિત કુલ ૨,૮૬૯ બેઠક પર આ ચૂંટણી યોજાશે. ૧,૮૧,૯૩,૬૬૬ પુરુષ અને ૧,૬૬,૭૯,૭૫૫ મહિલા મતદાર સહિત કુલ ૩.૪૮ કરોડ મતદારો આ ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર હશે, એમ સ્ટેટ ઈલેક્શન કમિશન (એસઈસી) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી (જુઓ પાનું ૨) ▶▶

કુલ પાલિકાઃ ૨૯

કુલ બેઠકઃ ૨,૮૬૯

કુલ મતદારોઃ ૩.૪૮ કરોડ

ક્યાં ક્યાં ચૂંટણી?

મુંબઈ, નવી મુંબઈ, થાણે, પુણે, નાશિક, નાગપુર, છત્રપતિ સંભાજી નગર, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, કોલ્હાપુર, ઉલ્હાસનગર, પીંપરી-ચિંચવડ, સોલાપુર, અમરાવતી, અકોલા, લાતુર, પરભણી, ચંદ્રપુર, ભિવંડી-નિઝામપુર, માલેગાંવ, પનવેલ, મીરા-ભાયંદર, નાંદેડ-વાઘાલા, સાંગી-મિરજ-કૂપવાડ, જલગાંવ, ધૂળે, અહિલ્યાનગર, ઈચલકરંજી અને જાલના. ■

હે, ધનકુબેરો ભગવાનને આરામ તો કરવા દોઃ સુપ્રીમ કોર્ટ

વૃંદાવનમાં બાંકે બિહારીની વિશ્રાંતિના સમયમાં અમીરો માટે પૂજા કરવાની ખાસ વ્યવસ્થા સામે અદાલત ભડકી

નવી દિલ્હીઃ વૃંદાવનમાં બાંકે બિહારીના વિશ્રાંતીના સમયમાં તવંગરો માટે ખાસ પૂજા રાખવામાં આવે છે એ મુદ્દે સુપ્રીમ કોર્ટ નારાજ થઈ હતી.

જાણીતા બાંકે બિહારીજી મંદિરમાં દર્શન સમય અને મંદિર પ્રણાલીમાં ફેરફારને પડકારતી અરજીઓ સાંભળીને સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓ પાસે જવાબ માગ્યો છે. સર્વોચ્ચ અદાલતે તેણે જ રચેલી ઉચ્ચ સત્તાધારી ટેમ્પલ મેનેજમેન્ટ કમિટી અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી હતી. આ બાબતનું લિસ્ટિંગ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવ્યું છે.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ. પંચોલીની બેન્ચ સમક્ષ સિનિયર ઍડવોકેટ શ્યામ દીવાન અને વકીલ તન્વી દુબેએ દર્શન સમયમાં ફેરફાર અને દેહરી પૂજા જેવી આવશ્યક ધાર્મિક પ્રણાલી અટકાવવાની સામે રજૂઆત કરી હતી. દીવાને કહ્યું હતું કે આ દર્શનના સમય પરંપરા અને વિધિનો ભાગ છે. મંદિરને ભાવિકો માટે ખુલ્લું રાખવાના સમય એ પણ લાંબી પરંપરા છે. ઐતિહાસિક રીતે ટાઈમ ટેબલનું સખત રીતે પાલન કરાતું હતું. મંદિરના સમયના ફેરફારને લીધે મંદિરની આંતરિક વિધિ અને ભગવાન સવારે જાગે અને રાત્રે સૂએ એ સમયમાં પણ ફેરફાર થાય છે. (જુઓ પાનું ૨) ▶▶

પહલગામ આતંકવાદી હુમલોઃ એલઈટી, છ જણ સામે ચાર્જશીટ

જમ્મુ : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ બાવીસ એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલાના કેસમાં છ જણ અને બે આતંકવાદી સંસ્થાઓ સામે આરોપનામું નોંધાવ્યું હતું.

આરોપનામું પાકિસ્તાનસ્થિત લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને તેના પ્રોક્સી ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન અને પડોશી દેશના હેન્ડલર સામે નોંધવામાં આવ્યું છે. તહોમતનામામાં પાકિસ્તાનના કાવતરાની વિગતો, આરોપીની ભૂમિકા અને હુમલાના પૂરક પુરાવાની વિગતો છે. આરોપનામામાં પ્રતિબંધિત એલઈટી અને ટીઆરએફને પહલગામ હુમલાનું આયોજન કરવા, એને મદદ આપવા અને અંજામ આપવાની ભૂમિકા ભજવવા માટે આરોપી ગણવામાં આવ્યા છે. આમાં પાકિસ્તાની સૂત્રધાર સાજિદ જટ્ટનું નામ પણ છે. ૧,૫૯૭ પાનાનું આરોપનામું એનઆઈએની ખાસ અદાલતમાં નોંધાવામાં આવ્યું હતુ. આમાં લશ્કરે હુમલાના ૯૯ દિવસ બાદ ઑપરેશન મહાદેવમાં શ્રીનગરમાં દચીગામમાં મારેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીનાં નામો પણ છે. આ ત્રણેને ફૈસલ જટ્ટ ઉર્ફે સુલેમાન શાહ, હબીબ તાહિર ઉર્ફે જિબરન અને હમઝા અફઘાની તરીકે ઓળખવામાં આવ્યા હતા. (એજન્સી) ■

જોર્ડનમાં મોદીનું પીએમ જાફર હસન દ્વારા સ્વાગત



અમાનમાં ભારતીય મૂળની બાળકી સાથે ગમ્મત કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (એજન્સી)

અમાનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસની મુલાકાતે જોર્ડન પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતનો હેતુ આરબ દેશ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોના પ્રતીક તરીકે મોદીનું જોર્ડનના વડા પ્રધાન જાફર હસને એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મોદીએ સોશ્યિલ મીડિયા પર જણાવ્યું કે હું અમ્માન પહોંચી ગયો છું. એરપોર્ટ પર ઉષ્માભર્યા સ્વાગત માટે જોર્ડનના હશમાઇટ કિંગડમ ઓફ જોર્ડનના વડા પ્રધાન જાફર હસનનો આભાર. મને વિશ્વાસ છે કે આ મુલાકાત આપણા દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવશે. જોર્ડનની આ સંપૂર્ણ દ્વિપક્ષી મુલાકાત ૩૭ વર્ષ પછી થઇ રહી છે. જે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે થઇ રહી છે. મોદીના ચાર દિવસના ત્રણ દેશોના પ્રવાસમાં જોર્ડન પહેલો તબક્કો છે. ત્યારબાદ મોદી ઇથોપિયા અને ઓમાન પણ જશે. જોર્ડનના વડા પ્રધાને સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું કે આજે જોર્ડનમાં ભારતના વડા પ્રધાનનું વિશેષ અતિથિ તરીકે સ્વાગત કરવું અમારા માટે સન્માનની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે અમે આપણા બંને દેશો વચ્ચે ખાસ કરીને આર્થિક, રોકાણ અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની આશા રાખીએ છીએ.

નિકાસ ૧૯.૩૭ ટકા વધી ને આયાત ૧.૮૮ ટકા ઘટી

વેપાર ખાધ પાંચ મહિનામાં સૌથી ઓછી

નવી દિલ્હીઃ ભારતની નિકાસ ઓક્ટોબરમાં ઘટાડા પછી નવેમ્બરમાં ૧૯.૩૭ ટકા વધીને ૩૮.૧૩ અબજ ડોલર થઈ, જે એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ માલના ઊંચા શિપમેન્ટને કારણે વેપાર ખાધ પાંચ મહિનાના નીચલા સ્તરે ૨૪.૫૩ અબજ ડોલર થઈ હતી.

અમેરિકા દ્વારા ભારતીય માલ પર ૫૦ ટકાના ભારે ટેરિફ છતાં નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન, નિકાસ ૨૭૦ અબજ ડોલર રહી, જે એપ્રિલ-નવેમ્બર ૨૦૨૪માં ૨૪૮.૫૬ અબજ ડોલર હતી.

સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, સમીક્ષા હેઠળના મહિનામાં સોનું, ક્રૂડ ઓઇલ, કોલસો અને કોકના ઇનબાઉન્ડ શિપમેન્ટમાં ઘટાડો થવાને કારણે દેશની આયાત ૧.૮૮ ટકા ઘટીને ૬૨.૬૬ અબજ ડોલર થઈ.

સોનાની આયાત ૫૯.૧૫ ટકા ઘટીને ૪ અબજ ડોલર (જુઓ પાનું ૨) ▶▶

દિલ્હીમાં ભયંકર પ્રદૂષણઃ ૬૧ ફ્લાઈટ રદ, ૪૦૦ મોડી

ત્રણ દેશે પોતાના નાગરિકોને દિલ્હીમાં શું કરવું - શું ન કરવુંની માર્ગદર્શિકા બહાર આપી

નવી દિલ્હીઃ દિલ્હીની હવાની ગુણવત્તા સોમવારે ‘ભયાનક’ કેટેગરીમાં કથળી જતા સિંગાપોરના ભારતમાંના હાઈ કમિશને દિલ્હી-એનસીઆરમાં રહેતા તેના નાગરિકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. હાઈ કમિશને નાગરિકને ઘરે જ રહેવાની અને બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવાની સલાહ આપી છે. બ્રિટન અને કેનેડાએ પણ આ પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડી છે.

સોમવારે દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું જાડુ આવરણ છવાઈ જતા દૃષ્ટિગોચરતા તદ્દ્ન ઓછી થઈ ગઈ હતી અને ૬૧ ફ્લાઈટ રદ થઈ હતી અને બીજી ૪૦૦ ફ્લાઈટ મોડી પડી હતી.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના સમીર એપમાં મળતા ડેટા પ્રમાણે સોમવારે સવારે ૭:૦૫ વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૫૪ હતો. રવિવારે હવા ગુણવત્તા સુચકાંક ૪૬૧ હતો. રવિવાર ડિસેમ્બરનો બીજા નંબરનો બદતર દિવસ હતો.

દિલ્હી આવનારી પાંચ ફ્લાઈટને બીજે વાળવામાં આવી હતી. (જુઓ પાનું ૨) ▶▶

‘મનરેગા’નું નામ ‘જી-રામ-જી’ શું કામ?: વિપક્ષો ગુસ્સામાં

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી ઍક્ટ ‘મનરેગા’નું નામ બદલીને વિકસિત ભારત ગૈરેનમ્ટી રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (વીબી-જી રામ-જી) રાખવાની માગણી કરતા ખરડાને મામલે વિપક્ષે સરકારની એમ કહીને આકરી ટીકા કરી હતી કે શા માટે રાષ્ટ્રપિતાનું નામ હટાવવામાં આવી રહ્યું છે.

વિકસિત ભારત ગૈરેન્ટી રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (વીબી-જી રામ-જી) બિલ ૨૦૨૫નું સોમવારે બિઝનેસની પૂરક યાદી સાથે લોકસભામાં લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

નેશનલ વિઝન ઑફ વિકસિત ભારત ૨૦૪૭ સાથે સુસંગત ગ્રામીણ વિકાસ માળખાને ધ્યાનમાં રાખીને આ ખરડામાં ‘મનરેગા’ને સ્થાને વિકસિત ભારત ગેરેન્ટી રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) (વીબી-જી રામ-જી) બિલ ૨૦૨૫ લાવવાની માગણી કરવામાં આવી હતી. નવા (જુઓ પાનું ૨) ▶▶

પક્ષના આશીર્વાદથી નવી તક મળીઃ ભાજપના નવા પ્રમુખ

પટણાઃ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નિમાયેલા નીતિન નબીને પોતાની બઢતીને સોમવારે પક્ષના આશીર્વાદ અને નવી તક લેખાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ જ એક એવો પક્ષ છે જેમાં નીચલા સ્તરના કાર્યકર્તાઓને પણ મોટા હોદ્દા સુધી પહોંચવાની તક મળે છે.

દિલ્હી જતા અગાઉ તેમણે પક્ષે મૂકેલા વિશ્વાસ બદલ ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો.

ભાજપ માત્ર યુવાનોને બઢતી જ નથી આપતો, પરંતુ તેમને માર્ગદર્શન આપી મોટા લક્ષ્યો માટે તૈયાર કરે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભાજપ એક જ એવો પક્ષ છે જે નીચલા (જુઓ પાનું ૨) ▶▶

નીતિન નબીને કમાન સંભાળી

ભાજપના નવા નિમાયેલા કાર્યવાહક પ્રમુખ નીતિન નબીનું ગૃહ પ્રધાને અમિત શાહે અભિવાદન કર્યું હતું. (એજન્સી)

નવી દિલ્હીઃ ભાજપના નવા નિમાયેલા કાર્યવાહક પ્રમુખ નીતિન નબીને સોમવારે પક્ષના વડા મથકમાં જઈને પોતાનો હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો. ભાજપના પ્રમુખ અને કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ, શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને બીજાઓ નીતિને હોદ્દો સંભાળ્યો ત્યારે હાજર હતા. નબીન તેમની નિમણૂકના એક દિવસ બાદ સોમવારે બપોરે ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ આવ્યા હતા. તેમનું સ્વાગત દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા (જુઓ પાનું ૨) ▶▶

નીતીશનું ઠેકાણે છે?: મંચ પર મહિલા ડૉક્ટરનો બુરખો હટાવ્યો

નવી દિલ્હીઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર પટણામાં સરકારી કાર્યક્રમ દરમિયાન નિમણૂક પત્ર આપતી વખતે મહિલા આયૂષ ડૉક્ટરનો બુરખો હટાવતા હોવાનું દર્શાવતો વીડિયો વાઈરલ થયા બાદ રાજકીય વિવાદ ભડકી ઊઠ્યો હતો.

નવા ભરતી કરાયેલા આયૂષ ડૉક્ટરોને નિમણૂકપત્ર આપવા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી.

નિસરત પરવિન નિમણૂકપત્ર લેવા આગળ આવી હતી. તેને નિમણૂક પત્ર આપ્યા બાદ મુખ્ય પ્રધાન નીતીશકુમારે મહિલાના બુરખા સામે જોઈ તેને એ અંગે પૂછ્યું હતુ અને તેને જાતે જ બુરખો ચહેરા પરથી હટાવવાની સૂચના આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત અમુક લોકો હસી પડતાં દેખીતી રીતે જ મહિલા અસ્વસ્થ થઈ ગઈ હતી. સોશ્યલ મીડિયા પર વીડિયો વાઈરલ કરી રાષ્ટ્રીય જનતા દળે એમ કહીને નીતીશકુમારની ટીકા કરી હતી કે નીતીશજીને શું થઈ ગયું છે? શું એમનું માનસકિ સંતુલન છેક જ (જુઓ પાનું ૨) ▶▶

ગોવાની આગ માટે કોણ જવાબદાર?: કોર્ટ

પણજીઃ બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે બિર્ચ બાય રોમિયો લેન નાઈટ ક્લબ વિરુદ્ધના સિવિલ સૂટને એમ કહીને પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઈએલ-જનહિતની અરજી)માં પરિવર્તિત કરી દીધી હતી કે પચીસ જણનો ભોગ લેનારી કરુણાંતિકા માટે કોઈને તો જવાબદાર ઠેરવવો પડશે. હાઈ કોર્ટની ગોવા ખંડપીઠના ન્યાયાધીશ સારંગ કોતવાલ અને આશીષ ચૌહાણે કડક શબ્દોમાં કહ્યું હતું કે સ્થાનિક પંચાયત ઘટનાની આપોઆપ નોંધ લેવામાં નિષ્ફળ રહી હતી અને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી.

ડિવિઝન બૅન્ચે ગોવા સરકારને નાઈટ ક્લબને આપવામાં આવેલી પરવાનગીને લગતી વિગતવાર અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. (એજન્સી)

એક્સ્ટ્રા અફેર

ભરત ભારદ્વાજ
feedback@bombaysamachar.com

સિડનીમાં આતંકી હુમલો, મુસ્લિમો માટેની નફરત ઘેરી બનશે

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. બોન્ડી બીચ પર રવિવારે બપોરે હનક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર બે મૂળ પાકિસ્તાની આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને ૧૬ લોકોનાં ઢીમ ઢાળી દીધાં. તેમાંથી ૧૧ લોકો તો બીચ પર જ ઢળી ગયાં, જ્યારે બાકીના પાંચ હોસ્પિટલમાં મોતને ભેટ્યા છે. આ હુમલામાં ૩૮ લોકો ઘાયલ થયા છે ને તેમાંથી ઘણાંની હાલત ગંભીર છે એ જોતાં મૃત્યુ આંક હજુ વધી શકે છે. ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોન હુમલા વખતે બીચ પર જ હતો ને ગોળીબાર સાંભળીને ભાગી ગયો પછી એક રેસ્ટોરન્ટમાં છુપાઈને માંડ માંડ જીવ બચાવ્યો. વોને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી એટલે લોકોને આ વાતની ખબર પડી પણ વોનની જેમ બીજા સેંકડો લોકો માંડ માંડ જીવ બચાવી શક્યા છે.

પોલીસે તરત પહોંચી જઈને એક આતંકવાદીને તો તરત ઢાળી દીધેલો જ્યારે બીજો આતંકવાદી એક મુસ્લિમ યુવકના કારણે ઝડપાઈ ગયો છતાં ધમપછાડા કરતો હતો તેથી પોલીસે તેને પણ ગોળી મારવી પડી. આ આતંકી હોસ્પિટલમાં છે અને તેની હાલત ગંભીર છે એ જોતાં એ પણ ઉપર પહોંચી જાય તો નવાઈ નહીં. એ ઢબી જાય તો અફસોસ કરવા જેવો નથી કેમ કે, ૧૬ લોકોનો જીવ લેનારા નરાધમને જીવતા રહેવાનો કોઈ હક નથી. સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે આતંકવાદી બાપ-દીકરો હતા ને મૂળ પાકિસ્તાની છે. તેમાંથી ૫૦ વર્ષનો પિતા સાજિદ અકરમ ઢબી ગયો જ્યારે ૨૪ વર્ષનો પુત્ર નવીદ અકરમ હોસ્પિટલમાં છે.

ઓસ્ટ્રેલિયા દુનિયામાં સૌથી સલામત દેશોમાંથી એક છે પણ સિડનીની ઘટનાએ સાબિત કર્યું છે કે દુનિયામાં હવે કોઈ દેશ એવો દાવો કરી શકે તેમ નથી કે પોતે એકદમ સલામત છે. જિહાદના નામે ચલાવાતા મુસ્લિમ આતંકવાદનો ભરડો આખી દુનિયા ફરતે છે એ વાત આ હુમલાએ સાબિત કરી દીધી છે અને તેનાથી કઈ રીતે બચવું એ વિશે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.

સિડનીની ઘટનામાં યહૂદીઓને નિશાન બનાવાયા તેનો અર્થ એ થયો કે, હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે હુમલો થયો છે. હમાસે પહેલાં આતંકવાદી હુમલો કરીને ૧૨૦૦ ઈઝરાયલીઓને રહેંસી નાખ્યા હતા અને બહેન-દીકરીઓ પર પાશવી બળાત્કાર સહિતના અત્યાચારો ગુજાર્યા હતા. ઈઝરાયલે વળતો પ્રહાર કરીને હમાસના તાબા હેઠળના ગાઝાપટ્ટી વિસ્તારને ખેદાનમેદાન કરી નાખ્યો. ઈઝરાયલે કશું ખોટું નહોતું કર્યું કેમ કે પોતાની સુરક્ષા માટે વળતો હુમલો કરવાનો તેને અધિકાર છે પણ દુનિયાભરના મુસ્લિમોના માનસમાં એવું ઝેર ભરી દેવાયું કે, ઈઝરાયલે ગાઝાપટ્ટીના મુસ્લિમો પર ભારે અત્યાચાર કરી મૂક્યા. ઈઝરાયલ સામે નફરતનો માહોલ પેદા કરી દેવાયો તેનું આ પરિણામ છે.

સિડનીના હુમલાએ આખી દુનિયા સામે એક એ વાસ્તવિકતા પણ છતી કરી દીધી કે દુનિયાના બધા મુસ્લિમો આતંકવાદી નથી કે આતંકવાદના સમર્થક પણ નથી પણ એક વ્યક્તિના કારણે મુસ્લિમો વિશેનો દૃષ્ટિકોણ નહીં બદલાય. સિડનીમાં હુમલાખોર આંતકવાદીને પાછળથી પકડીને તેની પાસેથી મશીનગન છીનવીને તેની સામે તાકી દેનારા માણસનું નામ અહમદ અલ અહમદ છે અને અહમદ મુસલમાન છે. સિડનીના બોન્ડી બીચ પર ફળ વેચતા ૪૩ વર્ષના અહમદે જરાય ડર્યા વિના ભારે મર્દાનગી અને મુત્સદીગીરી વાપરીને પાછળથી આવીને આતંકવાદી પાસેથી મશીનગન ખૂંચવી લીધી હતી.

આતંકવાદી પાસે બીજાં હથિયારો હતાં ને તેમાંથી તેણે ગોળીબાર કર્યો તેમાં અહમદને બે ગોળી વાગી છતાં અહમદે આ હિંમત બતાવી એ બદલ તેને સલામ કરવી જોઈએ. અહમદની મર્દાનગીના કારણે પોલીસ આતંકવાદીને સરળતાથી પકડી લીધો. અહમદ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને એ ઝડપથી સાજો થાય એ માટે પ્રાર્થના કરવી જોઈએ. અહમદે આ બહાદુરી ના બતાવી હોત તો શું થયું હોત તેની કલ્પના કરવી અઘરી છે કેમ કે આતંકવાદી પાસે હેન્ડ ગ્રેનેડ સહિત બીજાં હથિયારો હતાં. એ હથિયારોથી તેણે કેટલી લાશો ઢાળી દીધી હોત તેની કલ્પના કરી શકાય તેમ નથી એ જોતાં અહમદ સાચા અર્થમાં તારણહાર સાબિત થયો ને સંખ્યાબંધ લોકોના જીવ તેણે બચાવ્યા છે.

દુનિયામાં અને ખાસ તો ભારતમાં મુસ્લિમોને આતંકવાદ સાથે જોડવાની ફેશન છે. ભારતમાં તો સોશ્યિલ મીડિયા પર એવો બકવાસ સવાલ પણ કરાય છે કે, દુનિયામાં બનતી આતંકવાદની બધી ઘટનાઓ સાથે મુસ્લિમો જ કેમ જોડાયેલા હોય છે ? સિડનીની ઘટનાએ સાબિત કર્યું કે, બધા મુસ્લિમો આતંકવાદી નથી ને આતંકવાદી માનસિકતા પણ ધરાવતા નથી. કમનસીબે અહમદ જેવા મુસ્લિમો બહુ ઓછા હોય છે. અહમદની જેમ આતંકવાદીઓની સામે ભિડાઈ જવાની વાત તો છોડો પણ જિહાદને નામે થતી નિર્દોષોની હત્યાની સામે ખુલ્લેઆમ બોલતા પણ નથી. તેના કારણે આતંકવાદને મુસ્લિમો સાથે જોડી દેવાનું સરળ થઈ જાય છે. આ ઘટના પછી પણ એ જ થશે ને મુસ્લિમો તરફની નફરત ઘેરી બનશે.

સિડનીની ઘટના પછી એક બીજી વાત વિશે પણ આપણે વિચારવું જરૂરી છે. ભારતમાં આતંકવાદી હુમલા થાય છે ત્યારે લગભગ દરેક કિસ્સામાં લોકો પોતાના જીવની ચિંતા કરીને ભાગવા માંડે છે. આતંકવાદીઓ એકલ-દોકલ જ હોય છે, કંઈ પચાસ-સો નથી હોતા છતાં તેમની સામે ભિડાઈ જવાની મર્દાનગી બતાવાઈ હોય એવું ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં બન્યું હોય એવું યાદ નથી આવતું. તેના કારણે આતંકવાદીઓ લોકોની લાશો ઢાળીને નિરાંતે રવાના થઈ જાય છે ને મોટા ભાગની ઘટનાઓમાં તો પકડાતા જ નથી.

પહલગામનો કિસ્સો તાજો જ છે અને યોગાનુયોગ પહલગામ અને સિડનીની ઘટનાઓમાં સામ્ય પણ છે. બંને ઘટનાઓમાં લોકો મોજમસ્તી માટે ભેગા થયા હતા ને આતંકવાદીઓ ત્રાટક્યા. સિડનીમાં બે આતંકી હતા જ્યારે પહલગામમાં ચાર આતંકવાદી હતા. પહલગામમાં સિડની જેટલાં લોકો નહોતા પણ મોટી સંખ્યામાં લોકો હતાં છતાં કોઈએ આતંકીઓ સામે ભિડાઈ જવાની હિંમત ના બતાવી. બધાને મોતનો ડર લાગતો જ હોય છે તેથી કોઈના પર દોષારોપણ ના કરી શકાય પણ આતંકવાદીઓ સામે લડવાની હિંમત બતાવાય તો આતંકીઓને પણ ઝબ્બે કરી શકાય છે એ વાત સિડનીની ઘટનાએ સાબિત કરી છે.

અહમદે શું વિચાર્યું હશે એ ખબર નથી પણ આતંકવાદની ઘટના વખતે મોતની પરવા નહીં કરનારો અહમદ જેવો એકાદ ભડવીર પણ નીકળી આવે તો આતંકીઓને પણ પછાડી શકાય છે એ વાત સિડનીની ઘટનાએ સાબિત કરી છે.

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

દક્ષિણાયન - સૌર હેમંતઋતુ, મંગળવાર, તા. ૧૬-૧૨-૨૦૨૫, અન્નપૂર્ણા વ્રત સમાપ્તિ

- ભારતીય દિનાંક ૨૫, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૭
- વિક્રમ સંવત ૨૦૮૨, શા. શકે ૧૯૪૭, માર્ગશીર્ષ વદ-૧૨
- જૈન વીર સંવત ૨૫૫૨, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧૨
- પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૫
- પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૫
- પારસી ફસલી રોજ ૧ લો હોરમજદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૪
- મુસ્લિમ રોજ ૨૪મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૭
- મીસરી રોજ ૨૬મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૭
- નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૪-૦૯ સુધી, પછી વિશાખા
- ચંદ્ર તુલામાં
- ચંદ્ર રાશિ નામાક્ષરઃ તુલા (ર, ત)
- સૂર્યોદયઃ મુંબઈ ક. ૦૭ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૫, સ્ટા. ટા.
- સૂર્યાસ્તઃ મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૫, સ્ટા. ટા.

મુંબઈ સમુદ્રમાં ભરતી-ઓટ

- ભરતીઃ સવારે ક. ૦૯-૦૬, રાત્રે ક. ૨૨-૩૬
- ઓટઃ બપોરે ક. ૧૫-૩૯, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૯ (તા. ૧૭)
- વ્રત પર્વાદિઃ વિક્રમ સંવત ૨૦૮૨, 'પિંગલ' નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૭, 'વિશ્વાવસુ' નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ - દ્વાદશી. અન્નપૂર્ણા વ્રત સમાપ્તિ, સંક્રાંતિ પુણ્યકાળ ક. ૧૨-૩૫ સુધી
- શુભાશુભ દિનશુદ્ધિઃ બપોરે ક. ૧૨-૩૫ સુધી શુભ કાર્ય વર્જ્ય છે. મુહૂર્ત વિશેષઃ મહાબલિ હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, બજરંગ બાણ વાંચન. સંક્રાંતિ પુણ્યકાળમાં સાંસારિક, માંગલિક કાર્ય વર્જ્ય છે, નદી-સંગમ-તીર્થમાં, સ્નાન-તર્પણ, શ્રાદ્ધ, સૂર્ય-વિષ્ણુ-શિવપૂજા, બ્રાહ્મણ ભોજન, આદિ ધર્મકાર્યનો મહિમા. શુદ્ધ સમયમાં શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, નવા વસ્રો, આભૂષણ, માલ લેવો, રત્નધારણ, બી વાવવું, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
- આચમનઃ ચંદ્ર-રાહુ ત્રિકોણ સાહસિક સ્વભાવ
- ખગોળ જ્યોતિષઃ ચંદ્ર-રાહુ ત્રિકોણ
- ગ્રહગોચરઃ સૂર્ય ધનુ, મંગળ-ધનુ, માર્ગી બુધ- વૃશ્ચિક વક્રી ગુરુ-મિથુન, શુક્ર-વૃશ્ચિક શુક્ર અસ્ત) માર્ગી શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, વક્રી હર્ષલ-વૃષભ, માર્ગી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર. ■

અણુક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખોલતો ખરડો લોકસભામાં રજૂ

નવી દિલ્હીઃ ઉદ્યોગ ભાગીદારો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરવા માટે, ભારતના નાગરિક અણુક્ષેત્રને સંચાલિત કરતા કાયદાઓમાં ફેરફાર કરવા, તેને ખાનગી ભાગીદારી માટે ખોલવા અને નવી જવાબદારી શાસન લાગુ કરવા માટે એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે.

ભારતની સંપૂર્ણ પરમાણુ ઊર્જા ક્ષમતાનો ઉપયોગ કરવા માટે એક વ્યાપક કાયદા તરીકે જોવામાં આવતા, સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા બિલ, ૨૦૨૫, એટોમિક એનર્જી એક્ટ, ૧૯૬૨ અને સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ, ૨૦૧૦ને રદ કરવાનો પ્રયાસ કરે છે.

'આ બિલ પરમાણુ નુકસાન માટે વ્યવહારિક નાગરિક જવાબદારી શાસન પ્રદાન કરવા અને પરમાણુ ઉર્જા નિયમનકારી બોર્ડને વૈધાનિક દરજ્જો આપવાનો પ્રયાસ કરે છે,' તેવું પીએમઓમાં રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું.

બિલમાં ઉમેર્યું છે કે ઓપરેટર 'અસાધારણ પ્રકૃતિની ગંભીર કુદરતી આપત્તિ, સશસ્ત્ર સંઘર્ષ, દુશ્મનાવટ, આંતરવિગ્રહ અને બળવો અથવા આતંકવાદ'ના કૃત્યને કારણે થયેલા નુકસાન સિવાયના નુકસાન માટે જવાબદાર રહેશે.

વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈઃ ખરડો સંસદમાં

નવી દિલ્હીઃ વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશના તમામ લોકોને વીમાકવચ પૂરું પાડવા સરકાર વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈની માગણી કરતો ખરડો આ અઠવાડિયે લોકસભામાં રજૂ કરવાની સરકારની યોજના છે.

સબકા વીમા સબકી રક્ષા (અમેન્ડમેન્ટ ઈન્સ્યોરન્સ લૉ) ઍક્ટ, ૨૦૨૫માં ઈન્સ્યોરન્સ ઍક્ટ ૧૯૩૮, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઍક્ટ ૧૯૫૬ અને ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઍક્ટ ૧૯૯૯માં સુધારો કરવાની માગણી કરવામાં આવી છે.

લોકસભામાં રજૂ કરતા અગાઉ આ ખરડો સભ્યોમાં ફેરવવામાં આવ્યો હતો.

આ ખરડામાં વીમા ક્ષેત્રમાં એફડીઆઈની વર્તમાન ૭૪ ટકાની મર્યાદા વધારીને ૧૦૦ ટકા કરવાની માગણી કરવામાં આવી છે.

એફડીઆઈની મર્યાદા ૧૦૦ ટકા કરવામાં આવે છતાં કંપનીના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટ કે સીઈઓ તો ભારતીય જ હશે. આ ખરડાને શુક્રવારે પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી હતી જેને કારણે લોકસભામાં આ ખરડો રજૂ કરવાનો માર્ગ મોકળો થયો હતો. (એજન્સી)

ભારત-અમેરિકા વેપાર કરાર ફાઈનલ જ સમજોઃ વાણિજ્ય સચિવ

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા તેના પ્રસ્તાવિત દ્વિપક્ષી વેપાર કરારની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ જ નજીક છે. તેમજ બંને દેશો આ દિશામાં સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યા છે, એમ વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે જણાવ્યું હતું.

બંને દેશો ઊંચા ટેરિફના મુદ્દાને ઉકેલવા અને વ્યાપક દ્વિપક્ષી વેપાર કરાર(બીટીએ) પર અલગ-અલગ વાટાઘાટો કરી રહ્યા છે. અમેરિકાના નવા ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ રિક સ્વિટ્ઝર ગયા અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા હતા અને વાણિજ્ય સચિવ સાથે વેપાર વાટાઘાટો કરી હતી.

સ્વિટ્ઝરની મુલાકાત દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષી વેપાર સંબંધો, કરારો અને વ્યાપક બીટીએની પ્રગતિની સમીક્ષા કરી હતી. વાણિજ્ય સચિવ અગ્રવાલે પત્રકારોને જણાવ્યું કે અમે કરારને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છીએ, જે ટૂંક સમયમાં પૂર્ણ થઇ શકે છે. જો કે હું ચોક્કસ સમયમર્યાદા આપી શકતો નથી.

તેમણે બીટીએ પર વધુ ઔપચારિક રાઉન્ડ થશે કે કેમ તેનો જવાબ આપતાં જણાવ્યું કે અંતિમ તબક્કામાં વાટાઘાટો માટે સામાન્ય રીતે આવા રાઉન્ડની જરૂર હોતી નથી.

કોઇ ઔપચારિક રાઉન્ડ નહીં હોય, પરંતુ ભૌતિક અને વર્ચ્યુઅલ બેઠકો સમાપન સુધી ચાલુ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે તો અમે તે ઝોનમાં આગળ વધી રહ્યા છીએ અને અમે તેને શક્ય તેટલી ઝડપથી જોવા માટે સતત કામ કરી રહ્યા છીએ.

પહેલા પાનાનું ચાલુ

૧૫મી જાન્યુઆરીએ

હતી તે પાલિકાની ચૂંટણીની એસઈસી દ્વારા સોમવારે જાહેરાત કરવામાં આવી હતી.

૧૬મી જાન્યુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ભાજપના વડપણ હેઠળની મહાયુતિ શહેરી વિસ્તારમાં તેની સર્વોપરિતા પુરવાર કરવાના પ્રયાસ કરશે અને વિપક્ષ વિધાનસભાની ચૂંટણીમાં મળેલા નાલેશીજનક પરાજયમાંથી બેઠાં થવાનો પ્રયાસ કરશે જેને કારણે તમામ લોકોની નજર ચૂંટણીનાં પરિણામો પર હશે.

વર્ષ ૨૫-૨૬ માટે ૭૪,૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુના બજેટ સાથે એશિયાની સૌથી મોટી મહાનગરપાલિકા બીએમસી પર શિવસેના અને જૂનિયર ભાગીદાર ભાજપની અવિભાજિત યુતિએ વર્ષ ૨૦૧૭ સુધી એટલે કે બે દાયકા કરતાં પણ વધુ સમય સુધી બીએમસી પર રાજ કર્યું હતું.

આ ચૂંટણી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમનાં પક્ષ શિવ સેના (યુબીટી) માટે લિટમસ ટૅસ્ટ હશે.

રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ દિનેશ વાઘમારેએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. ''મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, દરેક વોર્ડમાં એક સભ્યનો વોર્ડ હોય છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે, દરેક મતદાતાએ ફક્ત એક મત આપવાનો હોય છે. જ્યારે, ૨૮ મ્યુનિસિપલ કોર્પોરેશનો બહુ-સભ્ય છે. મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં, એક વોર્ડમાં ૪ ઉમેદવારો ચૂંટવાના હોય છે. તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, કેટલાક વોર્ડ એવા છે જ્યાં ૩ ઉમેદવારો હશે, કેટલાક વોર્ડમાં પાંચ ઉમેદવારો હશે. તેથી, આ ૨૮ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાતાઓએ સામાન્ય રીતે ત્રણથી પાંચ મત આપવા પડશે,'' વાઘમારેએ માહિતી આપી હતી.

વધુ માહિતી આપતા દિનેશ વાઘમારેએ જણાવ્યું કે, ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માટે નોમિનેશન ફોર્મ સ્વીકારવાનો સમયગાળો ૨૩ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધીનો રહેશે. આ નોમિનેશન ફોર્મની ચકાસણી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ બીજી જાન્યુઆરી ૨૦૨૬ રહેશે. જ્યારે ચૂંટણી ચિન્હની ફાળવણી અને અંતિમ ઉમેદવારોની યાદી ૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જાહેર થશે.(એજન્સી)

કિંજલ દવે

મુદ્દે 'મુંબઈ સમાચાર'ની ટીમે ઔદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ અને આગેવાન સાથે ખાસ વાતચીત કરી હતી.

કિંજલ દવેની સગાઈના વિવાદ મામલે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂરાલાલ રાજગોરે કહ્યું હતું કે, ''દરેક સમાજનું પોતાનું એક બંધારણ હોય છે અને દરેક સમાજની એક મર્યાદા હોય છે. જો સમાજનું ગૌરવ અને જેને અમે સેલિબ્રિટીઝ માનતા હોય તેઓ જ સમાજના બંધારણની ઉપરવટ જશે તો સમાજ વિખેરાઈ જશે. મારા મતે સમાજનો આ નિર્ણય આવકારદાયક છે. એટલું જ નહીં, કિંજલ દવે દ્વારા લગાવવામાં આવેલા 'અસામાજિક તત્વો'ના આક્ષેપ પર ભૂરાલાલે કહ્યું કે, ''આ નિર્ણય કોઈ અસામાજિક તત્ત્વોએ નથી લીધો.

આ નિર્ણય કોઈ એક વ્યક્તિનો નથી, પરંતુ વડીલો દ્વારા સમાજની સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે. કિંજલ દવે એક સેલિબ્રિટી છે, અને જો સમાજની જાણીતી વ્યક્તિ જ બંધારણ વિરુદ્ધ કામ કરશે તો સમાજની બીજી દીકરીઓ પણ તેમાંથી શીખ લઈ બંધારણની ઉપરવટ જશે. આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ મને લાગી રહ્યું છે. મારું એવું પણ માનવું છે કે જો તમે કોઈ સમાજનું ગૌરવ હોવ, તો થોડો ભોગ આપીને પણ બંધારણને વળગી રહેવું જોઈએ જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય.''

'મુંબઈ સમાચાર'ની ટીમ સાથે વાત કરતા પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજના આગેવાન સિદ્ધરાજ જોષીએ જણાવ્યું કે, ''હું કિંજલ દવેની વાત સાથે સહમત નથી અને તેની વાતોને વખોડું છું. અમે જે કંઈ પણ નિર્ણય લીધો છે તે સમાજના હિતમાં છે. સમાજના સભ્યોએ તેમના ઘરે જઈને કોઈ તોડફોડ કરી નથી, તો પછી તે કઈ રીતે અમને અસામાજિક તત્ત્વો કહી શકે? આ નિર્ણય સમાજનું બંધારણ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે અને તે આવકાર્ય છે. આ પહેલીવાર નથી કે અમે કોઈ પરિવારનો બહિષ્કાર કર્યો હોય, આ અગાઉ પણ આંતરજ્ઞાતીય લગ્ન મામલે અમે બે-ત્રણ પરિવારોનો બહિષ્કાર કર્યો છે.'' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ''જે રીતે કિંજલબેનનો નિર્ણય તેમની રીતે સાચો છે, તે જ રીતે સમાજનું બંધારણ ટકાવી રાખવા માટે સમાજનો નિર્ણય પણ સાચો છે. દેશના બંધારણ અને સમાજના બંધારણમાં રાત-દિવસનું અંતર હોય છે. સમાજનું બંધારણ સીમિત હોય છે અને દરેક સમાજના પોતાના નિયમો હોય જ છે. જ્યારે પણ લોકો સમાજના નિયમો તોડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેની સામે કડક પગલાં લેવા જ પડે છે.

આ અગાઉ કિંજલની સગાઈ 'સાટા પદ્ધતિ' મુજબ નક્કી થઈ હતી. ભાઈનાં લગ્ન તૂટ્યાં બાદ કિંજલે પોતાના જ સમાજના યુવાન સાથે સગાઈ તોડવાની શું જરૂર હતી? સમાજના રોષનું મુખ્ય કારણ એ જ છે કે સમાજના યુવાન સાથે સગાઈ તોડીને આંતરજ્ઞાતીય સગાઈ કેમ કરી?

સિંગર કિંજલ દવેએ એક વીડિયો શેર કરી પોતાનાં લગ્નના થઈ રહેલા વિરોધ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેણે સમાજની દીકરીઓની પાંખો કાપનારા અને આ રીતે વિરોધ કરનારાઓને અસામાજિક તત્ત્વો કહ્યા હતા. આ સાથે આ રીતે તેમના કે તેમના પરિવાર વિરુદ્ધ હવે પછી ખોટી ટીપ્પણીઓ કરવામા આવશે તો કાનૂની પગલા લેવાની ચીમકી પણ આપી હતી.

નિકાસ ૧૯.૩૭

થઈ. મહિના દરમિયાન ક્રૂડ ઓઇલની આયાત પણ ૧૧.૨૭ ટકા ઘટીને ૧૪.૧૧ અબજ ડોલર થઈ હતી.

આયાતમાં ઘટાડાથી નવેમ્બરમાં દેશની વેપાર ખાધ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) ઘટાડવામાં પણ મદદ મળી. આ વર્ષે જૂનમાં અગાઉનો સૌથી નીચો અંક ૧૮.૭૮ અબજ ડોલર હતો.

ઓક્ટોબરમાં વેપાર ખાધ ૪૧.૬૮ અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ રહી હતી.

એપ્રિલ-નવેમ્બર દરમિયાન કુલ નિકાસ ૨.૬૨ ટકા વધીને ૨૯૨.૦૭ અબજ ડોલર થઈ હતી, જ્યારે આઠ મહિના દરમિયાન આયાત ૫.૫૯ ટકા વધીને ૫૧૫.૨૧ અબજ ડોલર થઈ હતી. ખાધ ૨૨૩.૧૪ અબજ ડોલર થઈ હતી.

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે નવેમ્બરમાં આઉટબાઉન્ડ શિપમેન્ટ આ વર્ષે ઓક્ટોબરમાં થયેલા નુકસાનને સરભર કરે છે. નિકાસ માટે નવેમ્બર સારો મહિનો રહ્યો છે.''

તેમણે ઉમેર્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ, રસાયણો, જેમ્સ અને જ્વેલરી જેવા ક્ષેત્રોએ દેશના વેપારી માલના શિપમેન્ટને આગળ વધારવામાં મદદ કરી હતી.

પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પણ નવેમ્બરમાં ૧૧.૬૫ ટકા વધીને ૩.૯૩ અબજ ડોલર થઈ હતી. અન્ય કોમોડિટીઝમાં જે ચીજવસ્તુઓમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી તેમાં ચા, કોફી, આયર્ન ઓર, કાજુ, તેલ ભોજન, ડેરી, હસ્તકલા, દરિયાઈ ઉત્પાદનો અને ચામડાની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

જોકે, ચોખા, તેલ બીજ, કાર્પેટ અને પ્લાસ્ટિકના શિપમેન્ટમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.

દિલ્હીમાં

આર્જેન્ટિનાના ફૂટબોલના મહાન ખેલાડી લિયનેલ મેસ્સી તેના પ્રવાસના છેલ્લા તબક્કા માટે દિલ્હી આવવાનો હતો, પરંતુ તેની ફ્લાઈટ કલાકો મોડી હતી. તેને દિલ્હીમાં સવારના ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું હતું, પરંતુ તે બપોરના બે વાગ્યા પછી પહોંચ્યો હતો. રાજધાનીના પ્રદૂષણ માપનારા બધા સ્ટેશને સોમવારે બપોર બે વાગ્યે એક્યુઆઈ ૪૦૦થી વધારે નોંધ્યો હતો. સિંગાપોર હાઈ કમિશને એક્સ પર મૂકેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે ૧૩ ડિસેમ્બર,૨૦૨૫એ ઈન્ડિયન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દિલ્હી નેશનલ કેપિટલ રીજનમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)નો ચોથો એટલે કે સર્વોચ્ચ તબક્કો અમલમાં મૂક્યો હતો. આ તબક્કામાં બાંધકામ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ પર મોટો અંકુશ મુકવામાં આવે છે અને સ્કૂલ અને ઑફિસોને હાઈબ્રિડ ફોર્મેટ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. દિલ્હી સરકારે બાળકો અને શ્વાસ કે હૃદયની બીમારી ધરાવનારાને ઘરે જ રહેવાની અને બહાર નીકળે તો માસ્ક પહેરવાની સલાહ આપી છે. સિંગાપુરના નાગરિક આ સલાહને માને. આ સાથે ફ્લાઈટ પર પણ આની અસર થશે. મુસાફરોએ હવાઈમથકે આવતા પહેલા એરલાઈનમાં અપડેટ ચેક કરવા.

દરમિયાન દિલ્હી હવાઈમથકે બોપેર બે વાગ્યે જાહેરાત કરી હતી કે હવે દૃષ્ટિગોચરતા સુધરી રહી છે અને ફ્લાઈટ ઑપરેશન સામાન્ય થશે.

'મનરેગા'નું

ખરડાની જોગવાઈઓમાં ગ્રામીણ વિસ્તારના પ્રત્યેક પરિવારના બિનકાર્યકુશળ સભ્યને દર વરસે ૧૨૫ દિવસના રોજગારની બાંયધરી આપવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઑફ રુરલ ડેવલપમેન્ટ ઍન્ડ પંચાયતી રાજના અધ્યક્ષ અને કૉંગ્રેસના સાંસદ સપ્તગીરી ઉલાકાએ કહ્યું હતું કે પેનલે 'મનરેગા' યોજના અંતર્ગત કામના દિવસો વધારીને ૧૫૦ કરવાનો તેમ જ વળતર વધારવા સહિત અનેક ભલામણો કરી હતી, પરંતુ ભાજપ સત્તા પર આવ્યો ત્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઈરાદો 'મનરેગા' યોજના બંધ કરી દેવાનો જ રહ્યો છે.

'બાપુ'ના નામ સાથે ભાજપને શું સમસ્યા છે? એ જ અમને નથી સમજાતું. ભાજપ 'મનરેગા'ને ખતમ કરવા માગે છે કેમ કે એ કૉંગ્રેસની યોજના છે.

ભાજપ ખરડો લાવ્યો છે, પરંતુ શા માટે તે મહાત્મા ગાંધીનું નામ હટાવવા માગે છે? એવો સવાલ તેમણે કર્યો હતો. (એજન્સી)

નીતીશનું

ખોરવાઈ ગયું છે? કે પછી નીતીશ બાબુ હવે સંપૂર્ણપણે સંઘના થઈ ગયા છે? નીતીશકુમાર પર આક્રમક પ્રહાર કરી કૉંગ્રેસે તેમનાં આ કૃત્યને ઘૃણાસ્પદ લેખાવ્યું હતું અને તેમનાં તાત્કાલિક રાજીનામાની માગણી કરી હતી. આ શરમજનક ઘટનાને નિહાળો. એક મહિલા ડૉક્ટર નિમણૂકપત્ર લેવા આવે છે ત્યારે મુખ્ય પ્રધાન તેનો બુરખો ખેંચી કાઢે છે એમ જણાવતાં કૉંગ્રેસે કહ્યું હતું કે જો રાજ્યનો સર્વોચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ જ જાહેરમાં આ પ્રમાણે વર્તન કરતી હોય તો પછી રાજ્યમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તેની કલ્પના લોકો કરી શકે છે. આ વાંધાજનક કૃત્ય બદલ નીતીશકમારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ એમ જણાવતાં કૉંગ્રેસે કહ્યું હતું કે આ પ્રકારનું ગેરવર્તન માફીને પાત્ર નથી. ૬૮૫ આયુર્વેદિક, ૩૯૩ હોમિયોપેથિક અને ૨૦૫ યુનાની પ્રેક્ટિશનર સહિત ૧,૨૮૩ આયૂષ ડૉક્ટરને નિમણૂકપત્ર આપવા સંબંધિત આ કાર્યક્રમ હતો. (એજન્સી)

પક્ષના

સ્તરના કાર્યકર્તાઓને પણ મોટા હોદ્દા સુધી પહોંચવાની તક આપે છે. તેમણે પક્ષના કાર્યકર્તાઓને સંગઠનને મજબૂત બનાવવા ધીરજપૂર્વક કામ કરવાની વિનંતી કરી હતી. નબિનની રવિવારે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. (એજન્સી)

નીતિન નબીને

ગુપ્તા અને ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ હાજર રહ્યા હતા. નબીને કાર્યભાર સંભાળ્યો ત્યારે ગુપ્તા અને તેમના પ્રધાનમંડળના સાથીદારો પક્ષના વડા મથકમાં હાજર હતા. ૪૫ વર્ષના નબીન બિહારની નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ સરકારમાં પ્રધાન છે. નબીન અંતે રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાનું સ્થાન લેશે. આ સંસ્થામાં નવી પેઢીનું વચસ્ર્વ સ્થપાશે. નબીન ભાજપના દિવગંત નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નબીન કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે. તેમની પાર્શ્વભૂમિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. (એજન્સી)

હે, ધનકુબેરો

મુખ્ય ન્યાયમૂર્તિએ મૌખિક રીતે એવું નિરીક્ષણ કર્યું હતું કે તેઓ શું કરે છે. મંદિર બપોરના બાર વાગ્યે બંધ થયા છે પરંતુ ભગવાનને એક સેકન્ડ માટે પણ આરામ દેવામાં આવતો નથી. કહેવાતા સમૃદ્ધ લોકો જંગી રકમ આપીને ખાસ પૂજા કરે છે. દૂવાને કહ્યું હતું કે યોર લોર્ડશિપ, અદાલત મહત્ત્વનો મુદ્દો ઉઠાવી રહી છે. સમય અતિશય પવિત્ર છે અને તેને જાળવવો જોઈએ. (એજન્સી)

અમદાવાદના થલતેજની ઈમારત માટે મનપાની ₹ ૧૦૩ કરોડની એફએસઆઈ ડીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ શહેરમાં પણ મુંબઈ જેવી આકાશને આંબતી ઈમારતો બનવા જઈ રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં થલતેજમાં ૩૮ માળીય ઈમારત ઊભી કરવા વધારાની ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) મંજૂર કરી હતી. આ માટે બિલ્ડરે રૂ. ૧૦૩.૫૦ કરોડ મનપાને ચૂકવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. મનપાને અગાઉ એક પ્રોજેક્ટ માટે આટલી મોટી રકમ મળી નથી. આનું કારણ જંત્રીના વધી ગયેલા દર સાથે ઊંચી ઈમારતો માટેનું અનુકૂળ વાતાવરણ ગણવામાં આવે છે. આ સાથે આ પ્રકારના પ્રોજેક્ટ અમદાવાદમાં લક્ઝરી હોમ્સના ટ્રેન્ડનો પણ પુરાવો આપે છે. તાજેતરમાં જ પાલિકાએ આ પ્રોજેક્ટના પ્લાનને મંજૂરી આપી હતી. ૯,૯૫૮ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં કુલ ૫૩,૬૮૩.૧૯ ચોરસ મીટર એફએસઆઈનો ઉપયોગ થશે. આમાંથી ૪.૨ એફએસઆઈ ચાર્જેબલ એફએસઆઈ તરીકે ખરીદવામાં આવ્યો છે, જે ૧.૨ ની માન્ય એફએસઆઈ કરતા વધારે છે. રાજ્ય સરકારનાં ધોરણો મુજબ ઊંચી ઇમારતો માટે કુલ ૫.૪ એફએસઆઈને માન્યતા આપે છે.

મનપાના અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડરે વધારાની એફએસઆઈ માટે હાલના જંત્રી દરના ૪૦ ટકા ચૂકવવાના હતા. આ પ્લોટ માટે જંત્રી-લિંક્ડ એફએસઆઈ દર રૂ. ૬૨,૦૦૦ પ્રતિ ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો, રૂ. ૪૧,૭૩૪ પ્રતિ ચોરસ મીટર ચાર્જેબલ એફએસઆઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. થલતેજ વિસ્તારના જંત્રી દર પ્રમાણે કુલ રૂ. ૧૦૩ કરોડ આપવાના રહે છે. જેમાંથી રૂ. ૨૫ કરોડ મનપાએ જમા કરાવ્યા હતા અને રૂ. ૭૮.૫૦ કરોડ નિયમ અનુસાર ઈન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે, તેવી માહિતી એક અહેવાલ દ્વારા મળી હતી.

મનપાએ મંજૂર કરેલા પ્લાન અનુસાર આ પ્રોજેક્ટમાં ચાર રેસિડેન્શિયલ ટાવર હશે. જેમાં બ્લોક એ અને બીના ૩૮ માળ હશે, જ્યારે બ્લોક સી અને ડીમાં ૩૩ માળ હશે. બ્લોક એ અને બીની ઊંચાઈ ૧૨૭.૭ મીટર મંજૂર કરવામાં આવી છે, જ્યારે બ્લોક સી અને ડી ૧૧૧.૪૫ મીટર ઊંચા હશે. આ પ્રોજેક્ટમાં ત્રણ બેઝમેન્ટ લેવલ, ૨,૪૯૦.૯૪ ચોરસ મીટરનો ગ્રાઉન્ડ કવરેજ અને ૧,૭૬૪.૦૫ ચોરસ મીટરનો કોમન પ્લોટ એરિયા હશે. કુલ ૨૫૦ રેસિડેન્શિયલ યુનિટસ હશે, જેનો કુલ બિલ્ટ-અપ એરિયા ૧,૦૭,૨૫૫.૩૩ ચોરસ મીટર રહેશે, તેમ અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું. મનપાના ડેટા દર્શાવે છે કે મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં શહેરની હદમાં ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ૩૦ ઇમારતોના પ્રોજેક્ટને મંજૂર કર્યા છે.

દેશમાં હિંદુઓની ઘટતી વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું સ્ફોટક નિવેદન

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ મહેસાણાના કડીના બુડાસણમાં આવેલા ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સામાન્ય સભામાં હાજર રહ્યા હતા. આ અવસરે તેઓ પ્રાસંગિક સંબોધન કરતાં હિંદુ રાષ્ટ્રમાં હિંદુઓના ધર્માંતરણ માટે મિશનરીનું મિશન અને ઘટતી જતી હિન્દુની વસ્તી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સેવા-શિક્ષણના માધ્યમથી ધર્માંતરણ સામે લડવા હુંકાર કર્યો હતો.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલમાં ઉપસ્થિત લોકોને સંબોધતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫-૩૦-૪૦ વર્ષથી આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, મુસલમાનોની પણ સંખ્યા વધતી જાય છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને એકસાથે જોડવાની જરૂર નથી. એક આતંકવાદીઓનો પક્ષદળ છે. દેશદ્રોહીઓનો પક્ષદળ છે, હિંસક લોકોનો પક્ષદળ છે. અને એક ફોસલાવી ફોસલાવી અને હાથ ફેરવી ફેરવીને પટાવીને ધર્મપિવર્તન કરાવે છે. બંનેનું લક્ષ્ય હિંદુઓને ઓછા કરવા અને હિંદુ ધર્મ ઉપર વર્ચસ્વ જમાવવનું લક્ષ્ય છે. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી ધર્મપરિવર્તનનું કામ કરાવે છે. કપડા આપે, ભણાવે, દવાખાના ખોલે, હોસ્ટેલો ખોલીને લાલચ આપે છે. અને પેલા લોકો એમની હિંસક રીતે ધર્મપરિવર્તન કરાવે છે, આ બે પરિબળો સામે આપણે લડવાનું છે. બંનેની સામે લડવાની પદ્ધતિ જુદી જુદી હોઈ શકે. એકની સામે તેના જેવું જ સેવાકીય કામ કરીને આપણા લોકોને જાળવવા પડશે. આ સભામાં નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 'ભણેલો હોય તેને ખબર પડે કે બીપી છે તો તેને રાતે ઊંઘ ના આવે જ્યારે મજૂરી કરીને ઘસઘસાટ સૂઈ જતો હોય તેને બીપીની ચિંતા નહીં અને કશાની ચિંતા નહીં. પણ ખબર પડે એટલે આપણને ચિંતા થાય. એ જ રીતે અત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને સંઘ મારફતે ખબર પડી છે કે, છેલ્લા ૨૫, ૩૦, ૪૦ વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ જે ચિંતાજનક છે.'

ઈવીનું વેચાણ ઘટતા ગુજરાત સરકાર સબસિડી પાછી લાવે તેવી શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સ (ઈવી)ને પ્રોત્સાહન આપવા સરકારે ખાસ સબ્સિડી જાહેર કરી હતી, પરંતુ લોકોએ ઈવી ખરીદવામાં ખાસ રસ દાખવ્યો ન હોવાથી સરકારે આ સબ્સિડી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતમાં ઓટોમોબાઈલ્સનું વેચાણ રાષ્ટ્રીય સરેરાશ વેચાણ કરતા વધારે થયું છે, પરંતુ ઈવીના વેચાણમાં ૨૨ ટકાનો ઘટાડો નોંધાયો હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા હતા. આ આંકડાઓએ સરકારને તેમની હાલની પૉલિસી અંગે વિચારવાની ફરજ પાડી છે.

એપ્રિલ મહિનામાં સરકારે ઈવી માટેનો રોડ ટેક્સ છ ટકામાંથી એક ટકો કર્યો હતો. જેના લીધે વાહનચાલકને રૂ. ૩૦,૦૦૦થી એક લાખ સુધીનો સીધો ફાયદો થતો હતો, તેમ છતાં લોકોએ ખાસ ઉત્સાહ બતાવ્યો ન હતો.

એક અધિકારીના જણાવ્યા અનુસાર કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે, તેથી હવાની ગુણવત્તા રાજ્ય સરકાર માટે એક મહત્ત્વનો મુદ્દો છે. રાજ્યમાં પ્રદૂષણનો મુદ્દો ગંભીર બનતો જાય છે. સરકાર માટે ચાર વર્ષમાં અમદાવાદને પોલ્યુશન ફ્રી કરવું જરૂરી છે. આથી નવી ઈવી પૉલિસીમાં વધારે સારી સબ્સિડી ઓફર કરવામાં આવે, તેવી શક્યતા અધિકારીએ દર્શાવી હતી. સરકાર લગભગ આવતા વર્ષની માર્ચ મહિનામાં નવી પોલિસી લાવે તેવી શક્યતા છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

બુલેટ ટ્રેનનું ધ્વનિ પ્રદૂષણ રોકવા ચાર લાખ નોઈઝ બેરિયર્સ લગાવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં રોજેરોજ પ્રગતિ થઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ૫૦૮ કિમી લાંબા કોરિડોર પર મોટાભાગનું માળખાકીય અને ટેકનિકલ કામ નવ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ ગયુ છે.

પ્રોજેક્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૩૩૦ કિમીથી વધુ વાયડક્ટનું બાંધકામ પૂરું થયું છે, જ્યારે ૪૦૮ કિમીથી વધુ રૂટ પર પિયરનું કામ પૂરું થયું છે. પુલનું બાંધકામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. નદી પર બાંધવાના ૨૫ બ્રિજમાંથી ૧૭ બ્રિજનું કામ પૂરું થઈ ગયું હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે નેશનલ હાઈ વે ૬૪ અને ભારતીય રેલવેની ભરૂચ-દહેજ ફ્રેઇટ લાઇન પર ૨૩૦ મીટર લાંબા સ્ટીલ પુલના પ્રથમ ૧૩૦ મીટરના સ્પાનનું કામ પૂરું થયું છે. વધુમાં લગભગ ૨૬૦ ટ્રેક કિમી માટે રિઇનફોર્સ્ડ કોંક્રીટ ટ્રેક બેડનું બાંધકામ પૂર્ણ થયું છે.

આ સાથે અધિકારીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કોરિડોરમાં ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે અત્યાર સુધીમાં ૪.૭ લાખથી વધુ નોઈઝ બેરિયર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. કુલ ૨૩૫ કિમીના કોરિડોરમાં ૪.૭ લાખ કરતા વધારે નોઈઝ બેરિયર્સ લગાડવામાં આવ્યાં છે. અધિકારીના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રિફિકેશનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. જેમાં લગભગ ૮૫ કિમી રૂટ પર લગભગ ૩,૭૦૦ ઓવરહેડ ઇલેક્ટ્રિક માસ્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ટનલનું બાંધકામ પણ ચાલી રહ્યું છે, જેમાં સાત માઉન્ટેન ટનલનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે ૨૧ કિમી લાંબી ભૂગર્ભ ટનલમાંથી ૫ કિમીનું ખોદકામ અત્યાર સુધીમાં પૂરું થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ બુલેટ ટ્રેન સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

રાજ્યના ચાર જિલ્લામાં એક તૃત્યાંશ મૃત મતદારો, ડાંગમાં સૌથી ઓછા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં કુલ મૃત મતદારના એક તૃત્યાંશ મૃત મતદાર ચાર જિલ્લામાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ચાર જિલ્લામાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન સૌથી ઓછા મતદાર મૃત હોવાનું બહાર આવ્યું હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.

૭, ૩૯૪,૦૦૦ મતદારની યાદી ડ્રાફ્ટ લિસ્ટમાં નથી, આ તમામ મતદાર હયાત ન હોવાનું બહાર આવ્યું હતું. વર્ષ ૨૦૨૫ની મતદાર યાદીમાં પણ કુલ ૧,૮૦૫,૦૦૦ મૃત હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર ગામડાઓમાં તલાટી અથવા સરપંચને મૃતકો વિશે માહિતી હોવાથી તેમનું કામ સરળ બન્યું હતું, પરંતુ શહેરી વિસ્તારોમાં બૂથ લેવલ ઓફિસર માટે મૃત મતદાર વિશેની માહિતી મેળવવાનું અઘરું સાબિત થયું હતું. આથી હવે સ્મશાનગૃહો સાથે ડેટાનો તાલમેલ બેસાડવામાં આવી રહ્યો છે. હાલમાં મૃતકની આધાર પરની માહિતી અનુસાર મતદાર યાદીમાં માહિતી લેવામાં આવી છે અને સતત તેમાં ફેરફાર કરવામાં આવતા રહેશે.

સત્તાવાર માહિતી અનુસાર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લામાં ૬,૩૬,૦૦૦ મતદારોને મતદાર યાદીમાં મૃતક તરીકે ઓળખવામાં આવ્યા હતા.

રાજ્યમાં ખનીજ ચોરોની હવે ખેર નથીઃ ખનીજ લઈ જતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં ખનીજ માફિયા દ્વારા થતી ખનીજ ચોરીને અટકાવવા માટે રાજ્યના જીઓલોજી અને માઇનિંગ વિભાગના કમિશનર ધવલ પટેલે રાજ્યમાં ખનીજ પરિવહન માટે નવો પરિપત્ર અમલી બનાવ્યો છે. રાજ્યભરમાં ૧૫ ડિસેમ્બરથી અમલી બનેલા આ પરિપત્ર અન્વયે ખનીજ પરિવહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે.

રાજ્યભરમાં ખનીજ માફિયાઓ પર લગામ કસવા માટે આકરા નિયમો લાદવામાં આવ્યાં છે. હવે ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરાઇ છે. જો ટ્રેકિંગ સિસ્ટમમાં છેડછાડ થશે તો રોયલ્ટી બંધ કરી દેવાશે. આ ઉપરાંત જો રોયલ્ટી ધારણ જીપીએસ સિસ્ટમ બંધ કરી વાહનને અન્યત્ર રૂટ પણ ડાઇવર્ટ કરશે તો પણ તેમની રોયલ્ટી બંધ થઇ જશે. આ સાથે આકરા દંડની પણ જોગવાઇ કરાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, લીઝ-રોયલ્ટી ધારકો જીપીએસમાં છેડછાડ કરતા હોવાથી આકરા નિયમો લદાયા છે. વીટીએમએસ સિસ્ટમથી મોનિટરિંગ કરવામાં આવશે.

ખનીજ ચોરી પર બ્રેક લગાવવા માટે બધા જ જિલ્લામાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વૉડની ટીમો સતત મોનિટરિંગ કરશે. ઉપરાંત રાજ્યમાં રોયલ્ટી સાથે કાયદેસર ખનીજ પરિવહન કરતા તમામ વાહનો માટે જીપીએસ સિસ્ટમ લાગુ કરી દેવાઇ છે. આ સિસ્ટમ ચાલુ રાખવાનો નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, પહેલાથી રાજ્યમાં વીટીએમએસ સિસ્ટમ એટલે કે, વ્હિકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ અમલી હોવા છતાં મોટાભાગના વાહનો ખનીજ પરિવહન દરમિયાન તેમના માન્ય જીપીએસ ઉપકરણો બંધ કરી દેતા હોવાનો તપાસમાં ખુલાસો થતાં નવા નિયમને વધુ કડક બનાવી દેવામાં આવ્યાં છે.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે પોતાને હસ્તક લીધો, વિદ્યાર્થીની હત્યાને પગલે નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો છે. સેવન્થ-ડે સ્કૂલને સરકારે પોતાને હસ્તક લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેવન્થ ડે શાળામાં ૧૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કથિત રીતે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને ધારદાર હથિયારથી ઘા મારવાના કારણે ખળભળાટ મચી ગયો હતો.

સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા હતા કે, તેઓએ બેદરકારી દાખવી હતી. તેમણે ઘટનાની જાણ ન કરી અને પહેલાની બુલિંગની ફરિયાદો અવગણી હતી. આનાથી રોષ ફેલાયો હતો અને વાલીઓ તથા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ મામલે રોષે ભરાયેલા વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ હતી અને મણિનગર-ખોખરા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.

ત્યાર બાદ સ્કૂલ અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સ્કૂલ ગેરકાયદે ઉભી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવા માટે શિક્ષણ વિભાગને પત્ર પણ લખી દેવાયો હતો. ડીઈઓના પત્રના પગલે સરકારે શાળાનો વહીવટી પોતાને હસ્તક લેવાનો નિર્ણય કર્યો હતો.

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભરશિયાળે કેસર કેરીનું આગમનઃ રેકોર્ડ ભાવે હરાજી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ફળોના રાજા કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ભરશિયાળે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ ઘટના ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વખત બની છે, જેનાથી ખેડૂતો, વેપારીઓ અને કેરીપ્રેમીઓમાં આશ્ચર્ય અને ઉત્સાહનો માહોલ છવાયો છે. સામાન્ય રીતે કેરીની સીઝન માર્ચ-એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં થયેલા ફેરફારને કારણે આંબા પર પાંચ મહિના વહેલા કેરી આવી ગઈ છે.

મળતી વિગત મુજબ, પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામના ખેડૂતના બગીચામાંથી આવેલી આ કેસર કેરીનું એક બોક્સ (આશરે ૧૦ કિલો) સુદામા ફ્રૂટ કંપની ખાતે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યું હતું. જો કે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ એક બોક્સ કેસર કેરીની હરાજી રૂ. ૧૨,૫૧૦ના ઊંચા ભાવે થઈ હતી. એટલે કે પ્રતિ કિલો કેરીનો ભાવ રૂ. ૧,૨૫૧ રહ્યો, જે ઐતિહાસિક છે. હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ આનંદ વ્યક્ત કરતાં પેંડા વહેંચીને મોઢું મીઠું કરાવ્યું હતું.

વડોદરા પાસે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ વડોદરા શહેર નજીક વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે મોત થયાં હતાં. અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા બાઈકસવારને ગંભીર ઈજા પહોંચતા સયાજી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં રહેતા દિલીપભાઈ અને ગંભીરભાઈ બંને સરદાર એસ્ટેટ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વાઘોડિયા બ્રિજ પર અજાણ્યા વાહને તેમના બાઈકને ટક્કર મારી હતી. જેથી તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જોકે, દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બનતાની સાથે જ સ્થળ પર લોકોની ભારે ટોળાં એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

સ્વેપ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત મોખરે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ બદલતી જીવનશૈલીને કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસ પણ વધી રહ્યા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને ઘણો સમય લાગે છે. ડોનરની કિડની મેચ કરવાની પ્રક્રિયામાં લાગતા લાંબા સમયગાળા અને અન્ય સમસ્યઓને લીધે ગુજરાતે એક પ્રમાણમાં સરળ રસ્તો શોધી કાઢ્યો હતો. ઈન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા કુલ ૩૦૨ જીવંત કિડનીડોનર ટ્રાન્સપ્લાન્ટમાંથી ૮૬ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. સ્વેપ ડોનર્સ પ્રોસિઝરમાં બે કિડનીના દરદીઓના ડોનરને એકબીજા માટે કિડની દાન કરવાનું કહેવામાં આવે છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે દર્દીઓ અને દાતાઓની પ્રોફાઇલ સોફ્ટવેરમાં દાખલ કરવામાં આવે છે. લોકોની સંમતિ પ્રાપ્ત થયા પછી, સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવે છે. હાલમાં ૮૬ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે અને હજુ પાંચ આ રીતે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ વાતની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

રાજસ્થાનના ઉદેપુરમાં અકસ્માતમાં ત્રણ ગુજરાતી યુવકનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ રાજસ્થાનના ઉદેપુરમાં સર્જાયેલી ભીષણ રોડ દુર્ઘટનામાં ત્રણ ગુજરાતી યુવકનાં મૃત્યુ થયા છે. ઉજ્જૈન દર્શન માટે જઈ રહેલા વાવ-થરાદ વિસ્તારના ભાભર તાલુકાના ઠાકોર સમાજના ત્રણ યુવાન સહિત કુલ ચાર લોકોનાં મોત થતા સમગ્ર પંથકમાં ઠાકોર સમાજ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ટ્રકના ડાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાભર તાલુકાના ત્રણ યુવાને જીવ ગુમાવ્યો હતો. ત્રણ યુવાનમાં મેરા ગામના અરવિંદજી ઠાકોર, અબાસણા ગામના વિક્રમજી ઠાકોર, ભીમબોરડી ગામના પ્રકાશજી ઠાકોરનું મૃત્યુ થયું હતું.

મળતી વિગતો અનુસાર, રાજસ્થાનના ઉદેપુર-ઉજ્જૈન હાઈવે પર પિંડવાડા નજીક એકસાથે ચારથી વધુ વાહન વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. એક પથ્થરો ભરીને જઈ રહેલા ટ્રકે અચાનક કાબૂ ગુમાવતાં અન્ય ટ્રક સહિત કુલ છ વાહન એકબીજા સાથે અથડાયા હતા, જેમાં એક ફોર્ચ્યુનર ગાડી પર માર્બલનો બ્લોક પડતાં આ દર્દનાક દુર્ઘટના બની હતી, જેમાં ત્રણ ગુજરાતી યુવક સહિત ચારનાં મોત થયા હતા, જ્યારે અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતને કારણે ઉદયપુર-પિંડવારા હાઇવે પર લગભગ બે કલાક સુધી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ફોર્ચ્યુનર પલટી ગઈ હતી અને ઘાયલોને બચાવવામાં સૌથી વધુ સમય લાગ્યો હતો.

અકસ્માતની જાણ થતાં જ મૃતકના પરિવારજનો તાત્કાલિક ઉદયપુર પહોંચ્યા હતા. મૃતદેહોને તેમના વતન, ભાભર તાલુકામાં લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ભાવનગરના અલંગ, મણારમાં દબાણ રોકવા તળાજા મામલતદાર કચેરીએ લોકોનાં ધરણાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ભાવનગરના તળાજાના અલંગ, મણાર સહિતના વિસ્તારોમાંથી દબાણ હટાવવા માટે પ્રશાસને તૈયારી કરી લીધી છે. આગામી બે દિવસમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. એ પહેલા ૧૫ ડિસેમ્બર અલંગ, મણાર સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ડિમોલિશનની કાર્યવાહીના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે રાજકીય વગ ધરાવતા લોકોને બચાવીને દબાણની કામગીરી માત્ર ગરીબ માણસો પર જ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે અલંગ, મણારના ૩થી ૪ હજાર લોકો રસ્તા પર ઊતર્યાં હતા. એટલું જ નહીં આઈસર સહિતના વાહનોમાં બેસીને પણ તળાજા પહોંચ્યા હતા.

આ તમામ વિરોધકર્તાઓ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યારે વિરોધકર્તાઓમાંથી પાંચ આગેવાને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. એ પહેલા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. લોકોની સંખ્યા વધી જતા તળાજા, અલંગ મરીન સહિતની પોલીસની ટીમના પણ ધાડે ધાડા ઊતર્યાં હતા. તળાજા તાલુકાના અલંગ સહિતના ગામોમાં ડિમોલિશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. એટલે કે સરકારી ખરાબા અને ગૌચરની જમીન ઉપર થયેલા દબાણો હટાવવા તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી છે. અહેવાલ મુજબ હાલ ૧૫૯ દબાણ હટાવવાની કામગીરી ૧૭ ડિસેમ્બરથી કરવામાં આવી શકે છે.

સી.આઇ.ડી. ક્રાઇમના ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને એસીબીએ છટકું ગોઠવી ₹ 30 લાખની લાંચ લેતા ઝડપ્યા

અમદાવાદઃ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ ૧૫ ડિસેમ્બર સોમવારે ગાંધીનગરમાં છટકું ગોઠવીને પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને ૩૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ગાંધીનગરમાં સી.આઇ.ડી. ક્રાઇમ, સી.આઇ. સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને રૂ. ૩૦ લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. એ.સી.બી. દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમણે લાંચ આપવાનો ઇનકાર કરી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદ અનુસાર, સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં કોલ સેન્ટરના એક ગુનામાં કોઈ કાર્યવાહી ન કરવા બદલ ફરિયાદી પાસે રૂ.૩૦ લાખની લાંચની માગ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે એ.સી.બી.એ ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન આરોપી આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બાબુભાઇ દેસાઇએ ફરિયાદી સાથે રૂબરૂ મુલાકાત કરી લાંચની રકમ સ્વીકારી હતી.

ભરૂચમાં ૧૨ બાંગ્લાદેશી સહિત ૧૪ મહિલાને દેહવ્યાપારમાંથી બચાવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ભરૂચ જિલ્લા પોલીસના સ્થાનિક ગુના શાખા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે એક સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલા દેહ વેપાર રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને ૧૪ મહિલાને રેસ્ક્યુ કરી હતી, જેમાં ૧૨ બાંગ્લાદેશી મહિલાનો સમાવેશ થાય છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન અને માનવ તસ્કરીમાં સંડોવાયેલા ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

ફારુક શેખ નામના બાંગ્લાદેશી એજન્ટ વિશે મળેલી માહિતી બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જે કથિત રીતે બ્યુટી પાર્લરમાં અથવા ઘરનોકર તરીકે નોકરી આપવાનું વચન આપીને મહિલાઓને લલચાવતો હતો અને પછીથી તેમને દેહ વેપારમાં ધકેલી દેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે મહિલાઓને જંબુસરમાં આરોપીઓના ઘરમાં કેદ કરી રાખવામાં આવી હતી, જ્યાંથી આ રેકેટ ચલાવવામાં આવતું હતું.

નવમા પાનાનું ચાલુ

ઉદ્ધવનો પક્ષ

હવે ઉમેદવારો શોધવા પડશે એવો દાવો શિરસાટએ કર્યો હતો.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે બોલતા શિરસાટએ જણાવ્યું હતું કે 'અમારા પક્ષ અને ભાજપ તરફથી ઘણા ઉમેદવારો છે, પરંતુ માત્ર એક જ વ્યક્તિને ઉમેદવારી મળી શકે છે.

આવી સ્થિતિમાં કેટલાક અસંતુષ્ટ લોકો પક્ષ પલટો કરી શકે છે. અમે તેમનેઅટકાવી ન શકીએ.' (પીટીઆઈ)

શિવસેના (યુબીટી)ના

હતું કે તેમણે શિવસેના (યુબીટી)માં ખંતપૂર્વક કામ કર્યું હતું અને હવે નવા પક્ષમાં વધુ મહેનત કરશે. પક્ષ દ્વારા જે પણ જવાબદારી સોંપાશે એ પોતે પાર પાડશે.

તપાસની ધીમી ગતિ પર નિરાશા વ્યક્ત કરી તેમણે કહ્યું કે 'મારા પતિની હત્યાની સીબીઆઈ તપાસ ધીમી ગતિએ આગળ વધી રહી છે. મને આશા છે કે તે વહેલી તકે પૂર્ણ થઈ જશે.'

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોલીસ તપાસમાં ઢીલ થતી હોવાથી બોમ્બે હાઈ કોર્ટે હત્યાની તપાસ સીબીઆઈને સોંપી હતી.

તેજસ્વી ઘોસાળકર ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી શિવસેનાનાં નગરસેવક હતાં. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)માંથી તેમણે અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું. (પીટીઆઈ)

ઓસી આપવાની જાહેરાત થઈ પણ અમલ સરકાર માટે કપરાં ચઢાણ

આ જાહેરાત ચૂંટણીલક્ષી જુમલો ન બની રહે તે માટે ત્રણ બાબતોનું ધ્યાન આપવું પડશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં વિધાનસભામાં જાહેરાત કરી હતી કે જે ઇમારતો પાસે ઓક્યુપન્સી સર્ટિફિકેટ (ઓસી) નથી, જેના કારણે તેમના રહેવાસીઓને પાણી અને પ્રોપર્ટી ટેક્સ વધેલા દરે ચૂકવવો પડે છે, તેમને ઓસી આપવામાં આવશે અને આવી ઇમારતોમાં રહેતા લોકોને રાહત મળશે. આ જાહેરાત પ્રશંસનીય છે. વળી, ચૂંટણીની પૂર્વસંધ્યાએ કરવામાં આવી હોવાથી તેનું મહત્ત્વ પણ છે. તેનો અમલ કેવી રીતે થશે, તે અંગેની ખાસ વિગતો હજી સુધી સામે આવી નથી, તેથી તેના પર ચોક્કસ ટિપ્પણી કરવી હાલ પૂરતું શક્ય નથી.

ભૂતકાળમાં નોન-ઓસી ઇમારતોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઘણા પ્રયાસો થયા છે. હવે, આ નવી જાહેરાતના અમલીકરણમાં કઈ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તેનો અંદાજ લગાવી શકાય છે. જો આ ઘોષણાના અમલ માટે સૂચનાઓ જારી કરવામાં આવશે, તો તેનો સુચારૂ રૂપે અમલ થશે, નહીં તો આ ઘોષણાને 'ચૂંટણીલક્ષી જુમલો' બનતા વાર નહીં લાગે.

અમલીકરણમાં નીચેની મુશ્કેલીઓ આવી શકે છે.

સૌથી પહેલી મુશ્કેલી એ આવે કે જે બિલ્ડર અને આર્કિટેક્ટે બાંધકામ કર્યું છે, પરંતુ ઓસી લીધા વિના જ રહેવાસીઓને કબજો આપી દીધો છે, તેવા બિલ્ડર અને આર્કિટેક્ટ શોધવા છતાં મળતા નથી. તેના કારણે, નવેસરથી અરજી કરવી, આવશ્યક દસ્તાવેજોની પૂર્તિ કરવી વગેરે માટે કોઈ વ્યક્તિ મળતી નથી.વળી, જો બીજા બિલ્ડર અને આર્કિટેક્ટને આ કામ સોંપવામાં આવે, તો પણ તેમને પહેલાના બિલ્ડરના એનઓસી અને જૂના દસ્તાવેજોની જરૂર હોય છે, જે પણ ઉપલબ્ધ હોતા નથી. આવી પરિસ્થિતિમાં, ઓસી મેળવવા માટેનો પ્રસ્તાવ તૈયાર કરવાથી જ મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. વળી, આ પ્રક્રિયામાં ઘણી ખર્ચાળ છે. ટૂંકમાં, ઓસી મેળવવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં જ મોટી મુશ્કેલી આવી શકે છે.બીજી વાત એ છે કે નોન-ઓસી બાંધકામોમાં ઘણા ગેરકાયદેસર પ્રકારો છે. તેથી, ઓસી જારી કરવી એ સરળ પ્રક્રિયા નથી. તેનો અમલ પડકારજનક છે.

મુખ્ય પ્રધાનના

કરી હતી. દરમિયાન એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના એક કેસમાં ઠક્કરની ધરપકડ કરાઈ હોવાના સમાચાર પટેલે અખબારમાં વાંચ્યા હતા. તરત જ પટેલે સાંતાક્રુઝ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

સ્માર્ટ એટીએમ

તેમનાં બૅન્ક ખાતાંમાં જમા થવાને બદલે મશીનમાં જ અટકી ગઈ હતી.

સોમવારે ખાતાધારકોની ફરિયાદ બાદ બૅન્કની મહિલા મૅનેજરે કર્મચારીની મદદથી મશીનની ચકાસણી કરી તો તેમના આશ્ચર્ય વચ્ચે મશીનમાં વધારાની કોઈ રકમ જમા ન થઈ હોવાનું જણાયું હતું. શંકા જતાં મૅનેજરે બીકેસીમાં આવેલી હેડ ઑફિસના ડિજિટલ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી હતી. ડિપાર્ટમેન્ટના નિષ્ણાતો દ્વારા ઑનલાઈન તપાસ કરવામાં આવતાં મશીનમાં કોઈ ખામી ન હોવાનું જણાયું હતું.

મશીનમાં ભરેલી રોકડ ક્યાં ગઈ તે શોધી કાઢવા એટીએમ સેન્ટરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં અને ફૂટેજને આધારે મૅનેજરે પોલીસ ફરિયાદ કરી હતી. સ્માર્ટ ચોરોએ બૅન્ક બંધ હોય એવા દિવસે જ પોતાની કારીગરી દેખાડી હોવાનું માનવામાં આવે છે, જેથી કસ્ટમર તાત્કાલિક બૅન્કમાં ફરિયાદ ન કરી શકે.

ફૂટેજમાં બે ચોર શનિવારના મળસકે ૪.૩૦ વાગ્યે એટીએમ સેન્ટરમાં આવે છે અને મશીનનું મેઈન પ્લગ કાઢતા નજરે પડે છે. પ્લગ કાઢ્યા પછી પોતાની પાસેનું એડોપ્ટર મશીનના પ્લગમાં લગાવી ફરી મશીન ચાલુ કરીને નીકળી જાય છે. રાતે ૯ વાગ્યે ફરી બન્ને આવે છે અને પોતાના મોબાઈલ ફોનમાં કંઈક કરે છે. ત્યાર બાદ તારની મદદથી કૅશ બૉક્સનું કવર જબરદસ્તી કાઢીને મશીનમાં ફસાયેલી રોકડ લઈ લે છે. પછી ફરી કવર ગોઠવીને પસાર થઈ જાય છે. આ જ રીતે ફરી રવિવારની સવારે ૧૦.૧૯ વાગ્યે આવીને રોકડ કાઢી લેતા હોવાનું ફૂટેજમાં નજરે પડે છે.

માહિમ પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર સુજિત ચાળકેએ 'મુંબઈ સમાચાર'ને જણાવ્યું હતું કે બન્ને શકમંદે રોકડ ચોરવા માટે ખરેખર તો કઈ પદ્ધતિ અપનાવી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આરોપીના પકડાયા પછી આ અંગે ખુલાસો થઈ શકશે. જોકે માહિમની શાખામાં હજુ સુધી બે જ કસ્ટમર આ રીતે રોકડ ગુમાવ્યાની ફરિયાદ કરવા આવ્યા છે. ફૂટેજને આધારે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

મહાલક્ષ્મી રેસકોર્સ

સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૂરા કરવાનું આશ્વાસન પણ મહાયુતિની સરકારે આપ્યું હતું. મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડની ખુલ્લી જગ્યા મળીને કુલ ૨૯૫ એકર આંતરારાષ્ટ્રીય દરજ્જાનો સેન્ટ્રલ પાર્ક ઊભો કરવામાં આવવાનો છે. પ્રસ્તાવિત સેન્ટ્રલ પાર્કનો પ્લાન સોમવારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. એ સમયે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ભૂષણ ગગરાણી અને આર્કિટેક્ટ હાફીઝ કૉન્ટ્રેક્ટર હાજર હતા. આ સેન્ટ્રલ પાર્ક અંડરગ્રાઉન્ડ માર્ગે સીધો કોસ્ટલ રોડ સાથે જોડવામાં આવશે. રેસકોર્સ અને તેના ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરતા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવવાનો દાવો સરકારે કર્યો છે.

મહાલક્ષ્મી રેસકોર્સ પરની ૧૨૫ એકર પર આંતરરાષ્ટ્રીય દરજ્જાનો સેન્ટ્રલ પાર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે. કોસ્ટલ રોડની ૧૭૦ એકર જગ્યા એમ કુલ ૨૯૫ એકરની જગ્યા પર ભવ્ય સેન્ટ્રલ પાર્ક તૈયાર થશે. સેન્ટ્રલ પાર્ક નીચે ૧૦ લાખ ચોરસ ફૂટનું વૈશ્વિક સ્તરનું સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ પણ વિકસાવવામાં આવવાનું છે. અહીં આંતરારાષ્ટ્રીય સ્તરની રમતો સહિત ખો-ખો, કબડ્ડી જેવી રમત-ગમત માટે પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવવાની છે. મુલાકાતીઓ અહીં પાર્કમાં વોકિંગ કરતા ઘોડાની રેસ પણ જોઈ શકશે. સેન્ટ્રલ પાર્કની જમીન પર ફૂટપાથ સિવાયનું કોઈ પણ બાંધકામ નહીં હોય. આ સંપૂર્ણ ઉદ્યાન હશે. અહીં ટ્રાફિકનું મેનેજમેન્ટ સરળતાપૂર્વક થાય તે માટે સેન્ટ્રલ પાર્ક ૧,૨૦૦ મીટર લાંબા અંડર ગ્રાઉન્ડ માર્ગે કોસ્ટલ રોડ સાથે જોડવામાં આવવાની છે. તે માટે ૫૫૦ કરોડના ટેન્ડર કાઢવામાં આવ્યા છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે આ પાર્ક માટે મેટ્રો-૩ રૂટ પરથી નેહરુ સાયન્સ સેન્ટર નજીકનું સ્ટેશન છે. આ સ્ટેશનને અંડરગ્રાઉન્ડ માર્ગે સેન્ટ્રલ પાર્ક સાથે જોડવામાં આવશે. આ અંડરગ્રાઉન્ડ રોડ ઍની બેસન્ટ રોડથી આગળ હાજી અલી સુધી જઈને પાર્કિંગને જોડવામાં આવશે, ત્યાથી તે કોસ્ટલ રોડને જોડવામાં આવશે. કોસ્ટલ રોડ અને સેન્ટ્રલ પાર્ક અંડરગ્રાઉન્ડ માર્ગે જોડાવવાથી સેન્ટ્રલ પાર્ક અને સ્પોર્ટસ કૉમ્પ્લેક્સમાં જનારી ભીડનું આયોજન કરી શકાશે. કોસ્ટલ રોડ પાર્કિંગમાં ૧,૨૦૦ ગાડી અને ૧૦૦ બસ પાર્ક કરવાની ક્ષમતા છે. આ પ્રોજેક્ટને કારણે ૩૦૦ એકરમાં ઓક્સિજન પાર્ક તૈયાર થવાનો હોવાથી મુંબઈના પ્રદૂષણમાં ઘટાડો થવામાં મદદ મળશે એવો દાવો પણ યુતિ સરકારે કર્યો હતો.

ભારતનો સૌથી ઊંચો

કરવામાં આવી હતી. પેરિસના એફિલ ટાવર (૩૦૦ મીટર ઊંચો)ની માફક જ થાણેમાં કાસારવડવલી ક્રીક પાસે ૨૬૦ મીટર ઊંચો ટાવર અને કન્વેન્શન સેન્ટર ઊભું કરવામાં આવવાનું હોવાની જાહેરાત સોમવારે નાયબ મુખ્ય પ્રધાને કરી હતી. એ સિવાય કોલશેતમાં ૨૫ એકરમાં ટાઉન પાર્ક ઊભો કરવામાં આવવાનો છે, જે બિલ્ડ-ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણ પણ બનાવવામાં આવશે. તેમ જ આગ્રી કોળી મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, એક્વેરિયમ અને સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ પણ ઊભું કરવામાં આવવાનું છે.

કોલશેતમાં ૨૫ એકર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાનું સ્નો પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક અને એડવન્ચર પાર્ક ઊભો કરવામાં આવવાનો છે. કોલશેતમાં ૧૨.૫ એકર જગ્યામાં રાજ્ય સરકાર બર્ડ મ્યુઝિયમ બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયાનું ભંડોળ આપવાની છે. થાણે પાલિકા દ્વારા મીરા-ભાઈંદર મહાપાલિકાની સીમાને લાગીને સંજય ગાંધી નેશનલ પાર્કને જોડીને ૧૮.૪ કિલોમીટર લંબાઈનો આનંદવન લીલો પટ્ટો વિકસિત કરવામાં આવવાનો છે. તેથી થાણે જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓને અત્યાધુનિક દરજ્જાની સેવા-સુવિધા ઉપલબ્ધ થશે.

કાલબાદેવીના ઝવેરી

રાજસ્થાનના ઉદયપુરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કાલબાદેવીના ૪૦ વર્ષના ઝવેરીની ફરિયાદને આધારે ટાંક વિરુદ્ધ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે ૨૦૨૩માં મુંબઈમાં યોજાયેલા ગૉલ્ડ એક્ઝિબિશનમાં એક વેપારી મિત્ર મારફત ફરિયાદીની ઓળખ ટાંક સાથે થઈ હતી. તે સમયે ટાંક સિકંદરાબાદનો મોટો વેપારી હોવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું.

ઓળખાણ થયા પછી આરોપીએ સૌપ્રથમ એપ્રિલ, ૨૦૨૩માં ફરિયાદી પાસેથી દાગીના લીધા હતા, જેની રકમ તેણે સમયસર ચૂકવી દીધી હતી. બાદમાં બે-ત્રણ મહિને આરોપી ઑર્ડર આપતો તે મુજબ ફરિયાદી દાગીના પૂરા પાડતો અને સમયાંતરે તેનું પેમેન્ટ પણ આપતો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ઑક્ટોબર, ૨૦૨૪માં આરોપી ફરિયાદીની ઑફિસે આવ્યો હતો અને અંદાજે ૨.૧૫ કરોડ રૂપિયાના દાગીના તેણે પસંદ કર્યા હતા. પસંદગી અનુસારના દાગીના ફરિયાદીએ આરોપીને આપ્યા હતા, જેની સામે આરોપીએ માત્ર ૩૮.૫૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીનાં નાણાં પછી ચૂકવવાની ખાતરી આપી હતી. વળી, એની સામે સિક્યોરિટી ચેક પણ આપ્યો હતો.

જોકે ખાસ્સા દિવસો વીત્યા છતાં આરોપીએ નાણાંની ચુકવણી કરી નહોતી. તેનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ આવતાં ફરિયાદીએ સિકંદરાબાદના એક વેપારી પાસે તપાસ કરાવી હતી. આરોપીની સિકંદરાબાદની ઑફિસને તાળું હોવાનું જાણવા મળતાં ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મુંબઈની ઈમારતો

મુંબઈવાસીને શહેરની બહાર ધકેલી કાઢવા માગે છે.' આદિત્ય ઠાકરેએ આ લોકોની સરકાર નથી અને ભાજપને બિલ્ડર જનતા પાર્ટી ગણાવી માગણી કરી હતી કે મુંબઈમાં હાઈ ફ્રિકવન્સી ડિફેન્સ રડાર તેમની આસપાસના વિસ્તારોના પુનર્વિકાસને સક્ષમ બનાવવા માટે ખસેડવા જોઈએ અને નોંધ્યું હતું કે હાલના ધોરણો વિકાસને અવરોધે છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કરવામાં આવેલી આ જાહેરાતથી હજારો ભાડૂતોને ફાયદો થવાની અપેક્ષા છે. (પીટીઆઈ)

પાલિકા ચૂંટણી

મતગણતરી થશે. ફડણવીસે કહ્યું કે મહાયુતિના ભાગીદારો વચ્ચે ગઠબંધન થશે, પરંતુ મોટાભાગના શહેરોમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થશે. પુણેમાં જ્યાં ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અગ્રણી પક્ષ છે, ત્યાં ગઠબંધનની સંભાવના નથી. મહાયુતિમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. વિસ્તૃત જાણકારી આપતા ફડણવીસે એમ પણ કહ્યું હતું કે પુણે અને પડોશી પિંપરી ચિંચવડમાં ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી વચ્ચે મૈત્રીપૂર્ણ મુકાબલો જોવા મળશે. ૩ હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયુતિ ગઠબંધન રાજ્યની મ્યુનિસિપલ ચૂંટણીમાં બહુમતી મેળવશે. (પીટીઆઈ)

થાણેમાં પાણીના

થાણેમાં પાણીની સમસ્યાને પગલે પાણીકાપ લાદવામાં આવ્યો હતો તે હવે ૧૯ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હોવાથી હજી તેમને પાણીની સમસ્યા ભોગવવી પડશે. થાણે પાલિકા દ્વારા સોમવારે ફરી એક વખત સમગ્ર શહેરમાં ૧૯ ડિસેમ્બર સુધી ૫૦ ટકા પાણીકાપ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ ત્રીજી વખત પાણીકાપને લંબાવવામાં આવ્યો છે.

કલ્યાણ ફાટા પાસે મહાનગર ગૅસના કામમાં થાણે શહેરને પાણીપુરવઠો કરનારી પિસે બંધમાંથી ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી પુરવઠો કરનારી ૧,૦૦૦ ડાયામીટરની પાઈપલાઈનને ગુરુવારે,૧૧ ડિસેમ્બરના કલ્યાણ ફાટા પાસે મહાનગર ગેસ લિમિટેડના કામ દરમ્યાન નુકસાન પહોંચ્યું હતું. યુદ્ધના ધોરણ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે પાણીની પાઈપલાઈન બહુ જૂની અને સિમેન્ટ-કૉંક્રીટની બનેલી હોવાથી તેના સમારકામમાં ચાર દિવસથી વધુ સમય લાગી શકે છે. તેને કારણે થાણે શહેરના પાણીપુરવઠામાં તાત્કાલિક ધોરણે સોમવાર, ૧૫ ડિસેમ્બર સુધી ૫૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો પણ આ કામ હજી સુધી પૂરું થયું નથી. તેથી સોમવાર, ૧૫ ડિસેમ્બરના થાણે પાલિકા દ્વારા ફરી એક વખત ૫૦ ટકા પાણીકાપને લંબાવી દેવામાં આવ્યો છે. હવે ૫૦ ટકા પાણીકાપ ૧૯ ડિસેમ્બર, શુક્રવાર સુધી રહેશે.

આચારસંહિતા

આગળ વધવાની પ્રક્રિયા પણ આગામી મહિનામાં ચાલુ જ રહેશે અને સાઈટ પર કામ પણ ચાલુ જ રહેશે.

મહત્વના પ્રોજેક્ટમાં ગારગાઈ બંધનું કામ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો કૉન્ટ્રેક્ટ તેમ જ ગોરેગામ-મુલુંડ લિંક રોડના ચોથા તબક્કાનું બાંધકામ, ભાયખલાના વાય ફ્લાયઓવરને જેજે ફ્લાયઓવર સાથે જોડતો કેબલ-સ્ટેડ બ્રિજ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આચારસંહિતા લાગુ પડે તેના અઠવાડિયા પહેલા જ પાલિકાએ લગભગ ૧૦ હજારથી વધુ કરોડના પ્રોજેક્ટના ટેન્ડર અને વર્ક ઓર્ડર બહાર પાડી દીધા છે. ગોરેગામ-મુલુંડ લિંક રોડના ચોથા તબક્કાના કામ માટે પાલિકાએ ૧,૨૦૦ કરોડના ટેન્ડર બહાર પાડયા છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવને અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના રસ્તાના રિસર્ફેસિંગના કામ માટે સોમવારે ૧૨૦ કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

રાજ્યના મહાનગરોમાં

ટૂલ દ્વારા સંભવિત ડુપ્લિકેટ મતદારોનો સંપર્ક કર્યા પછી, વાસ્તવિક સંખ્યા આંકડાના ૭ ટકા છે. આ નામો પર ડબલ સ્ટાર ચિહ્નિત કરવામાં આવ્યા છે અને તેમને પૂછવામાં આવ્યું છે કે તેઓ કયા મતદાન મથક પર મતદાન કરશે, એમ રાજ્ય મતદાન પેનલના વડાએ જણાવ્યું હતું.વરિષ્ઠ અમલદારે જણાવ્યું હતું કે, જે ડુપ્લિકેટ મતદારોનો સંપર્ક થઈ શક્યો નથી.

કમિશનરના ઘરમાં ૧૫૦ અને શૌચાલયમાં ૧૦ મતદારો અંગે ખુલાસો

ડુપ્લિકેટ મતદારો અને મતદારના સરનામાને લઈને સર્જાયેલા ગૂંચવણ વિશે દિનેશ વાઘમારેએ જણાવ્યું કે, 'અમે કેન્દ્રીય ચૂંટણી પંચની જે મતદાર યાદી છે, તે જ વાપરવાના છીએ. પહેલી જુલાઈ ૨૦૨૫ સુધીની યાદી અમે આ ચૂંટણીમાં વાપરવાના છીએ. આ યાદીના ડુપ્લિકેટ મતદારોને અમે શોધી કાઢ્યા છે. તેના પર કાર્યવાહી ચાલુ છે. તેમાં વધુ એક સમસ્યા હતી, જેમ કે નવી મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં એક ફરિયાદ સામે આવી હતી. મહાનગરપાલિકા કમિશનરના ઘરમાં દોઢસો મતદારો દર્શાવવામાં આવ્યા હતા. ''જ્યારે અમે તે કેસની તપાસ કરી, ત્યારે આ વાત સામે આવી. મતદારોનાં ઘરનાં સરનામામાં, સેક્શન એડ્રેસ હતું. વાસ્તવમાં સેક્શન એડ્રેસ એ કોઈ મતદારના ઘરનું લેન્ડમાર્ક હોય છે. તે વિસ્તારમાં દોઢસો મતદારો હતા. બીજી એક ફરિયાદ એવી હતી કે, નવી મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં ટોઇલેટમાં ૧૦ મતદારો દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે જણાયું કે ટોઇલેટની જે ઇમારત હતી તેના પહેલા અને બીજા માળે લોકો રહેતા હતા. તેથી, ટોઇલેટનું સરનામું બતાવતું હતું. તેઓ પહેલાં ત્યાં ઉપર રહેતા હતા. તેથી તેવું સરનામું બતાવતું હતું, એવી સ્પષ્ટતા વાઘમારેએ કરી હતી.

નોમિનેશન ફક્ત ઑફલાઇન

વાઘમારે જણાવ્યું હતું કે નોમિનેશન ફક્ત ઓફલાઇન જ ભરી શકાય છે અને પહેલી જુલાઈ, ૨૦૨૫ સુધીની મતદાર યાદીઓ જેને વોર્ડવાર અપડેટ કરવામાં આવી છે, તે ચૂંટણીઓ માટે ઉપયોગમાં લેવાશે.

જિલ્લા પરિષદ વિશે શું?

તેમણે કહ્યું કે ૧૨ જિલ્લા પરિષદોની ચૂંટણીઓ, જ્યાં અનામત મર્યાદા ૫૦ ટકા સુધી છે, તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેમાં ક્વોટા અંગે સર્વોચ્ચ અદાલતના નિર્દેશોને ધ્યાનમાં લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ૩૧ જાન્યુઆરી સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૨૪૬ મ્યુનિસિપલ કાઉન્સિલો, ૪૨ નગર પરિષદો, ૩૨ જિલ્લા પરિષદો અને ૩૩૬ પંચાયત સમિતિઓની ચૂંટણીઓ કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કાર્ય કરતા, ચૂંટણી પંચે બે ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં ૨૬૩ મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની ચૂંટણીઓ યોજી હતી. બાકીની ૨૪ કાઉન્સિલ અને નગર પંચાયતો ૨૦ ડિસેમ્બરે મતદાન કરશે. મતદાન થયેલા તમામ મતોની ગણતરી ૨૧ ડિસેમ્બરે કરવામાં આવશે.

જે જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓની મુદત પૂરી થઈ ગઈ છે તેમના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત હજુ બાકી છે.

ડબલ મતદારોને મતદાન મથક પસંદ કરવાની મંજૂરી

વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (વીવીએમસી)એ ડબલ મતદારોને ફોર્મ ભરીને તેમના પસંદીદા મતદાન મથક પસંદ કરવાની મંજૂરી આપી છે. જોકે, બહુજન વિકાસ આઘાડી (બીવીએ) એ ડબલ વોટરના મુદ્દે સીધો હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુનાવણી ૨૨ ડિસેમ્બરે થવાની છે. પાંચ વર્ષ પછી વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૨૯ વોર્ડનો સમાવેશ થાય છે. ૨૮-૨૮ વોર્ડમાંથી કુલ ૪ નગરસેવક અને ૨૯મા વોર્ડમાંથી ત્રણ નગરસેવક કુલ ૧૧૫ બેઠકો પર ચૂંટાવાના છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે અને મ્યુનિસિપલ વહીવટીતંત્ર પણ વ્યાપક વ્યવસ્થા કરી રહ્યું છે.

જૈન મરણ

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન

દેદાદરા નિવાસી હાલ ચીંચપોકલી, સ્વ. જસવંતીબેન વ્રજલાલ ત્રંબકલાલ શાહના સુપુત્ર અશોકભાઈ (ઉં.વ. ૬૫) તે કામિનીબેનના પતિ. નીધિ હેમલ ગાંધીના પિતાશ્રી. હેમલભાઈના સસરા. પ્રવિણભાઈ, પ્રદીપભાઈ, દિલીપભાઈ, સ્વ. ઉષાબેન પરીમલ દોશીના ભાઈ. પંકજભાઈ હિંમતલાલ ગાંધીના વેવાઈ. પિયરપક્ષે સ્વ. લલીતાબેન મુળજીભાઈ નરોત્તમદાસ વોરાના જમાઈ તા. ૧૫-૧૨-૨૫ને સોમવારના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠેઃ એલ/૨૫, ડીએલ જૈન ચાલ, ૬૪ ડૉ. આંબેડકર રોડ, ચીંચપોકલી, મુંબઈ-૪૦૦૦૧૨.

ઘોઘારી વિશાશ્રી માળી જૈન

ટાણા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. પરમાનંદદાસ રાયચંદ શાહના સુપુત્ર સુરેશભાઈના ધર્મપત્ની અ.સૌ. અરૂણાબેન (ઉં. વ. ૭૩) રવિવાર તા. ૧૪-૧૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે, તે ભુપતભાઈ, મનહરભાઈ, નરેન્દ્રભાઈ, કિર્તીભાઈ, મહેન્દ્રભાઈ, અશ્વિનભાઈ, મંજુલાબેન, નિરંજનાબેન, હસુમતીબેનના ભાભી. કલ્પેશ- કેતનના માતુશ્રી. ફોરમ, ચાર્મીના સાસુ. પિયરપક્ષે પાલિતાણા નિવાસી દલીચંદ કાનજી દિયોરાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૭-૧૨-૨૫ના બુધવાર ૯.૩૦ થી ૧૧.૩૦. સ્થળઃ ભાનુશાલી વાડી, તિલક રોડ, ઘાટકોપર ઇસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન

ધાગંધ્રા (થળા) નિવાસી હાલ અંધેરી, રાજુલાબેન (ઉં.વ.૭૪) તા. ૧૪/૧૨/૨૦૨૫નાં અરીહંતશરણ પામેલ છે. તે સ્વ. અશોકભાઇ ઠાકરશીભાઈ શાહનાં ધર્મપત્ની. ઘરા અને નીરવના માતુશ્રી. ઠાકરશીભાઈ ન્યાલચંદના પુત્રવધૂ. શાંતીલાલ ગીરધરલાલ દેસાઈનાં સુપુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાનઃ ૧૦૦૩, શીલ્પા બિલ્ડિંગ, આઝાદ રોડ, અંધેરી પૂર્વ.

ઝાલાવાડી શ્વે. મૂર્તિપૂજક જૈન

મૂળી નિવાસી હાલ સાયન, ચી. પ્રદુત શાહ (ઉં.વ.૫૨) તે સ્વ. કૌમુદિની રજનીકુમાર શાહના પુત્ર. સ્વ. શાંતાબેન નવનીતલાલ દુલેભજી શાહના પૌત્ર. સ્વ. જયંતકુમાર, નીતા દિપકભાઈ વોરા શીરીષકુમાર, મધુના ભત્રીજા. કવિતા- જેસોન બ્લોકીંગના ભાઈ, ભાવિન, નાન્સી, વિરબલના પિતરાઈભાઈ. જગજીવન ત્રિભોવનદાસ શાહના દોહિત્ર ન્યૂયોર્કમાં ૬/૧૨/૨૫ના અરિહંતશરણ પામેલ છે. તેમની અંતિમસંસ્કાર વિધિ ન્યૂયોર્કમાં કરેલ છે. લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

મોરબી નિવાસી હાલ ઘાટકોપર, ગં. સ્વ. શીલાબેન ઉત્તમલાલ સંઘવી (ઉં.વ. ૮૯), રવિવાર, તા. ૧૪-૧૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉત્તમલાલ વનેચંદ સંઘવીના ધર્મપત્ની. સ્વ. નગીનદાસ પ્રાણજીવન મહેતાના સુપુત્રી. સ્વ. નવલબેન વનેચંદ સંઘવીના પુત્રવધૂ. સ્વ. ડૉ. પ્રવીણભાઈ તથા સ્વ. મનહરલાલ સંઘવીના ભાભી. સ્વ. પ્રકાશભાઈ, જ્યોતીબેન, માધવીબેન, વિરેનભાઈના માતુશ્રી. ચેતનાબેન, ડૉ. સુધીરભાઈ, રાકેશભાઈ, અપેક્ષાબેનના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.સાકરલાલ જગજીવનદાસ જસાણીના પુત્ર વસંતરાય (ઉં.વ.૯૪) રવિવાર તા.૧૪/૧૨/૨૫ના અરિહંતશરણ પામ્યા છે. તે ધનલક્ષ્મીબેનના પતિ. સ્વ. રેખાબેન જીતેન્દ્રભાઈ બાવીસી અને દિનેશના પિતાશ્રી. પુનમબેનના સસરા. સ્વ. ભોગીભાઈ, સ્વ. રમણીકભાઇ, સ્વ. જશવંતભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, ભારતીબેન પ્રવીણચંદ્ર મહેતા તથા અરવિંદભાઈના ભાઈ, હરગોવિંદદાસ જીવનલાલ સરવૈયાના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના બંધ રાખેલ છે.

શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન

પુનડીના હરખચંદ લખમશી મારૂ (ઉં.વ. ૬૫) ૧૨-૧૨-૨૫ના અવસાન પામેલ છે. જવેરબેન લખમશીના સુપુત્ર. અરૂણાના પતિ. કેવલ, સમીરના પિતા. જયંતીલાલ, દિલીપ, જયા, ભાવનાના ભાઇ. દેશલપુરના જવેરબેન માવજી વીરાના જમાઇ. પ્રાર્થનાઃ શ્રી વર્ધમાન સ્થાનક જૈન શ્રાવક સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. તા. ૧૬-૧૨-૨૫. નિવાસઃ હરખચંદ મારૂ, સી/૩૦૨, આનંદ પ્લાઝા, એસ.એન. દુબે રોડ, રાવલપાડા, દહીંસર (ઇ.)

દેશલપુર (કંઠી)ના પુષ્પાબેન (હરખમણી) પ્રેમજી વીરા (ઉં.વ. ૮૫) તા. ૧૪-૧૨-૨૫ ના અવસાન પામેલ છે. પ્રેમજીભાઇના પત્ની. રતનબેન મુલજીના પુત્રવધુ. ફાલ્ગુનીના માતુશ્રી. લક્ષ્મીબેન શાંતીલાલના સુપુત્રી. સરલા, ધીરજ, કસ્તુર, સુરેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પુષ્પા વીરા, ૭/૪ અવધુત દત્ત મંદિર રોડ, કાંદિવલી (વે.) ૬૭.

વાંકી હાલે થાણાના માતુશ્રી ઉષા કિશોર સાવલા (ઉં.વ. ૬૪) તા. ૧૪-૧૨-૨૫ના દેહ પરિવર્તન કરેલ છે. સ્વ. પુરબાઈ ભવાનજીના પુત્રવધૂ. સ્વ. કિશોરના ધર્મપત્ની. હિતેન, ખુશ્બુના માતુશ્રી. મુંબઇના સ્વ. કમળાબેન છગનલાલ પંચાલના દીકરી. મધુબેન સુરેશ, કલ્પનાબેન રાજેન્દ્ર ના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહી. નિ. ઉષાબેન સાવલા, ૧૩૦૧, પ્રથમેશ હીલ, ઢોકાલી નાકા, કોલસેટ રોડ, થાણા (વે).

મોટી રાયણના ગુલાબચંદ આણંદજી ગડા (ઉં.વ. ૮૫) તા. ૧૪-૧૨-૨૫ના અરિહંત શરણ પામ્યા છે. સાકરબેન આણંદજીના સુપુત્ર. દિવાળીબેનના પતિ. નીલમ, ગીતાના પિતાશ્રી. હેમચંદ, સુરેશના ભાઈ. મોટી ખાખરના ભમીબેન નાનજી રવજી ભેદાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિલેશ ચુનીલાલ છેડા : ૮૦૧, બાગબાન, વલ્લભબાગ લેન, ઘાટકોપર-ઈ.

પત્રીના પુષ્પાબેન દામજી દેઢિયા (ઉં. વ. ૮૯) તા. ૧૪/૧૨/૨૫ના સંથારો સીઝયો છે. મેઘબાઈ ગાંગજીના પુત્રવધૂ. દામજીના પત્ની. રમેશ, કિશોર, અજીત, પદ્મિનીના માતુશ્રી. પત્રી નાગઇબાઈ પોપટલાલના પુત્રી. કલ્યાણજી, મણીબેન, ઝવેરબેન, કેસરબેન, કુસુમબેન ના બહેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. પદ્મિની દેઢિયા- ૬૦૩, મેરી વિલા, એસ. વી. પી. રોડ, બોરીવલી (વે).

ખારૂઆના દિલીપ રામજી વિસરીયા (ઉં. વ. ૬૫) ૧૪-૧૨-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. વેજબાઇ રામજીના પુત્ર. બિંદુના પતિ. દિવ્યાના પિતા. ચુનીલાલ, રક્ષા, રમેશના ભાઇ. બિદડા ગં.સ્વ. લીલા મુલચંદ હંસરાજ છેડાના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બિંદુ વિસરીયા, ૧૫, વિરેન્દ્રસીંગ ચાલ, પ્રતાપનગર, જોગેશ્વરી (ઇ.).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

સ્વ. વનિતાબેન કનૈયાલાલ શાહ (ઉં.વ. ૮૭) તે કનૈયાલાલ ગીરધરલાલ ફૂલચંદ શાહના ધર્મપત્ની તા. ૧૦-૧૨-૨૫ના સ્વર્ગવાસ પામેલ છે. તે પરિમલ-ભાવના, માલતી-દિલીપ ગાંધી, બીના-મનીષ શાહ, અલ્પા-નિલેશ દોશીના માતુશ્રી. તે છોટુભાઈ-પ્રભાબેન, ભાસ્કરભાઈ-શારદાબેન, યશવંતભાઈ-પ્રેમિલાબેન, ચંદ્રાબેન જયંતિલાલ તથા વિલાસબેન જયસુખલાલના ભાભી. તે ચંપકલાલ પ્રાગજી સંઘવી વલ્લભીપુરવાળાની દીકરી. તે શાંતિભાઈ, રમેશભાઈ, મહેશભાઈ, શરદભાઈ, પ્રદીપભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા ચંદ્રાબેન જશવંતરાયના બહેન મંગળવાર, તા. ૧૬-૧૨-૨૫ સવારના ૧૦થી ૧૨ માતૃવંદના. ઠે. સર્વોદય હોલ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, સ્ટેશન પાસે, બોરીવલી વેસ્ટ.

ઝાલાવાડ વિશા શ્રીમાળી દેરાવાસી મૂર્તિપૂજક જૈન

રાણપુર નિવાસી હાલ અંધેરી, સ્વ. સમતાબેન વિનયચંદ્ર દોશીના પુત્રવધૂ નલીની (નીતા) દિનેશભાઈ દોશી (ઉં.વ. ૭૪) તા. ૧૪-૧૨-૨૫ રવિવારના અરિહંતશરણ પામેલ છે. ચિંતન- નીપા- વિરલ- સિદ્ધિ હેમાશુના માતુશ્રી તથા ભારતીબેન અનીલકુમાર પરીખ, પુર્ણમાબેન ભુપતકુમાર શાહ- દક્ષા ગુણવંતરાય શાહ તથા ભારતી જોગેશ દોશીના ભાભી તથા પિયર પક્ષે વઢવાણ નિવાસી સ્વ. મંગલજીભાઈ વર્ધમાન કોઠારીની દીકરી તથા ક્રીપા-કબીરના નાની. રે.ઠે. ૪૦૧એ વિંગ, ગંગાવિહાર, બીએમડબ્લ્યુ શોરૂમની બાજુમાં, સી.ડી. બરફીવાલા રોડ, અંધેરી વેસ્ટ. સાદડી તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પારસી મરણ

કેટી રૂસ્તમ ઈરાની તે મરહુમ રૂસ્તમ બમન ઈરાનીના વિધવા તે મરહુમો હોમાય તથા બરજોર ગાયવાલાના દીકરી. તે ડેલનાઝ ઈરાની ને યુહાન ચેસનના મમ્મી. તે રોશન વાઘવકરના બહેન. તે ગુસ્તાદ ઈરાની, તીરાન ઈરાની ને મેહરનોશ ઈરાનીના ભાભી. તે ઝરીન ઈરાની ને રોશન મલ્લુના નરન. (ઉં.વ. ૮૨) ઠે. રૂમ નં. ૧૩, ઑગસ્ટ ક્રાંતિ મેદાન, ફોરજેટ ક્રોસ રોડ, ગોવાલિયા ટેન્કની નજીક, તારદેવ, મુંબઈ-૪૦૦ ૦૩૦.

આરમયતી દારાયસ દમનીયા તે મરહુમ દારાયસ મંચેરશાહ દમનીયાના વિધવા. તે મરહુમો ટેહમીના તથા સરોશ લાલાના દીકરી. તે મરહુમો ફલી, મેહરૂ ને યઝદીના બહેન. તે ઈરાઝ, કૈનાઝ, તનાઝ, ડેલનાઝ, વિરાફ ને કૈઝાદના ફુઈજી. તે સનોબર ને મરહુમ મરઝબાનના મામી. તે મેહરૂના ભાભી. (ઉં.વ. ૭૩) ઠે. ૩/૨૦૪, દમાવંદ બિલ્ડીંગ, બેહરામ બાગ પારસી કોલોની, જોગેશ્વરી પશ્ચિમ, મુંબઈ-૪૦૦ ૧૦૨. ઉઠમણાની ક્રિયાઃ તા. ૧૬-૧૨-૨૦૨૫ને બપોરે ૦૩.૪૫ કલાકે મુંબઈ ડુંગરવાડી પર ઉપરની હોડીવાલા બંગલીમાં.

હિન્દુ મરણ

કચ્છી ભાટીયા

હરીશ (ઉં. વ. ૭૭), તે સ્વ. ભાનુબેન તથા સ્વ.નલિનકાંત હંસરાજ લીલાણીના પુત્ર. કલ્પનાના પતિ. સ્વ.ગુણીબેન આનંદદાસ આશરના જમાઈ. નીલ અને અંજલિના પિતા. નીલા/વિજય, સ્વ.જયશ્રી/અજીત તથા સ્વ. શૈલેષ/હિમાના ભાઈ તા.૧૩-૧૨-૨૫ના ફિલાડેલ્ફિયા, અમેરિકામાં સ્વર્ગસ્થ પામ્યા છે. ઉઠમણાંની ક્રિયા રાખી નથી.

હાલાઇ ભાટિયા

હૈદ્રાબાદ નિવાસી, કૃષ્ણરાજ (કિરણ) ગાંધી (ઉં.વ.૭૦) તે સ્વ. ક્રિષ્ણાબાઈ મથુરાદાસ ગોકળગાંધીના પુત્ર. ગં. સ્વ. જયશ્રીના પતિ. અ.સૌ. ભૈરવી તથા ચિ.જીજ્ઞેશના પિતા. પ્રભાત તથા સોનિકાના સસરા. સ્વ. ઈન્દુમતિ નરોત્તમદાસ વેદના જમાઈ. ગુરુવાર તા.૧૧/૧૨/૨૫ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

ચીંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ વણિક પારડી

જલગાંવ નિવાસી હાલ સુરત, રંજનબેન નટવરલાલ શાહનાં પુત્ર સુધીરભાઈ (ઉં. વ. ૬૩) તે મયુરીબેનના પતિ. વિમલબેન મુરલીધર ટાપર (જાલના)ના જમાઈ. પંકિત-મોહિતના પિતા. મિહિરભાઈ સપારા અને પલકના સસરા. તા. ૧૪/૧૨/૨૫ના દિવસે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સોરઠિયા વણિક

ખોરાસા નિવાસી હાલ ભાયંદર, સ્વ. સવિતાબેન કાળીદાસ શેઠના સુપુત્ર અશ્વિનકુમાર (ઉં.વ.૬૮) તે નિતાબેનનાં પતિ. સ્વ. કલાવંતીબેન કાંતિલાલ કઢી, સ્વ. ચંદ્રિકાબેન બળવંતભાઈ મુજયસરા, સ્વ. મંજુલાબેન ધીરજલાલ ગગલાણી, સ્વ. જયશ્રીબેન કિશોરભાઈ મોતીપરા, સ્વ. જ્યોત્સનાબેન કાળીદાસ શેઠના ભાઈ. તા. ૧૩/૧૨/૨૫ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી લોહાણા

અંજારના હાલ મુલુંડ, મોરારજી (ઉં.વ.૮૮) સ્વ. જેરામ પ્રેમજી પાદરાઈ (ઠક્કર)ના પુત્ર. મંજુલાબેનના પતિ. સમીરભાઈ તથા મનોજભાઈના પિતાશ્રી. સ્વ. શંભુલાલ મોરારજી રામાણીના જમાઈ. રવિવાર તા. ૧૪-૧૨-૨૫ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા

મૂળ ગામ કચ્છ કલ્યાણપુર હાલ મુલુંડ, અરવિંદભાઈ (ઉં.વ.૮૦) સ્વ. નર્મદાબેન ભગવાનજી સોમૈયાના સુપુત્ર. તે સ્વ. સરોજબેનના પતિ. સ્વ. નિર્મળાબેન કરમશી ધીરાવાણી (કોઠારા)ના જમાઈ. પ્રજ્ઞેશ, જીજ્ઞાના પપા. દર્શના પ્રજ્ઞેશ સોમૈયા, શૈલેષ ઉમાકાન્ત નેગાંધીના સસરા. સ્વ. કોકિલાબેન પ્રવીણ તન્ના, અ. સૌ. જ્યોત્સનાબેન કિશોર રૂપારેલ, જયેશના મોટાભાઈ. તા. ૧૩-૧૨-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા

પ્રતાપ વિસનજી ઠક્કર (ઉં.વ. ૭૮) ગામ-અંજાર કચ્છ હાલ મુલુંડ તે સ્વ. લક્ષ્મીબેન વિસનજી ઠક્કરના પુત્ર. દક્ષાબેનના પતિ. અવની, ઉર્વી તથા સ્વ. વિકાસના પિતા. સમીર મહેશ ઠક્કરના સસરા. ધીર સમીર ઠક્કરના નાના. સ્વ. કપીલાબેન કેશવજી ચંદે ગામ મસ્કાવાળાના જમાઈ તા. ૧૩-૧૨-૨૫ને શનિવારે સદગતી પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.

મોતાળા બ્રાહ્મણ

ગં.સ્વ. કિશોરીબેન મધુરકર ભટ્ટ (ઉં.વ. ૮૮) તા. ૧૪-૧૨-૨૫ના પ્રભુશરણ પામ્યા છે. તે નિહિરના માતુશ્રી. મમતાના સાસુ અને જૈનવના દાદી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છ

ગોભવા મોઢ વણિક

મનુભાઈ હાકેમચંદ મણીયાર તે સ્વ. ગીરધરભાઈ, સ્વ. નાનુભાઈ તથા ગં. સ્વ. રમાબેન કિશોરભાઈ કોઠારીના ભાઈ. સ્વ. શારદાબેન તથા સ્વ. પ્રભાબેનના દીયર. સ્વ. રોહિણી, સ્વ. હેમા તથા સ્વ. મુકુલના કાકા. સ્વ. દેવેન્દ્ર, ધીરેનભાઈ તથા ગં. સ્વ. કલ્પનાના કાકાજી તા. ૧૪-૧૨-૨૫ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

મરણ ખબર માટેની સૂચના	મૃત્યુનોંધ સાંજે ૭-૩૦ સુધી જ સ્વીકારવામાં આવશે	(૧) મરનારનું નામ (૨) તારીખ (૩) ઉંમર (૪) કયાં ગુજરી ગયા છે એ જગ્યા (૫) માતાનું નામ (૬) પિતાનું નામ (૭) ગમે તે ત્રણ સગાઈ (૮) પ્રાર્થનાસભા સ્થળ, તારીખ, સમય. મૃત્યુનોંધ આપનારે ઉપર જણાવ્યા મુજબની વિગતો જ પોતાના લેટરહેડ પર લખીને આપવાની રહેશે. સગાઈરૂપે લખાયેલાં વધારાના નામોની કાપકૂપ થાય તો એ માટે કોઈ સંવાદને સ્થાન રહેશે નહીં. (૫૦ શબ્દથી વધારે નહીં). - વ્યવસ્થાપક

તન-મન-ધનથી રહો તરોતાજા

ગૌરવ મશરૂવાળા
feedback@bombaysamachar.com

સંપત્તિને વશમાં રાખવા માટે આધ્યાત્મિક શક્તિની લગામ જરૂરી છે...

ગયા અઠવાડિયે આપણે લક્ષ્મી કેટલી ચંચળ હોય છે એ વિશે વાત કરી ગયા. હવે આવી ચંચળ લક્ષ્મીને વશમાં રાખવી એના વિશે વાત કરીએ...

ગયે અઠવાડિયે આપણે ગામડેથી આવેલા હરિરામભાઈએ જાત ઘસીને કઈ રીતે સંપત્તિનું સર્જન કર્યું અને પછી ત્રીજી પેઢીના આગમન સાથે એ સંપત્તિનું કઈ રીતે ક્રમશ : વિસર્જન થતું ગયું એ પણ આપણે જાણ્યું-એનાં કારણ પણ જાણ્યાં...

આવી હરિરામભાઈએ જાતમહેનતથી મેળવેલી સંપત્તિને વશમાં રાખવા માટે આધ્યાત્મિક શક્તિની લગામ જરૂરી છે...

પૈસા, શક્તિ અને સામર્થ્ય બન્ને ધરાવે છે. જો આ શક્તિ અને સામર્થ્યને યોગ્ય રીતે વાપરવામાં ન આવે તો પૈસો માણસને ઉપયોગી થવાને બદલે નુકસાનકર્તા બની જાય. માણસ પૈસાનો દાસ બની જાય. પૈસો એને પોતાની આંગળીએ નચાવવા લાગે. પૈસા માટે ઝઘડા, લડાઈઓ અને એકમેકને હરાવવાના પેંતરા શરૂ થઈ જાય. માણસ ખોટા રસ્તે પૈસો ભેગો કરવા માંડે. આ ઘમાસાણમાં દુર્બળ માણસ પાછળ રહી જાય, સામર્થ્યવાન વધુ ને વધુ સંપત્તિ એકત્રિત કરતો જાય.

પૈસો ‘શક્તિ’ છે. દેવીઓને આપણે શક્તિનું સ્વરૂપ ગણીએ છીએ. જો માણસ પૈસાનો શક્તિના સ્વરૂપ તરીકે આદર કરશે તો એને અવશ્ય લાભ થશે. લક્ષ્મીદેવીને માતાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.

સૌથી પહેલાં તો, માતા ક્યારેય પોતાના સંતાનને નુકસાન પહોંચાડતી નથી. એ હંમેશાં બાળકનું રક્ષણ કરે છે. બાળકની સુખાકારી માટે એ પોતાની તમામ શક્તિ કામે લગાડી દે છે. આથી ધનનો જો આપણે માતાની જેમ આદર કરીશું તો તે આપણી રક્ષા કરશે.

બાળક ક્યારેય માતાનો ખોટી રીતે ઉપયોગ નહીં કરે. માતા કોઈ વસ્તુ નથી. માતાનો એક ચીજ તરીકે જોવાનો અને ઉપયોગ કરવાનો વિચાર માત્ર તન-મનમાં ધ્રુજારી પેદા કરી દે છે. આથી જો આપણે પૈસાને લક્ષ્મીમાતા તરીકે નિહાળીશું તો ક્યારેય એનો ખોટી રીતે ઉપભોગ નહીં કરીએ, આપણે તેને સારાં કામમાં ખર્ચીશું. પૈસાનો ઉપભોગ કરવામાં અને તેને સારી રીતે ખર્ચવામાં ફરક છે.

માતા સાથે સંતાનનો એક જ સંબંધ હોઈ શકે છે - આદરનો. સામે પક્ષે, માતા સંતાનની રક્ષા કરે છે, એની સુખાકારીનો ખ્યાલ રાખે છે. માતા અને સંતાન વચ્ચેનો આ સંબંધ પ્રેમનો સંબંધ છે. આ એક પવિત્ર નાતો છે.

પૈસા સાથે એવો જ વ્યવહાર કરો જેવો તમે તમારી માતા સાથે કરો છો. સૌથી પહેલાં તો, સંપત્તિની કાળજી લો, એને સાચવો. પૈસા સંબંધિત દસ્તાવેજો અને કાગળિયાંની વ્યવસ્થિત ફાઈલ બનાવો, વિગતો અપડેટ કરતા રહો, ખર્ચ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તેના પર નજર રાખો. ધનને બેન્કના ખાતામાં, તિજોરીમાં કે પર્સમાં નિષ્ક્રિય પડી રહેવા ન દો. પૈસા ખર્ચો, વેડફો નહીં. પૈસાના મામલામાં જવાબદારીપૂર્વક વર્તો. અહમ્ સંતોષવા માટે, ઈર્ષ્યાના માર્યા કે હતાશ થઈને પૈસા ન વાપરો.

માતાનો પ્રેમ બિનશરતી છે. માતાના પ્રેમ માટે બાળક ક્યારેય અસલામતી કે ઉચાટ અનુભવતું નથી. એને પોતાની મા પર સંપૂર્ણપણે શ્રદ્ધા હોય છે. બાળકને જરૂર પડે ત્યારે માતા હંમેશાં હાજર થઈ જાય છે. સંપત્તિના મામલામાં પણ અસલામતી કે ઉચાટ ન અનુભવો. જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે લક્ષ્મીમાતા હાજર થઈ જ જશે. લક્ષ્મીમાતા પર શ્રદ્ધા રાખો.

માતા ક્યારેય આપણા માટે ક્ષોભ કે શરમનું કારણ બનતી નથી. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, ક્યારેય શરમ ન અનુભવો. જે રીતે આપણે આપણી માતાની સરખામણી બીજાઓની માતા સાથે કરતા નથી તે રીતે આપણી ધનસંપત્તિની તુલના પણ અન્યો સાથે ન કરવી જોઈએ. કોઈની માતા નાજાયઝ કે ગેરકાનૂની હોતી નથી. આથી કાળાંધોળાં કરીને કે કરચોરી કરીને નાજાયઝ સંપત્તિ એકઠી કરવી નહીં. ધનસંપત્તિને મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશવા દો - કાયદેસર રીતે, નીતિપૂર્વક, સન્માન સાથે.

માતાનો પ્રેમ સૌની સાથે વહેંચવાનો હોય. માનો પ્રેમ વહેંચવાથી ઘટતો નથી. તે જ રીતે લક્ષ્મીદેવીનો પ્રેમ પણ સૌની સાથે વહેંચો. સમાજ સાથે, દેશ સાથે, માનવજાત સાથે, પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિ સાથે.

બીજી તરફ, જો આપણે દેવી સમાન સંપત્તિ પ્રત્યે આધ્યાત્મિક અભિગમ કેળવીને તે અનુસાર વ્યવહાર નહીં કરીએ તો સંપત્તિ નુકસાનકારક નીવડી શકે છે. જો આપણે તેનો આદર નહીં કરીએ, એને લીધે શરમનો અનુભવ કરીશું, બીજાઓ સાથે એની સરખામણી કરીશું, ખોટા રસ્તે કમાઈશું (એટલે કે પાછલા દરવાજેથી એને ઘરમાં લાવીશું), એના પર અવિશ્વાસ કરીશું અને બીજાઓ સાથે વહેંચીશું નહીં તો આપણે પૈસાના મામલામાં અસલામતી અનુભવતાં થઈ જઈશું. મન ઉચાટભર્યું અને અશાંત રહેશે, આપણે અહંકારી બની જઈશું. આ તમામ વાત આપણા માટે હાનિકર્તા સાબિત થશે.

આથી જ ઋષિમુનિઓએ ધનને લક્ષ્મીદેવીનો દરજ્જો આપ્યો છે. એની સાથે સન્માન અને ભક્તિભાવભર્યો વ્યવહાર કરીએ. જો આમ કરીશું તો એ ક્યારેય પોતાનાં સંતાનોને નિરાશ ન કરે. ■

ફાઈનાન્સના ફંડા
મિતાલી મહેતા
feedback@bombaysamachar.com

પૈસા બમણાં કરવાનું ગણિતઃ રૂલ ઓફ ૭૨

...અને તેનો વિપરીત નિયમ!

આજના સમયમાં પૈસા સંબંધિત શબ્દો રિટર્ન-ઈન્ટરેસ્ટ- ઈન્ફ્લેશન અવારનવાર સાંભળીએ છીએ. પરંતુ આ બધા

શબ્દોની પાછળનું મૂળ સત્ય એક જ છેઃ સમય અને ચક્રવૃદ્ધિ.

આ સત્યને સમજવા માટે દુનિયાભરમાં એક સરળ પરંતુ શક્તિશાળી સૂત્ર જાણીતું છે રૂલ ઓફ ૭૨.

આ રૂલ ઓફ ૭૨ શું છે?

રૂલ ઓફ ૭૨ એક સહેલો અંદાજ આપે છેઃ

૭૨ને વાર્ષિક વ્યાજદરથી ભાગો, તો તમારા પૈસા બમણાં થવામાં કેટલા વર્ષ લાગશે તે ખબર પડે.

ઉદાહરણ તરીકેઃ

જો તમારું રોકાણ ૮% વાર્ષિક વધે છે - ૭૨ ÷ ૮ = ૯ વર્ષ

* ૬% પર - ૧૨ વર્ષ
* ૧૨% પર - ૬ વર્ષ

આ નિયમ ગણિતની દૃષ્ટિએ સંપૂર્ણ ચોક્કસ નહીં હોય, પરંતુ વાસ્તવિક જીવન માટે એટલો અસરકારક છે કે વિશ્વભરમાં નાણાંકીય સલાહકારો તેનો વ્યાપક ઉપયોગ કરે છે.

ભારતીય રોકાણકાર માટે આ કેમ મહત્ત્વનું છે?

ભારતમાં ઘણા લોકો આજે પણ ફિક્સ્ડ ડિપોઝિટને સૌથી સલામત વિકલ્પ માને છે, પરંતુ જો ફિક્સ્ડ ડિપોઝિટ પર તમને ૫૬% વ્યાજ મળે છે, તો રૂલ ઓફ ૭૨ જણાવે છે કે તમારા પૈસા બમણાં થવામાં ૧૨ થી ૧૪ વર્ષ લાગી શકે.

હવે અહીં એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે મોંઘવારી.

જો મોંઘવારી દર વર્ષે ૬% વધે છે, તોઃ

૭૨ ÷ ૬ = ૧૨ વર્ષ

અર્થાત, જો તમારા પૈસા મોંઘવારી જેટલા દરે પણ નથી વધતા, તો તેની ખરીદ શક્તિ ૧૨ વર્ષમાં અડધી થઈ જાય છે.

આથી, પૈસા ફક્ત સલામત રાખવું પૂરતું નથી તેને સમજદારીથી અને યોગ્ય સાધનો દ્વારા વધારવું જરૂરી છે.

હવે જાણીએ રૂલ ઓફ ૭૨નો વિપરીત નિયમ

રૂલ ઓફ ૭૨ નો એક ઓછો ચર્ચાતો, પરંતુ એટલો જ મહત્ત્વનો વિચાર છે વિપરીત નિયમ.

૭૨ને વર્ષોથી ભાગો, તો તમને પૈસા બમણાં કરવા માટે કેટલો વાર્ષિક રિટર્ન જોઈએ તે ખબર પડે.

ઉદાહરણ તરીકેઃ

* ૧૦ વર્ષમાં પૈસા બમણા કરવા - ૭૨ ÷ ૧૦ = ૭.૨%
* ૮ વર્ષમાં -૯%
* ૬ વર્ષમાં -૧૨%

આ વિપરીત નિયમ રોકાણકારને વાસ્તવિકતા સાથે જોડે છે.

જો કોઈ કહે કે મારા પૈસા પાંચ વર્ષમાં બમણા થવા જોઈએ, તો આ નિયમ સ્પષ્ટ કરે છે કે તેને લગભગ ૧૪-૧૫%

વાર્ષિક રિટર્ન જોઈએ જે સતત અને ઓછા જોખમ સાથે મળવું સરળ નથી.

દેવું પણ આ નિયમને અનુસરે છે

રૂલ ઓફ ૭૨ ફક્ત રોકાણ માટે નથી દેવા માટે પણ એટલો જ લાગુ પડે છે. જો ક્રેડિટ કાર્ડ પર ૨૪% વ્યાજ લાગે છેઃ

૭૨ ÷ ૨૪ = ૩ વર્ષ

અર્થાત્, બાકી રકમ માત્ર ત્રણ વર્ષમાં બમણી થઈ શકે છે.

ચક્રવૃદ્ધિ હંમેશાં આપણા પક્ષમાં જ કામ કરે એવું નથી અયોગ્ય દેવામાં તે આપણા વિરુદ્ધ પણ ઝડપી ગતિએ કામ કરે છે.

એક માનસિક સાધન

રૂલ ઓફ ૭૨ અને તેનો વિપરીત નિયમ કોઈ ગણિતીય સૂત્ર યાદ રાખવા માટે નથી તે વિચારવાની એક સરળ પદ્ધતિ છે.

તે આપણને મદદ કરે છેઃ

* વિવિધ રોકાણ વિકલ્પોની ઝડપી તુલના કરવામાં
* મોડું શરૂ કરવાની કિંમત સમજવામાં
* મોંઘવારીની સાચી અસર ઓળખવામાં
* વાસ્તવિક નાણાંકીય લક્ષ્યો નક્કી કરવામાં
* જોખમ અને અપેક્ષા વચ્ચે સંતુલન રાખવામાં

ટૂંકમાંઃ

આજના જટિલ નાણાંકીય વિશ્વમાં દરેક જવાબ મોબાઇલ એપ કે કેલ્ક્યુલેટરમાં નથી... ક્યારેક એક જ આંકડો ૭૨ આપણી નાણાંકીય દિશા બદલી શકે છે.

સમય અને ચક્રવૃદ્ધિ ક્યારેય અટકતા નથી.

પ્રશ્ન માત્ર એટલો છે શું તે તમારા માટે કામ કરી રહ્યા છે, કે ખુદ તમારી વિરુદ્ધ? ■

feedback@bombaysamachar.com
આરોગ્ય એક્સપ્રેસ
રાજેશ યાજ્ઞિક

બ્લડપ્રેશરનો એક ભેદી પ્રકાર..

પલ્મોનરી હાયપરટેન્શન

પલ્મોનરી હાઇપરટેન્શન (Pulmonary Hypertension-પીએચ) એ એક પ્રકારનું હાઈ બ્લડપ્રેશર છે, જે ફેફસાં અને હૃદયની જમણી બાજુની ધમનીઓને અસર કરે છે.

પલ્મોનરી ધમનીઓ આપણા હૃદયથી ફેફસાંમાં લોહી વહન કરે છે. આ બ્લડપ્રેશરના ઘણાં સંભવિત કારણો હોઈ શકે છે, પરંતુ તે સામાન્ય રીતે હૃદયરોગ અથવા ફેફસાંના રોગની ગૂંચવણ છે. સમય જતાં, વધેલું દબાણ પલ્મોનરી ધમનીઓને નુકસાન પહોંચાડે છે અને લોહી વહેવા માટે જગ્યાને સાંકડી કરે છે. આનો અર્થ એ છે કે જમણા વેન્ટ્રિકલ (જમણા હૃદયની નીચલી ચેમ્બર) ને તે ધમનીઓ દ્વારા લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડશે, જેથી તે ફેફસાં સુધી પહોંચી શકે. આ વધારાનું કામ જમણા વેન્ટ્રિકલને તે હોવું જોઈએ તેના કરતા મોટું બનાવે છે (રાઈટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી), જે જમણી બાજુ હૃદયની નિષ્ફળતા તરફ દોરી શકે છે. સારવાર વિના, પીએચ જીવલેણ બની શકે છે.

પીએચના લક્ષણ

પલ્મોનરી હાયપરટેન્શનનાં લક્ષણો ધીમે ધીમે વિકસે છે. મહિનાઓ કે વર્ષો સુધી તે ન દેખાય તેવું બની શકે. જેમ જેમ રોગ ચાલુ રહે છે તેમ તેમ લક્ષણો વધુ ખરાબ થાય છે, જેમકે...

શ્વાસ લેવામાં તકલીફ

તેની શરૂઆત કસરત કરવા દરમિયાન થઈ શકે છે અને બાદમાં આરામ કરતી વખતે પણ અનુભવાય છે.

વાદળી અથવા ભૂખરી ત્વચા

ત્વચાના રંગના આધારે, આ ફેરફારો જોવા ક્યારેક મુશ્કેલ અથવા ક્યારેક સરળ હોઈ શકે છે.

તે ઉપરાંત છાતીમાં દબાણ અથવા દુખાવો, ચક્કર આવવા કે બેભાન થવું, ઝડપી ધબકારા, થાક લાગવો, પગની ઘૂંટીઓ, પગ અને પેટના વિસ્તારમાં સોજો વગેરે લક્ષણો જોવા મળી શકે છે.

કઈ સમસ્યાઓ સર્જાઈ શકે?

પલ્મોનરી હાયપરટેન્શનની સંભવિત ગૂંચવણોમાં; જમણી બાજુ હૃદયનું વિસ્તરણ અને હૃદયની નિષ્ફળતા. જેને કોર પલ્મોનેલ પણ કહેવાય છે, ફેફસાંની નાની ધમનીઓમાં લોહીનું ગંઠાવું, અનિયમિત ધબકારા, જેને એરિથમિયા પણ કહેવાય છે. તે ઘાતક પણ બની શકે છે. ફેફસાંમાં જીવલેણ રક્તસ્રાવ અને ખાંસીમાંથી લોહી નીકળવું. પલ્મોનરી હાઇપરટેન્શન ગર્ભવતી માતા અને વિકસી રહેલા બાળક માટે જીવલેણ બની શકે છે.

સારવાર કેવી રીતે થઇ શકે?

પલ્મોનરી હાયપરટેન્શનના મોટાભાગના કેસોનો ઇલાજ શક્ય નથી, પરંતુ સારવાર લક્ષણોને હળવા કરવામાં, જીવનની ગુણવત્તા સુધારવામાં અને રોગની પ્રગતિ ધીમી કરવામાં મદદ કરી શકે છે. પીએચની સીધી સારવાર કરવા અથવા તેના કારણને લક્ષ્ય બનાવવા માટે તમારે દવાઓ, પ્રક્રિયાઓ અથવા શસ્ત્રક્રિયાઓની જરૂર પડી શકે છે. તમને મળતી ચોક્કસ સારવાર પીએચના પ્રકાર પ્રમાણે બદલાય છે. પલ્મોનરી હાયપરટેન્શન ધરાવતા કેટલાક લોકો માટે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ એ છેલ્લો ઉપાય છે.



શું સાવધાની રાખવી જોઈએ?

મીઠાનું સેવન ઓછું કરવું મહત્ત્વપૂર્ણ છે. અને ક્યુર્ડ મીટ, સ્મોક્ડ મીટ અને ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓ ટાળવી. તબીબની સલાહ લઈને એક ઇમર્જન્સી કીટ હંમેશાં સાથે રાખવી. અમુક પ્રકારની કસરત તમને મદદ કરી શકે છે. કેટલીક કસરત અસુરક્ષિત હોઈ શકે છે. તમારી પરિસ્થિતિમાં શું શ્રેષ્ઠ છે તે તબીબ પાસેથી જાણો. તબીબોએ આપેલી દવાઓનું નિયમિત સેવન કરવું અને કોઈપણ બદલાવ તબીબની સલાહ વિના કરવો નહીં. ખૂબ બીમાર બનાવી શકે તેવા ફ્લૂ, ન્યુમોનિયા અને અન્ય વાયરસ સામે રક્ષણ માટે તબીબ રસીઓ લેવાનું જણાવી શકે. વિમાન પ્રવાસમાં અથવા ઊંચાઈવાળાં સ્થળોની મુલાકાત લેતી વખતે તમારે ચોક્કસ સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે.

શું શું કારણ હોઈ શકે?

પીએચના પાંચ મુખ્ય પ્રકાર છે - અને દરેક પ્રકારના પોતાના અનન્ય કારણો હોય છે. એકંદરે, હૃદય અને ફેફસાંના રોગો સૌથી સામાન્ય છે. જોકે અન્ય તબીબી પરિસ્થિતિઓ અથવા ચોક્કસ દવાઓ અથવા ઝેરી પદાર્થોથી પણ પીએચની સમસ્યા થઇ શકે છે.

ગ્રૂપ ૧ઃ

પલ્મોનરી ધમની હાયપરટેન્શન (PAH) જેમાં કોકેઈન અને મેથામ્ફેટામાઈન જેવા ડ્રગ્સ અને ઝેરી તત્ત્વો, જન્મજાત હૃદયરોગ, સંયોજક પેશીઓનો રોગ, વારસાગત જનીન ફેરફારો, એચઆઈવી, પોર્ટલ હાયપરટેન્શન (લીવર તરફ લોહી પહોંચાડતી નસોને લગતી સમસ્યા), શિસ્ટોસોમિયાસિસ, ઉપરાંત અજાણ્યાં કારણો (આઈડિયોપેથિક) પણ હોઈ શકે.

ગ્રૂપ ૨ઃ

ડાબી તરફના હૃદયરોગને કારણે ફેફસાંનું હાયપરટેન્શનઃ તેમાં એઓર્ટિક વાલ્વ રોગ, ડાબી બાજુ હૃદયની નિષ્ફળતા, મિટ્રાલ (Mitral) વાલ્વ રોગ જેવા કારણો સામે હોય છે.

ગ્રૂપ ૩ઃ

ફેફસાંના રોગો અથવા હાયપોક્સિયાઃ તેમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ ફેફસાંના રોગ (COPD), પ્રતિબંધક ફેફસાંના રોગ, ઓક્સિજનનું ઓછું સ્તર (હાયપોક્સિયા) - ઉદાહરણ તરીકે, ઊંચાઈ પર લાંબો સમય રહેવાથી, શ્વસન ડિપ્રેશન જેવા કારણ હોય છે.

ગ્રૂપ ૪ઃ

ફેફસાંમાં અવરોધઃ કારણોમાં ફેફસાંમાં લોહીનું ગંઠાવું જે દૂર થતું નથી, ગાંઠો જે પલ્મોનરી ધમનીને અવરોધે છે, સામેલ હોય છે.

જૂથ ૫ઃ

એવી સ્થિતિઓ જે જટિલ અથવા અસ્પષ્ટ રીતે PHનું કારણ બને છેઃ પોલિસિથેમિયા વેરા અને આવશ્યક થ્રોમ્બોસિથેમિયા સહિત રક્ત વિકૃતિઓ, સાર્કોઇડોસિસ જેવી વિકૃતિઓ, ગ્લાયકોજેન સંગ્રહ રોગ સહિત શરીરની ચોક્કસ શર્કરાને તોડવાની ક્ષમતાને અસર કરતી પરિસ્થિતિઓ કે કિડની રોગ જેવાં કારણો.

આઈઝનમેન્જર સિન્ડ્રોમ પણ એક કારણ છે, જે પલ્મોનરી હાયપરટેન્શન તરફ દોરી શકે છે. ■

દર સપ્તાહે વાંચો
વિશેષ વાંચન સામગ્રી
ધર્મતેજ
તન-મન-ધનથી રહો તરોતાજા
ઈન્ટરવલ
લાડકી
પુરુષ
મેટિની
વીક એન્ડ
ઉત્સવ
દરરોજ કંઈક નવું- દરરોજ કશું અનોખું!

feedback@bombaysamachar.com
સ્વાસ્થ્ય સુધા
શ્રીલેખા યાજ્ઞિક

પાચનતંત્રને મજબૂત બનાવતું મસ્તમજાનું હર્બલ પીણું એટલે જ કોમ્બુચા

ચાનું નામ પડતાંની સાથે જ આપણને તો ગરમાગરમ આદું-ફુદીનાવાળી કે મસાલાવાળી કડક-મધ્યમ-મીઠી ચાની ચૂસકી લેવાની જ ઈચ્છા થાય. આજે આપણે જે હર્બલ પીણાંની વાત કરવાના છીએ તે આથો આવેલી ચા વિશે. જેનું નામ છે 'કોમ્બુચા'. કેમ ચોંકી ગયાને ! ચા તે પણ આથો આવેલી? જી હા, ભારતીય ફિલ્મી હસ્તીઓ તથા ક્રિકેટરો શરીરની તંદુરસ્તી માટે કોમ્બુચા ચાનો પ્રતિદિન ઉપયોગ કરવા લાગ્યા છે. કોમ્બુચા એ કોરિયાની લોકપ્રિય ચા ગણાય છે. કોરિયાના પ્રસિદ્ધ ચિકિત્સક ડૉ. કોમ્બુના નામ ઉપરથી કોમ્બુચા ચા લોકપ્રિય બની ગઈ છે. ઠંડીની મોસમમાં શરીરની સાથે પાચનતંત્રને સુધારવામાં અત્યંત ઉપયોગી ગણાય છે.

હાલમાં ભારતમાં યુવા-વર્ગ વિદેશી વાનગીઓનો દીવાનો બનવા લાગ્યો છે. તેમાં પણ ચાઈનીઝ બાદ હવે કોરિયન વાનગી તેમ જ કોરિયન સંસ્કૃતિની લોકપ્રિયતા ભારતમાં વધવા લાગી છે. દક્ષિણ કોરિયાના લોકપ્રિય પીણાંના હવે દેશ-દુનિયાના લોકો દીવાના બનવા લાગ્યા છે. ચાલો જાણી લઈએ આ વિદેશી આથાવાળી આકર્ષક નામ ધરાવતી 'કોમ્બુચા'ના સ્વાસ્થ્યવર્ધક લાભ. કોરિયા તથા ચીનમાં કોમ્બુચા નિયમિત પીવામાં આવે છે.

કોરિયામાં એવી માન્યતા જોવા મળે છે કે 'કોમ્બુચા'ને પીવાથી વ્યક્તિ 'અમરત્વ' પામે છે. એટલે કે લાંબું -તંદુરસ્ત આયુષ્ય મેળવે છે.

ભારતમાં પણ શિયાળામાં ખાસ પ્રકારની આથો લાવેલી કાંજી પીવાની પરંપરા જોવા મળે છે. જેમાં બીટ-ગાજર-આમળાં-આદું-લીંબુ-વાટેલી રાઈને એક મોટી કાચની બરણીમાં ગોઠવી દેવામાં આવે છે. ત્યારબાદ બરણીમાં પાણી ભરીને ત્રણ દિવસ સુધી સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે. ત્રણ દિવસ બાદ સ્વાદિષ્ટ કાંજી તૈયાર થઈ જાય છે. જે નરણાં કોઠે પીવાથી શિયાળામાં પાચનતંત્ર મજબૂત બને છે. સંપૂર્ણ શરીર સ્ફૂર્તિલું બની જાય છે. તો અન્ય એક કાંજીમાં રાત્રિના વધેલા ભાતમાં થોડી છાસ કે દહીં ભેળવવામાં આવે છે. સવારે તેમાં લીલા મરચાં-લીમડો-કોથમીર-સિંધવ વગેરે ભેળવીને જીરાનો વઘાર કરીને ખાવાની પરંપરા છે. જે સ્વાસ્થ્યને માટે અત્યંત ગુણકારી ગણાય છે.

કોમ્બુચા હર્બલ ચાને બનાવવા માટે ગ્રીન-ટી, બ્લૅક-ટી, સાકર, ખાસ પ્રકારનું યીસ્ટ 'સ્કૉબી' જેમાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય તેવા બૅક્ટેરિયા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્બુચા ચાને તૈયાર થવામાં લગભગ ૮થી ૧૦ દિવસનો સમય લાગી જાય છે. જેને કારણે ચામાં પ્રોબાયોટિક, ઍન્ટિઓક્સિડન્ટ તથા વિટામિન્સ ઉત્પન્ન થાય છે. જેનો સ્વાદ થોડો ખાટ્ટો-ફીઝી એટલે કે ફીણ વાળો હોય છે. જેમ સોડામાં પાણી ઉમેરવાથી ફીણ ઉપર આવે છે. ગટ હૅલ્થ સુધારવા માટે કોમ્બુચા ચાની લહેજત માણવી આવશ્યક ગણાય છે.

કોમ્બુચા બનાવવાની રીત

સામગ્રી : ૧ લિટર પાણી, ૨ મોટી ચમચી ચા બ્લૅક પત્તી, ૧ નંગ ગ્રીન ચા, ૧ કપ સાકર, ૧ નંગ સ્કૉબી, ૧ મોટી ચમચી લીંબુનો રસ, ૧ મોટી ચમચી આદુંની કતરણ, ૧૦-૧૨ પાન તાજા ફુદીનાના, ૪ નંગ સંતરાની ચીર કે પાઈનેપલની ચીર.

બનાવવાની રીત : સૌ પ્રથમ ૧ લિટર પાણીને ઉકાળી લેવું. તેમાં અડધો કપ સાકર ભેળવવી. સાકર બરાબર ઓગળી જાય ત્યારબાદ તેમાં ચા પત્તી ભેળવવી. ચાને બરાબર ઠંડી કરવી. ઠંડી થાય ત્યારબાદ તેને સ્વચ્છ કાચની બરણીમાં ભરી લેવી. તેમાં લીંબુનો રસ, ફુદીનાના પાન, આદુંની કતરણ, સંતરાની ચીર કે પાઈનેપલની ચીર તથા સ્કૉબી ઉમેરવી. મલમલના રૂમાલથી બંધ કરવું. જ્યાં વધુ તડકો ના આવતો હોય તેવી જગ્યાએ ગોઠવી દેવું. ૭-૧૦ દિવસ બાદ ઢાંકણ ખોલીને બરાબર હલાવી દેવું. સ્વાદિષ્ટ કોમ્બુચાને ગાળીને કાચના ગ્લાસમાં કાઢીને પીવી.

કોમ્બુચા ચા બનાવવા માટે ખાસ પ્રકારની સ્કૉબી કે યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપ ઑનલાઈન કે જાણીતા સુપર માર્કેટમાંથી ખરીદી શકો છો. કોમ્બુચા પીને અમરત્વ મેળવવાની ઈચ્છા હોય એટલે કે સદાબહાર તંદુરસ્તી જાળવવી હોય તો અવશ્ય હર્બલ કોમ્બુચાને અજમાવવી.

કોમ્બુચા ચાના સ્વાસ્થ્યવર્ધક લાભ

પાચનક્રિયાને સુધારવામાં મદદરૂપ : કોમ્બુચા ચામાં ફેનોલિક કમ્પાઉન્ડ સમાયેલું હોય છે. જે હર્બલ ચામાં આથો લાવવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં કેટેચિન હોવાથી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. કોમ્બુચા ચામાં આથો લાવવો અત્યંત આવશ્યક છે. જેથી તે પ્રોબાયોટિક પીણામાં સ્થાન ધરાવે છે. પ્રોબાયોટિક બૅક્ટેરિયાવાળું પીણું કે વાનગી આંતરડાના સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. એક અધ્યયન મુજબ નિયમિત રીતે પ્રોબાયોટિક બૅક્ટેરિયાથી ભરપૂર આહાર લેવાથી પેટ સંબંધિત સમસ્યા જેમ કે વારંવાર ઝાડા છૂટી પડવા, અપચો, ગેસ, પાચનતંત્ર ઉપર સોજાને કારણે પેટમાં દુખવું, વારંવાર ચૂક આવવાની સ્થિતિથી રાહત અપાવે છે. મેટાબોલિક રેટ સુધારવામાં મદદ કરે છે.

ઍન્ટિ ઓકિસડન્ટથી ભરપૂર : કોમ્બૂચા હર્બલ ચાનો સૌથી વિશેષ ગુણ જોઈએ તો તે ઍન્ટિઓકિસડન્ટથી ભરપૂર હોય છે. ઍન્ટિ-ઓક્સિડન્ટ પ્રાકૃતિક અણુ હોય છે. જે મુક્તકણોથી લડવામાં મદદ કરે છે. જેને કારણે તે અનેક તીવ્ર તેમ જ જાનલેવા બીમારીના જોખમથી બચાવે છે. આથી નિયમિત રીતે કોમ્બુચા ચાને પીવાથી શરીરમાં પૂરતાં પ્રમાણમાં ઍન્ટિઓક્સિડન્ટની માત્રા વધવા લાગે છે. જેને કારણે તેની ઊણપની સ્વાસ્થ્ય ઉપર થનારી ખોટી અસરથી બચી શકાય છે.

વજનને ઘટાડવામાં ગુણકારી : આ હર્બલ ચામાં પ્રોબાયોટિક સત્ત્વ સમાયેલું હોય છે. જેથી તેનું સેવન કરવાથી વારંવાર ખોરાક લેતાં રહેવાની આદતથી બચી શકાય છે. કેમ કે આ હર્બલ ચાનું સેવન કરવાથી ભૂખ ઉપર નિયંત્રણ આવી જાય છે. જે લાંબે ગાળે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

માનસિક સ્વાસ્થ્ય માટે લાભકારક : કોમ્બુચા ચાનું સેવન કરવાથી શરીરમાં ખાસ શક્તિનો સંચાર થાય છે. જે લાંબેગાળે સતત તાણમાં રહેતી વ્યક્તિને મન શાંત કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસને નિયંત્રિત રાખવામાં લાભકારકઃ કોમ્બુચા હર્બલ ચાનું સેવન કરવાથી ડાયાબિટીસને નિયંત્રિત રાખવામાં લાભકારક મનાય છે. ડાયાબિટીક વ્યક્તિના અગ્નાશયને સુધારવામાં ઉપયોગી ગણાય છે. ડાયાબિટીસ વધી જવાને કારણે શરીરમાં થતી પ્રતિકૂળ ગતિવિધિને ઘટાડવામાં, લિવર તથા શરીરના અન્ય ભાગોની રક્ષા કરવામાં મદદ કરે છે.

ગઠિયાના દર્દમાં ગુણકારી : કોમ્બુચા ચામાં ગ્લુકોસામાઈન નામક ઘટક હોય છે. જે બધા જ પ્રકારના સાંધાના દુખાવાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ગ્લુકોસામાઈન હયાલૂરોનિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. કોમ્બુચા ચાનું સેવન કરવાથી સાંધાના દુખાવાના દર્દથી રાહત મેળવી શકાય છે.

શક્તિવર્ધક ગણાય છે : કોમ્બુચામાં વિટામિન બીની સાથે વિટામિન બી-૧ થિયામિન, બી-૨ રાઈબોફ્લેવિન, બી-૬ પાઈરિડોક્સિન જેવાં પોષક તત્ત્વો સમાયેલાં છે. શરીરને શક્તિપ્રદાન કરે છે. ભોજન દ્વારા ઊર્જા શરીરમાં પરિવર્તિત કરવામાં મદદ મળે છે. પ્રત્યેક મોસમમાં કોમ્બુચાનું સેવન દિવસમાં એક વખત નિયમિત કરવાથી શરીર તાજગી સભર બની જાય છે.

હૃદયની તંદુરસ્તી માટે લાભકારી : કોમ્બુચાનું સેવન કરવાથી હૃદય રોગના ખતરાથી બચી શકાય છે. તેનું મુખ્ય કારણ છે તેમાં સમાયેલું પૉલિફિનોલ્સ તથા ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા. જેને કારણે લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

શરીર ડિટૉક્સ બને છે : 'શરીરે સ્વસ્થ તો સુખી સર્વ વાતે' આપણે બધા જ જાણીએ છીએ કે શરીરના કોઈ અંગમાં નાનો અમથો દુખાવો વ્યક્તિને આકુળવ્યાકુળ બનાવી દે છે. તેથી કોરિયાઈ લોકો શરીરની તંદુરસ્તી માટે તેને વારંવાર ડિટૉક્સ કરવા ઉપર અત્યંત ભાર મૂકે છે. કોમ્બુચા ચામાં ગ્લુકો રોનિક એસિડ સહિત અન્ય કાર્બનિક એસિડ સમાયેલાં હોય છે. જે લિવરની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. શરીરમાં બનતાં વિષેલા પદાર્થોને બહાર કાઢે છે. જેને કારણે શરીર શક્તિવર્ધક બને છે. ■

feedback@bombaysamachar.com
આહારથી આરોગ્ય સુધી
ડૉ. હર્ષા છાડવા

કાર્નિટાઈન - જરૂરી અમીનો એસિડ

કાર્નિટાઈન એક અમીનો એસિડ છે. જે આપણા શરીરમાં પ્રાકૃતિકરૂપથી ઉત્પન્ન થાય છે. જે બધા જ જીવિતોમાં હાજર છે. જે વિવિધ શારીરિક પ્રક્રિયાઓમાં કાર્ય કરે છે. વિશેષરૂપથી વસા અમ્લની અંતકોશિકીય પરિવહનના એક આવશ્યક સહકારકના રૂપમાં છે. આપણા સામાન્ય આહારમાં તે પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. પ્રતિદિન ત્રેવીસથી એકસો પાંત્રીસ મિલીગ્રામ જેટલું મળી રહે છે. આપણું શરીર એક વિશિષ્ટ જેવ સંશ્લેષણ પ્રક્રિયાના માધ્યમથી એક આવશ્યક અમીનો એસિડ લાઈસિનથી કાર્નિટાઈનનું ઉત્પાદન કરે છે. ફેટી એસિડના પરિવહનમાં પોતાની ભૂમિકાને કારણે કાર્નિટાઈન માઈટો કોન્ડ્રીયલ ફેટી એસિડ બી-ઓક્સીકરણ ને માટે મહત્ત્વપૂર્ણ છે. કહેવાય છે કે પૂર્ણ શાકાહારીઓમાં એલ કાર્નિટાઈનની ઓછપ હોય છે. યોગ્ય સંભાળથી સામાન્ય ખોરાકથી જ આની ઓછપ દૂર કરી શકાય છે.

કાર્નિટાઈનની ઓછપ પર લોકોનું ધ્યાન હજુ કેન્દ્રિત નથી. મનુષ્યોમાં એલ-કાર્નિટાઈન જેવ સંશ્લેષણની સામાન્ય દર ૦.૧૬ થી ૦.૪૮ મિલીગ્રામ હોય છે. કાર્નિટાઈનની ઓછપ બે પ્રકારે હોય છે. પ્રાથમિક કાર્નિટાઈનની ઓછપ કોશીકીય, કાર્નિટાઈન ટ્રાન્સપોર્ટર પ્રણાલી અનુવાંશિક વિકાર છે. બ્રેન, કિડની અને લીવરમાં બને છે. ફેટને એનર્જીમાં રૂપાંતર કરે છે. કાર્નિટાઈનની ઓછપથી માંસપેશીઓમાં સોજા કે અકડતા આવવી, દોડવીરમાં આની તકલીફ જણાય છે. વ્યાયામ કે વધુ પડતી કસરત કરતા લોકોને પણ આની તકલીફ જણાય છે. એન્ટીબાયોટિક દવાઓના ઉપયોગના કારણે કાર્નિટાઈનનું ઉત્સર્જન વધી જાય છે, જેના કારણે આની ઓછપ થાય છે. માંસપેશીને મજબૂતી કાર્નિટાઈન એ ઊર્જા સ્રોત છે.

જ્યારે યકૃતમાં ગ્લુકોઝની આપૂર્તિ થાય છે જેથી ઓક્સિકૃત કે ગ્લાઈકોઝનના રૂપમાં સંગ્રહિત નથી કરી શકતું ત્યારે યકૃત અતિરિક્ત ગ્લુકોઝને સક્રિય રૂપમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ બનાવવાના શરૂ કરી દે છે. જેથી મેલોલિ સીઓએની સાંદ્રતા વધી જાય છે. જે ફેટી એસિડ સંશ્લેષણમાં પ્રથમ મધ્યવર્તી છે જેથી કાર્નિટાઈન એસાઈલટ્રોસફેરેજીનું અવરોધ થાય છે. જેથી બીટા ઓક્સિજનનું માઈટ્રોકોન્ડ્રીયલ મેટ્રિક્સમાં ફેટી એસિડનો પ્રવેશ થતો નથી. જેથી ઊર્જા ઉત્પાદનમાં અવરોધ આવે છે.

ચયાપચન સંબંધી વિકારોને રોકવા માટે કાર્નિટાઈનની પર્યાપ્ત માત્રા હોવી જરૂરી છે. શારીરિક પ્રદર્શનની ગુણવત્તા માટે આની પર્યાપ્ત માત્રા જરૂરી છે. પ્રજનન ક્ષમતા માટે વીર્યદ્રવમાં કાર્નિટાઈનની માત્રા સીધા શુક્રાણુની સંખ્યા અને ગતિશીલતા સંબંધિત જરૂરી છે.

વિભિન્ન અધ્યયનમાં જણાયું કે કાર્ડિયોમેટાબોલિક સ્થિતિ ગુણવત્તા માટે જરૂરી છે. હૃદયરોગ અને મધુમેહ સહિત અન્ય વિકાર દૂર કરવા કાર્નિટાઈનની ક્ષમતા વધારવી જરૂરી છે. ગ્લુકોઝ સહિષ્ણુતામાં સુધાર કે રક્ત ગ્લુકોઝના સ્તરને ઠીક રાખવા માટે કાર્નિટાઈનયુક્ત આહાર જરૂરી છે. કિડનીની બીમારીમાં સી-રિએક્ટીવ પ્રોટીનની ઓછપ દૂર કરવા માટે ખોરાક કાર્નિટાઈનયુક્ત હોવો જોઈએ. સામાન્ય ખોરાકથી જ મેળવવો જોઈએ સપ્લિમેન્ટ થોડા નુકસાનદાયક છે. પ્રોટીનયુક્ત આહારનું લયબદ્ધ સેવન જરૂરી છે.

ઘણાં પ્રિ-મેચ્યોર જન્મેલ બાળકોમાં આની ઊણપ જણાય છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય એવમ્ માનવ વિકાસ સંસ્થાને કાર્નિટાઈન એક સશર્ત આવશ્યક પોષક તત્ત્વ પાછળનું વિજ્ઞાન વિશે જણાવ્યું છે કે આહારમાં કેમિકલનો વપરાશ ન હોય તેવો આહાર જરૂરી છે. વિભિન્ન પ્રકારના ડેરી પ્રોડક્ટસ જે પ્રાકૃતિક હોય તે લેવા જરૂરી છે. ડેરી પ્રોડક્ટસમાં સ્વાભાવિકરૂપથી કાર્નિટાઈન હોય છે. સમુદ્ર પાસે ઊગતી ખાવાલાયક વનસ્પતિનો ઉપયોગ જરૂરી છે. મોરશ ભાજી, લૂણી ભાજી, વોટરક્રર ભાજી જે સમુદ્રની પાસે ઊગે છે. બિન્સ વિવિધ પ્રકારના મળી રહે છે. જેમાં શરીરની જરૂરિયાતનું પ્રોટીન મળી રહે છે જે સ્વાભાવિકરૂપથી કાર્નિટાઈન બનાવે છે. વટાણા પ્રોટીનનો સંપૂર્ણ સ્ત્રોત છે. સૂકો મેવો તેમ જ અન્ય બીજ ખાવામાં ઉપયોગ કરવો જરૂરી છે. અનાજને જાડું પીસી તેના દલિયાનો ઉપયોગ કરવો. પાલકને મુખ્ય રાખવી. ડ્રાયયિસ્ટ નાખી હોલવીટ બ્રેડ ઘરે બનાવવા. મશરૂમ એ પ્રોટીનનો ગુણવત્તાવાળો સ્ત્રોત છે. બીટ-બીટના પાન, કેળા, એપલ, ગ્રીન એપલ, મકાઈ, પીળા કેપ્સીકમ જેવા આહારમાં લેવા જરૂરી છે. સાત્ત્વિક આહાર લેવો જરૂરી છે.

કાર્નિટાઈન યુક્ત આહાર શારીરિક ક્ષમતા માટે જરૂરી છે. યોગ્ય આહારનું આયોજન કોઈપણ ઊણપથી દૂર રાખે છે. આજકાલની જીવનશૈલી એ બાહ્ય ખાનપાન પર આધારિત છે જેના કારણે ઘણી ઊણપો શરીરમાં દેખાય છે. ■

feedback@bombaysamachar.com
આરોગ્ય પ્લસ
સંકલનઃ સ્મૃતિ શાહ-મહેતા

આ તાવ વળી શું બલા છે...?



આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય કે, જેને જીવનમાં ક્યારેય તાવ આવ્યો જ ન હોય! તાવ એ સર્વત્ર વ્યાપક વ્યાધિ છે. પરંતુ ખરી રીતે જોતા તાવ એ શરીરમાં જમા થયેલ વધારાના ઝેરી તત્ત્વોને બહાર કાઢવાની એક પ્રક્રિયા છે, પરંતુ આજકાલ આપણે તાવથી એટલા બધા ભયભીત થઈ જઈએ છીએ કે, તાવ આવવાની સાથે જ તેનાથી બચવા માટે તરત જ દવાઓનો આશરો લઈ શરીર પર દવાઓનું આક્રમણ કરીએ છીએ, જેનાથી બે નુકસાન થાય છે.

(૧) આપણી રોગપ્રતિકારક શક્તિ ગમે તેવા રોગ સામે લડવા માટે કુદરતી રીતે સક્ષમ છે. તેમ જ તે બહારથી શરીરમાં આવેલ ગમે તેવા જીવાણુ -વિષાણુ કે ચેપીજંતુઓનો નાશ કરવા માટે કૃત્રિમ દવાઓ કરતાં અનેકગણી તાકાત ધરાવે છે. આપણું લીવર જ અનેક દવાઓ ઉત્પન્ન કરતી રાસાયણિક ફેકટરી છે, પરંતુ આપણે ભગવાનની આ અદ્ભુત ભેટનો બહિષ્કાર કરીને માત્ર બાહ્ય દવાઓથી તાવને રોકવા મથીએ છીએ, પણ આ જ દવાઓ રોગપ્રતિકારક શક્તિને કોઈ પણ પ્રકારના રોગ સામે લડવા માટે સક્ષમ રહેવા દેતી નથી.

(૨) આયુર્વેદના મતે ચેપ (ઈન્ફેકશન)થી શરીરમાં તાવ અમુક સમયે જ થતો હોય છે, પરંતુ મોટા ભાગે તાવ રસધાતુમાં ભેગા થયેલ 'આમ' (ઝેરી તત્ત્વો)ના કારણે જ થાય છે.

અર્થાત્: મિથ્યા આહાર-વિહારથી પ્રકુપિત થયેલા દોષો આમાશયમાં આશ્રય કરીને રસની સાથે સંપૂર્ણ શરીરમાં જાય છે અને કોષ્ઠાગ્નિને બહાર કાઢીને જ્વરની ઉત્પત્તિ કરે છે.

શરીરમાંથી જેવા આ ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય કે તરત જ તાવ શમી જાય છે. જોકે આપણે દવાઓના અતિરેકથી માત્ર તાવના બાહ્ય લક્ષણોને જ દૂર કરતા હોઈએ છીએ, આના કારણે શરીરમાં ભેગો થયેલો 'આમ' તો એમ ને એમ જ રહે છે. આ કારણે તે સંચિત થયેલો 'આમ' ફરી ગમે ત્યારે તાવ જેવી કોઈ પણ બીમારીરૂપે પ્રગટ થાય છે.

આવી રીતે 'આમ'ના કારણે તાવ આવે તે દરમિયાન આહાર લેવામાં વિવેક હોવો જોઈએ, તે વિવેક વિના આહાર લેવામાં આવે તો તે આહાર જ શરીરમાં જમા થયેલ 'આમ'ને દૂર કરવામાં નડતરરૂપ થાય છે, કેમ કે આહારને લીધે તો શરીરમાં 'આમ' બન્યો હોય છે...! માટે તાવ આવે ત્યારે આહાર લેવામાં આ મુજબ વિવેક રાખવો... :

* તાવનો પ્રાથમિક ઉપચાર તો શરીરને આહારથી દૂર રાખી ઉપવાસ કરવો તે છે. અર્થાત્: તાવમાં પ્રથમ ઉપવાસ કરવો, મધ્યમાં પાચન કરવું (યોગ્ય પાચન થાય તેવો હળવો આહાર લેવો) અને તાવના અંતમાં રેચન આપવું (પેટ સાફ કરવું) - આ તાવની ચિકિત્સા છે.

* ઉપવાસથી શરીર જેવું 'આમ' રહિત થાય છે, તેવું અન્ય કોઈ ઉપચારોથી થતું નથી.

* જો કોઈ પણ કારણોસર ઉપવાસ ન થઈ શકે તો સૂપ અને ફળોના રસ ઉપર રહેવું. લીંબુ અને મીઠાયુક્ત પાણી, એકદમ ઓછી ખાંડ નાખીને લઈ શકાય.

* દરમ્યાન ગરમ કરેલું હૂંફાળું પાણી જ પીવું.

* મેંદાની વાનગીઓ, ચરબીવાળા, ગળ્યાં, તીખા કે તળેલા પદાર્થો તેમજ ઠંડાં પીણાં વગેરેનો સદંતર ત્યાગ રાખવો.

* દારૂ, ચા, કોફી, સોડા વગેરે નશીલા પદાર્થોનો પણ ત્યાગ કરવો જોઈએ.

* તાવ ઉતર્યા બાદ પ્રથમ બે દિવસ મગનું ઓસામણ કે સૂપ લેવું. ત્યાર પછી અર્ધપ્રવાહી આહાર લેવો અને તે પછી નક્કર ખોરાક લેવાની શરૂઆત કરવી.

સાવધાની

તાવનું યોગ્ય નિદાન આવ્યા બાદ અહીં દર્શાવેલ પ્રાથમિક ઉપચારોનો ઉપયોગ કરવો. જો વધુ પ્રમાણમાં તાવ હોય તો ચિકિત્સકના માર્ગદર્શન પ્રમાણે સારવાર કરવી.

આધુનિક સાયન્સ મુજબ મોટા ભાગના તાવ જીવાણુ, વિષાણુ કે ચેપીજંતુના કારણે આવતા હોય છે, જેમકે....

જીવાણુ	વિષાણુ	ચેપીજંતુ
ટાઈફોઈડ	શરદી-કફનો તાવ	મલેરિયા
	ડેન્ગ્યૂ	
ન્યુમોનિયા (મોટા ભાગે)	ન્યુમોનિયા	

શરદી-કફનો તાવ

* લક્ષણઃ
* ઝીણો તાવ આવવો.
* શરદી (નાક બંધ થઈ જવું અથવા નાકમાંથી પાણી પડવું.)
* છીંકો આવવી, ગળામાં દુઃખાવો, ઉધરસ થવી, શરીર તૂટવું વગેરે.
* કારણઃ
* મોટા ભાગે શરદી-કફ વધવાથી થતા ચેપને લીધે થાય છે.
* આવે વખતે શું આહાર લેવો ?
* શક્ય હોય ત્યાં સુધી માત્ર ઉકાળેલું પાણી લઈ એક-બે ઉપવાસ કરવા. જો ઉપવાસ થઈ શકે તેમ ન હોય તો તાવ રહે તેટલા દિવસ માત્ર પ્રવાહી પર રહેવું. જેમ કે, ફ્રૂટજ્યૂસ, સૂપ, ઓસામણ વગેરે.
* ગળ્યું, ચીકણું તથા ભારે ન ખાવું.
* અતિ ઠંડા પાણી કે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ન કરવો.

સાવધાનીઃ

* દર્દીએ ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક આગળ રૂમાલ કે હાથ રાખવો, જેથી વાઇરસના જંતુઓનો બીજાને ચેપ ન લાગે.
* દર્દીએ વાપરેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ બીજાએ ન કરવો.
* દર્દીએ પોતાના હાથને વારેવારે ધોવાનો આગ્રહ રાખવો. જેથી હાથ જંતુરહિત થાય અને બીજી કોઈ જગ્યાએ જંતુ ન ફેલાય.
* ઉપચારઃ

૧) કોઈ પણ જાતનો તાવ આવ્યો હોય તો ૧૦ ગ્રામ મીઠું ગરમ પાણીમાં દિવસમાં ૩ વાર લેવાથી તાવમાં રાહત થાય છે.

૨) ફુદીનો, તુલસી અને આદુનો ઉકાળો પીવો.

૩) તુલસીના રસ અને મધ સાથે ૧-૧ ચમચી આદુ ને લીંબુનો રસ લેવો.

૪) તુલસી અને સૂરજમુખીના પાન વાટીને તેનો ૨૫ મિ.લી. જેટલો રસ પીવાથી બધી જાતના તાવમાં રાહત થાય છે.

૫) ૧૦ ગ્રામ ધાણા અને ૩ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવું.

૬) ૭ પાન તુલસીના, ૭ પાન ફુદીનાના, ૧ ગ્રામ મરીની ભૂકી, ૧૦ ગ્રામ ગોળને ૧ કપ પાણીમાં ઉકાળી, તેને ગાળીને સવાર-સાંજ પીવું.

૭) હળદર, સૂંઠ, મરી અને તુલસીના પાનનું ૫ ગ્રામ જેટલું ચૂર્ણ ગરમ પાણીમાં કે મધ સાથે લેવું. ■



ત્રાટકથી શું થાય છે?

feedback@bombaysamachar.com

તંદુરસ્તી-મનદુરસ્તી

ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

૫. સાવચેતીઃ

૧. આંખ પર અનાવશ્યક દબાણ કે તણાવ ન આવે તેની કાળજી રાખવી.

૨. મન ઉપર પણ દબાણ ન આવે તેની કાળજી રાખો. ત્રાટક એક આનંદદાયક અભ્યાસ બની રહેવો જોઈએ, ત્રાસદાયક નહીં.

૩. અભ્યાસ ધીમે ધીમે વધારવો જોઈએ. ઉતાવળ કરવામાં જોખમ છે.

૪. ત્રાટકનો અભ્યાસ દૃષ્ટિશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ માટે છે. એ સિવાય અન્ય મલિન હેતુ માટે ત્રાટકનો અભ્યાસ ન કરવો.

૫. જેમને આંખની તકલીફ હોય તેમણે ત્રાટકનો અભ્યાસ ન કરવો.

૬. સમયઃ

૧. રાત્રિની શાંતિમાં ત્રાટકનો અભ્યાસ વધુ ઉપકારક બને છે.

૨. દસ મિનિટથી માંડીને રોજ એક મિનિટ વધારતા જાઓ. આ રીતે ત્રાટકનો અભ્યાસ બે કલાક સુધી પહોંચાડી શકાય છે. બે કલાક સુધી પહોંચ્યા પછી એકાદ વર્ષમાં ત્રાટક સિદ્ધ થાય છે, એવી પરંપરાગત માન્યતા છે.

૭. ત્રાટકમાં વિઘ્નોઃ

૧. ઘણીવાર ત્રાટકમાં ઊંઘ બાધારૂપ બને છે.

૨. મનની ચંચળતા-વિચારોની સાંકળ ત્રાટકમાં બાધારૂપ બને છે.

૩. કંટાળો એ પણ ત્રાટકમાં એક વિઘ્ન છે.

૪. ત્રાટક એક યાંત્રિક ક્રિયા બની જાય તો પ્રગતિ અટકી જાય છે. એ એક જીવંત પ્રક્રિયા બની રહેવી જોઈએ.

૫. ઘણા સાધકો કોઈને કોઈ કારણોસર ત્રાટકનો નિયમિત અભ્યાસ કરતાં નથી. અનિયમિતતા બાધારૂપ છે.

આ પાંચે વિઘ્નોમાંથી મુક્ત રહી શ્રદ્ધા અને ધૈર્યપૂર્વક લાંબા સમય સુધી ત્રાટકનો અભ્યાસ કરવામાં આવે તો તે સિદ્ધ કરી શકાય છે.

૮. ત્રાટકથી શું થાય છે?

૧. એકાગ્રતાથી શક્તિ વધે છે.

૨. ધ્યાનમાં પ્રવેશ થાય છે.

૩. સંકલ્પ શક્તિ વધે છે.

૪. ચક્ષુનું શોધન થાય છે. આંસુ બહાર આવવાથી ચક્ષુના મળ નીકળી જાય છે અને દૃષ્ટિ પરિશુદ્ધ થાય છે.

૫. ચિત્તનું શોધન થાય છે. અજાગૃત મનનાં સંસ્કારો ઉપર આવે છે અને તેમનું વિરેચન થાય છે. પરિણામે ચિત્તશુદ્ધિ થાય છે.

૬. ત્રાટકના અભ્યાસથી કેટલીક વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ સાધકે તેના રવાડે ચડવું નહીં.

૯. શાસ્ત્રમાં ત્રાટકઃ

निरीक्षेन्निश्चलदृशा सूक्ष्मलक्ष्यं समाहितः।

अश्रु सम्पात पर्यन्तमाचार्यैस्त्राटकं स्मृतम् ।। ह. प्र. २, ३२

સ્થિર દૃષ્ટિથી, એકાગ્ર થઈને સૂક્ષ્મલક્ષ્યને ત્યાં સુધી જોવું જોઈએ જ્યાં સુધી આંખમાંથી આંસુ બહાર ન આવે. આચાર્યોએ આ ક્રિયાને ત્રાટક કહેલ છે.

૬. જલનેતિ

૧. નામઃ

આ ક્રિયામાં જલ દ્વારા નાકની અંદરના ભાગનું શોધન કરવામાં આવે છે તેને જલનેતિ કહે છે.

૨. પદ્ધતિઃ

૧. એક નાળચાવાળો પ્યાલો લો. નવસેકું પાણી લો. તેમાં થોડું મીઠું ઉમેરો. પ્યાલો આ પાણીથી ભરો.

૨. ઊભા રહીને કે ઊભડક પણે બેસીને આ ક્રિયા કરી શકાય છે.

૩. કોઈપણ એક નસકોરાની અંદર પ્યાલાનું નાળચું ગોઠવો. મસ્તક સહેજ આગળ વાળો. જે બાજુના નસકોરામાં નાળચું ગોઠવ્યું હોય તેની વિરુદ્ધ દિશામાં મસ્તક ધીમેધીમે ત્રાંસુ વાળો.

૪. પ્યાલો ધીમે ધીમે ઊંચો કરો. પાણી ધીમે ધીમે બીજા નસકોરામાંથી આવવા લાગશે. પ્યાલો ધીમેધીમે ઊંચો કરતા જાઓ અને મસ્તક ત્રાંસુ કરતાં જાઓ. પાણીની ધારા એકધારી રહે તે જુઓ.

૫. આ ક્રિયા દરમિયાન મુખ ખુલ્લું રાખો, જેથી શ્વાસોચ્છ્વાસ મુખથી ચાલ્યા કરે.

૬. આજ રીતે જલનેતિ બીજી બાજું પણ કરો.

૭. બંને બાજુથી આ રીતે શોધન કર્યા પછી નાક બરાબર સાફ કરો. નાકમાંનું બધું પાણી બહાર નીકળી જાય તે આવશ્યક છે. માથું આગળ નમાવી, બંને બાજુ વારા ફરતી ત્રાંસુ કરી પાણી બહાર આવવા દો પછી નાક છીંકારીને સાફ કરો. આંખ પર ઠંડું પાણી છાંટો. મુખ સાફ કરો. થોડી કપાલભાતિ કરો.

૩. વિશેષ નોંધઃ

૧. પ્રારંભમાં ઠંડા પાણીથી નેતિ કરવી નહીં. પાણી બહુ ગરમ પણ ન હોવું જોઈએ. ઠંડા પાણીથી જલનેતિ કરવાથી શરદી થવાનું જોખમ છે. જો વધુ ગરમ પાણી હોય તો નાકમાં બળતરા થાય છે. તેથી પાણી સહેજ નવસેકું જ હોય તે આવશ્યક છે. અનુકૂળ હોય તો લાંબા અભ્યાસ પછી ઠંડા પાણીથી જલનેતિ કરી શકાય છે.

૨. નેતિ માટેનો પ્યાલો સ્વચ્છ રાખવો જોઈએ. પ્રારંભમાં અને અંતે ગરમ પાણીથી સાફ કરવો અને ધૂળ વગેરે ન લાગે તેવી સ્વચ્છ જગ્યાએ મૂકવો.

૩. જલનેતિમાં સામાન્યતઃ બંને બાજુથી ૧૦૦ સી.સી. પાણી પસાર થવું જોઈએ.

૪. જલનેતિથી શું થાય છે?

૧. આંખનું સ્વાસ્થ્ય જળવાય રહે છે.

૨. શીરદર્દમાં રાહત આપે છે.

૩. નાકના મસાને દૂર કરે છે.

૪. નાક બંધ થઈ જવાની ફરિયાદ દૂર કરે છે.

૫. દુગ્ધ નેતિઃ

કોઈ જાણકારના માર્ગદર્શન હેઠળ, વિશેષ હેતુ માટે પાણીને બદલે દૂધ લઈને પણ નેતિ કરવામાં આવે છે. આ ક્રિયાને દુગ્ધનેતિ કહે છે. (ક્રમશઃ)■

બદામથી લઈને અંકુરિત કઠોળ કેવી રીતે ખાવા?

feedback@bombaysamachar.com

વિશેષ

અનંત મામતોરા

તમે તમારા આહારમાં ફળોથી લઈને શાકભાજી, સૂકા ફળો અને અનાજ સુધી બધું જ શામેલ કરો છો, પરંતુ તેમ છતાં, કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થાય છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે તમે આ ખોરાક યોગ્ય રીતે ન ખાતા હોવ. તો, ચાલો બદામથી લઈને અંકુરિત કઠોળ અને અનાજ સુધી ૧૦ અલગ અલગ ખોરાક ખાવાની યોગ્ય રીત શીખીએ.

સ્વસ્થ રહેવા માટે આપણને પોષક તત્વોની જરૂર હોય છે, જે આપણને ખોરાકમાંથી મળે છે, તેથી આપણા આહારમાં વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે. ખોરાક આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફળોથી લઈને શાકભાજી, અનાજ, ડેરી ઉત્પાદનો અને બદામ અને બીજ, જો આપણે આપણા આહારમાં સંતુલિત અને યોગ્ય રીતે શામેલ કરીએ, તો તે આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. જો કે, જો આપણે આ ખોરાક ખાવાની યોગ્ય રીત જાણતા નથી, તો આપણને તેમને જરૂરી સંપૂર્ણ પોષણ મળતું નથી.

દરેક શાકભાજી, ફળ, અનાજ અથવા સૂકા ફળમાં વિવિધ પોષક તત્વો હોય છે અને શરીર પર તેની અલગ અલગ અસર પડે છે. દરેક ખોરાક ખાવાનો યોગ્ય સમય અને પદ્ધતિ જાણવાથી શ્રેષ્ઠ ફાયદા થઈ શકે છે અને તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવી શકાય છે. આ લેખમાં ૧૦ એવા ખોરાકની શોધ કરવામાં આવશે જે તમારે ખાવાની યોગ્ય રીત જાણવી જોઈએ.

મગફળી કેવી રીતે ખાવી સારી ?

શેકેલા, ગરમ મગફળી શિયાળાનો આનંદ બમણો કરે છે. એક સામાન્ય ભૂલ એ છે કે તેના છાલ કાઢીને તેને છોલી નાખવામાં આવે છે. મગફળીની છાલમાં એન્ટીઑક્સિડન્ટ પણ હોય છે. ગંગા રામ હોસ્પિટલના સિનિયર ડાયેટિશિયન ફરેહા શનમ સલાહ આપે છે કે મગફળી હંમેશા પરંપરાગત રીતે ખાવી જોઈએ; પેક્ડ મસાલેદાર મગફળી બજારમાં વધુ સામાન્ય બની રહી છે, જે ટાળવી જોઈએ.

ટામેટાં કેવી રીતે ખાવા જોઇએ?

વિટામિન સીથી ભરપૂર, ટામેટાં કાચા અથવા રાંધેલા ખાઈ શકાય છે. જો કે જો તમારું શરીર એસિડિક હોય, તો તમારે કાચા ટામેટાં ખાવાનું ટાળવું જોઈએ. ટામેટાં ટાળવા જોઈએ, ખાસ કરીને રાત્રે કારણ કે તે એસિડ રિફ્લક્સનું કારણ બની શકે છે.

બ્રોકોલીને કેવી રીતે ખાવી વધુ સારી?

જો તમે તમારા આહારમાં બ્રોકોલીનો સમાવેશ કરો છો, તો તેને ઉકાળવાને બદલે વરાળથી બનાવવું વધુ સારું છે, અથવા તમે તેના પોષક તત્વોને જાળવવા માટે તેને થોડું બ્લેન્ચ કરી શકો છો.

ચિયા બીજ કેવી રીતે ખાવા ?

જો તમે તમારા આહારમાં ચિયા બીજનો સમાવેશ કરી રહ્યા છો, તો તેમને પાણીમાં પલાળી રાખવાનું ટાળો. આનાથી પેટ ફૂલી શકે છે. ચિયા બીજને થોડા કલાકો સુધી પલાળી રાખ્યા પછી હંમેશા તેનું સેવન કરો.

અનાજ સાથે ઘી ખાઓ

જો તમે બાજરી, મકાઈ, જુવાર અને રાગી જેવા અનાજ ખાતા હોવ, તો તેમાં થોડું ઘી ઉમેરવાનું ભૂલશો નહીં. આ કબજિયાત અટકાવવામાં મદદ કરે છે. આ અનાજ પ્રોટીનથી ભરપૂર હોય છે, પરંતુ તેમાંથી બનેલી રોટલી ખાવાથી પચવામાં થોડી તકલીફ પડે છે, તેથી તેને ઘી સાથે ખાવું શ્રેષ્ઠ છે.

બદામ ખાવાની યોગ્ય રીત

જો તમે સફરમાં બદામ ખાતા હોવ, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. નિષ્ણાતો બદામના સંપૂર્ણ ફાયદા મેળવવા માટે બદામને રાત્રે પાણીમાં પલાળી રાખવાની અને સવારે ખાલી પેટે તેને છોલીને ખાવાની ભલામણ કરે છે. પલાળેલી અને છોલેલી બદામ ખાવાથી પોષક તત્વો વધુ સારી રીતે શોષાય છે અને તેનું પાચન સરળ બને છે. પલાળવાથી છાલમાંથી ટેનીન અને એન્ઝાઇમ અવરોધકો દૂર થાય છે. લિંગ, તબીબી સ્થિતિ અને ઉંમરના આધારે ડોઝ ધ્યાનમાં લેવો જોઈએ.

સ્પ્રાઉટ્સ કેવી રીતે ખાવા?

મોટાભાગના લોકો સ્પ્રાઉટ્સ કાચા ખાય છે, પરંતુ આનાથી ક્યારેક પેટમાં ચેપ લાગી શકે છે. સ્પ્રાઉટ્સને વિકસિત થવામાં બે થી ત્રણ દિવસ લાગે છે, અને આ સમય દરમિયાન બેક્ટેરિયા વધી શકે છે. સ્પ્રાઉટ્સને ખાતા પહેલા હંમેશા બાફવું અથવા બ્લેન્ચ કરવું જોઈએ. આનાથી તેમને પચવામાં સરળતા રહે છે.

શણના બીજ કેવી રીતે ખાવા?

શણના બીજ ઓમેગા-૩ થી ભરપૂર હોય છે, પરંતુ તેમને ખાતી વખતે, તેમને પલાળી રાખવાનું અથવા પીસવાનું યાદ રાખો. આ તેમના પોષક તત્વોને મહત્તમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

સફરજન ખાવાની યોગ્ય રીત

ઘણા ફળો અને શાકભાજીમાં છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફરજન એક એવું ફળ છે જેની છાલ પોષક તત્વોનો ભંડાર છે. કેટલાક લોકો તેને છોલીને ખાય છે, પરંતુ સફરજનને છાલ સાથે ખાવાનું હંમેશા ફાયદાકારક છે.

હળદરવાળુ દૂધ ક્યારે પીવું વધું સારુ?

લોકો ઘણીવાર સૂતા પહેલા હળદરનું દૂધ પીવે છે, જે ઊંઘ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે જો તમને જઠરાંત્રિય સમસ્યાઓ હોય, તો તમારે રાત્રે હળદરનું દૂધ પીવાનું ટાળવું જોઈએ અથવા તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ■

હાફ કૂક ફૂડનો ટ્રેન્ડ આરોગ્ય માટે કેટલો જોખમી?

feedback@bombaysamachar.com

ફોકસ

નિધિ ભટ્ટ

આજના ઝડપી જીવનમાં દરેક માણસ સમય બચાવવાની દોડમાં છે. ખાસ કરીને નોકરી અને ઘરના કામ વચ્ચે સંતુલન જાળવતા લોકો સહજ રીતે ઇન્સ્ટન્ટ, રેડી ટુ કૂક અથવા હાફ કૂક ખોરાક તરફ આકર્ષાય છે. હાલ્ફ કૂક ફૂડ એટલે કે જે ફૂડને અડધું રાંધવામાં આવે અને ત્યાર બાદ તેમાં પ્રિઝર્વેટીવ એડ કરી વેચવામાં આવે. બજારમાં તૈયાર મસાલા, પરાઠા, મોમોસથી લઈને નાસ્તા, શાક, સૂપ સુધી અસંખ્ય વિકલ્પો ઉપલબ્ધ છે. આવા ખોરાક બનાવવા સરળ છે, ગેસ ઓછો વપરાય અને સ્વાદ પણ સરસ આવે છે એટલે મોટેભાગે લોકો તેની તરફ દોડી રહ્યા છે, પરંતુ શું આ સગવડતા પાછળ કોઈ જોખમ છુપાયેલું નથી? આ સગવડતા કેટલી હેલ્થી છે?

અડધા રાંધેલા ખોરાકમાં છુપાયેલું જોખમ

હાફ કૂક ફૂડનું સૌથી મોટું જોખમ છે બેક્ટેરિયા. યોગ્ય તાપમાન પર સંપૂર્ણપણે ન રાંધાતા ખોરાકમાં Salmonella, E.coli જેવા બેક્ટેરિયા રહી શકે છે જે ફૂડ પોઈઝનિંગથી લઈને પેટમાં દુખાવો, ડાયરિયા અને તાવ જેવી સમસ્યાઓ ઊભી કરે છે. ખાસ કરીને હાફ કૂક નોનવેજ, ઈંડા અને દરિયાઈ ખોરાક તો શરીરની રોગપ્રતિકારક શક્તિ પર સીધી અસર કરે છે.

બીજુ જોખમ છે પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સ. Ready-to-eat અથવા ready-to-cook ફૂડની Shelf life વધારવા માટે તેમાં વધારે પ્રમાણમાં કેમિકલ્સ ઉમેરવામાં આવે છે જે

લાંબા ગાળે લીવર, કિડની તેમજ હોર્મોનલ સિસ્ટમને અસર કરે છે.

મસાલા અને તેલનો ઓવરડોઝ

આવા ખોરાકમાં લગભગ બધામાં જ વધુ મીઠું, વધુ તેલ અને વધુ મસાલા હોય છે જેથી પ્રોડક્ટ ચાખવામાં વધુ મઝેદાર લાગે, પરંતુ સતત આવા ખોરાક લેવાની આદત હાઈ બીપી, હાર્ટ અટેક અને ઓબેસિટી સુધી લઈ જઈ શકે છે.

બાળકો પર ડાયરેક્ટ અસર

આજકાલ બાળકોમાં જન્ક ફૂડ, નૂડલ્સ, નૃગેટ્સ, મોમોસ જેવી વસ્તુઓ ખાવાની ટેવ વધી રહી છે. માતા-પિતા પણ ટાઈમના કારણે તેમને સહજ રીતે રેડી ફૂડ સર્વ કરી દે છે. પરિણામે બાળકોમાં આયર્નની ખામી, પાચન સમસ્યા અને કમજોર રોગપ્રતિકારક શક્તિ જોવા મળે છે.

* હાફ કૂક ખાવાનું ટાળો, સંપૂર્ણ રાંધો.
* ખોરાક હંમેશાં સારી રીતે રાંધો.
* ખાસ કરીને ચિકન, ઈંડા, ફિશ ક્યારેય અર્ધારાંધેલાં ના જમો.
* ફ્રોઝન પેકેટ ખોરાકને સારી રીતે ગરમ કરો.
* બાળકોને શક્ય તેટલો ઘરેલુ તાજો ખોરાક આપો.

હાફ કૂક ફૂડ સગવડ છે, પરંતુ આરોગ્ય કરતાં સહેલાઈ મોટી નથી. થોડો સમય વધારે કાઢીને પણ તાજું ઘરે રાંધેલો ખોરાક બનાવવા અને ખાવાની આદત આરોગ્ય માટે લાંબી ઇન્વેસ્ટમેન્ટ સાબિત થાય છે. યાદ રાખો ખોરાક માત્ર પેટ પૂરવા નથી, શરીરને સ્વસ્થ રાખવા હોય છે. ■

feedback@bombaysamachar.com

મોજની ખોજ

સુભાષ ઠકર

અહી નામ નઈ બદનામ થવા પણ ધક્કામુક્કી થાય છે...

મારું નામ કેવી રીતે પડ્યું?

શરીરથી સૌથી નજીક આપણુ નામ હોવા છતાં એ નામ આપણને જ પાડવા ન મળે તો દુખના ડુંગરા તૂટી ન પડે? જોકે એનાથી નાનકડી ટેકરીયે તૂટી પડતી નથી. આ તો મારું ચાલતું નથી બાકી મારું ચાલે તો જન્મ્યા પછી થોડા વખતે હું જાતે જ બધાને નામ પાડવાનો અધિકાર આપું. અરે, જે નામ આ શરીરનું વળગણ બની જાય, જે નામ પર જિંદગીનો હિસાબ ચાલુ થાય, જે નામથી જ નામના કમાવાની હોય, એ નામ સગાંવ્હાલાં પાડે? ધિક્કાર છે આવા જીવનને.

સાચુ કઉ? એ લોકો પહેલાં નામ પાડે ને પછી આપણને. શરૂ શરૂમાં મારું નામ પાડવા માટે આખા કુટુંબમાં પડાપડી થઇ. મારું જીવન ને મારું શરીર હોવા છતાં એક નોકરી માટે ૫૦૦ અરજી આવે એમ નામના જથ્થાબંધ સૂચન આવ્યા. નામકરણના દિવસે કુટુંબના બધા સભ્યો ગહન ચિંતનમાં ઊતરી પડ્યા.

ત્યાં જ મારા દીનુમામાનો મોબાઈલ રણક્યો

'હેલો દિનુભાઈ, બાજુમાંથી ચંબુલાલ સ્પીકિંગ... મારા દીકરાનું નામકરણ છે.'

'અરે વાહ... અમે ચોક્કસ આવશું. પણ ક્યારે છે?' મામાએ પૂછ્યું.

'શું ક્યારે છે? અને તમે શું કામ આવશો?.'

'અરે પાડોશી તરીકે એટલો તો હરખ કરવા...'

'અરે તમે સમજ્યા લાગતા નથી આ તો હમણાં નવા પાડોશી તરીકે રહેવા આવ્યા છીએ એટલે વાઈફે કીધુ કે દીનુભાઈને જણાવી દો કે દીકરાનું નામકરણ છે ને દીકરીનું નામ સ્મિતા છે. કઈ કામ પડે તો.'

'તારી જાતના ચંબુડા, અહીં નામકરણના અવસરે તું મગજની મેથી નઈ માર' મનમાં બોલી મામાએ ફોન કટ કર્યો.

એ દિવસે મારું નામ પાડવા મારા કુટુંબીજનો સાથે જેને દુશ્મનાવટ હતી એ લોકો બદલાની ભાવનાથી મારું નામ કંસ, રાવણ કે દુર્યોધન, હિટલર જેવા એ જમાનામાં દુર્લભ નામનું સૂચન કરતા. વળી મારા ઘરનો સિનિયર સિટિઝન વિભાગ તો મારું નામ અંબાલાલ કે મણીલાલ રાખવાના મૂડમાં આવી ગયેલો, પણ મારા ઘરના બીજા મજબૂત મેમ્બરોએ દલીલ કરી કે આવા નામથી હું ડાયરેક્ટ વડીલ તરીકે પેદા થયો હોઉ એવો હાઉ ઊભો થશે. અંતે સાત વિરુદ્ધ ત્રણથી આખો પ્રસ્તાવ ઉડી ગયો. આજે પણ આવા નામો આઉટ ઓફ સ્ટોકમાં છે. અરે બોસ, કેટલાયે તો મારો ચહેરો જોઈ ટોમી ને મોતી જેવા નામ કીધા ત્યારે મને કાળજે કેવા ઘા વાગ્યા હશે. અરે, જેને કોઈ વાતમાં જરાપણ ટપ્પી ન પડે એવા એલણપ્પુઓ, આશારામ, રામ-રહીમ કે રામપાલ જેવા નામનો આગ્રહ કરવા લાગ્યા. હવે તમે જ બોલો મારા નામમાં ક્યાંય 'રામ' આવ્યું. તો મારી ઈજ્જતના મળ્યા પહેલાં ધજાગરા થાય કે નઈ?

વળી મારા ફૂવાએ સંસ્કૃતમાં વિશારદ પાસીંગ માર્કથી કર્યું હોવાથી મારું નામ 'હસ્તકમળદંડ પદમપ્રકાશમ પરીપુંડ પરીપત્રિકા' રાખવાનું કીધુ ત્યારે મારું આખું કુટુંબ ડઘાઈ ગયુ. બધાના મોઢા કોઈને તાજેતાજા સ્મશાને મૂકી આવેલા ડાઘુ જેવા થઇ ગયા, પણ ફૈબા સિવાય કોણ લમણે લાગે.

આખું નામ ગોખવામાં મહિનો લાગે ને બોલવામાં અઠવાડીયું લાગે એવુ બોરીવલીથી અંધેરી જેવડું નામ યાદ કોને રહે? છેવટે ખુદ ફઈબાએ જ રોજની જેમ ફૂવાને તતડાવ્યા :

'તમે તો નામ પાડવા બેઠા છો કે સંસ્કૃતનો શ્લોક શીખવાડો છો? નામ પાડવાનો અધિકાર આપણો છે પણ બોલવામાં સરળ, સુંદર ને કાનને ગમે એવું મીઠડું હોવું જોઈએ. આ નામનો અર્થ શું?'

'અરે અર્થને તારે ધોઈ પીવો છે ? સિમ્પલ વાત સમજ. અહી અનામી બની જનમવાનુ, નામી બની જીવવાનું, ને નનામી બની ઉપર મૂળ ગામે નીકળી જવાનું. સમજી?'

અંતે ખૂબ માથાકૂટ પછી ભવિષ્યમાં મારી ભાષા મધુર હશે એ આશાએ સર્વાનુમતે મારું નામ પાડ્યું 'સુભાષ'. પછી આ શરીર મોંઘવારીની ગતિએ વધવા લાગ્યું. બચપન સરકવા લાગ્યું યૌવન ફરકવા લાગ્યું... સમય અને જિંદગીને પોઝનું બટન નથી. વર્તમાન ભૂતકાળ બનતો ગયો ને ભવિષ્યકાળ વર્તમાન બનતો ગયો પછી મારા શરીરની ઉંચાઇ કરતા મારી ઈચ્છાઓની ઉંચાઇ વધવા લાગી. કઈક બનવાના ચક્કરમાં બેંકમાં ખાતું ખોલાવા ગયો તો મેનેજરે કીધુ ' બેંક જેને સારી રીતે જાણતી હોય એવી બે વ્યક્તિના નામ આપો'

'વિજય માલ્યા ને નીરવ મોદી.'

સાહેબે ફોર્મ ફાડી નાખ્યું, સિક્યોરિટીને બોલાવીને મને ધમકાવ્યો, મિત્રો આમાં હું ક્યાંય ખોટો હોઉં તો તમારે પણ મને ધમકાવવો,પીઠ પર ચાર પાંચ ધબ્બા મારવા, મારા કપડાં ફાડી લીરેલીરા કરી નાખો મારા અંગેઅંગના ટુકડા કરી ગીધડાઓને ખવડાવી દો. તો પણ હું સત્યને વળગી રહીશ, બોલો સત્યમેવ જયતે...

ઉપરની આખી ઘટના બાપુને કરી તો બાપુ બોલ્યા

'બેટા, આ ભારત છે. અહી નામ માટે નહી બદનામ થવા માટે પણ ધક્કામુક્કી થાય છે.'

'કબુલ ...બાપુ. પણ જે નામના ને પ્રતિષ્ઠા કમાવા કેટલા ધમપછાડા-કાવાદાવા કરી હું નામ કમાયો હોઉં ને પછી બધા મંડી પડે કે 'જગમેં સુંદર હૈ દો નામ ચાહે કૃષ્ણ કહો યા રામ' ત્યારે મારો આત્મા અંદરથી કકળી ઉઠે છે. અરે કોઈ ટપકી પડે ને વીડિયો ઓ કેમેરાની જેમ લાશને ઉંચકી 'રામ નામ સત્ય હૈ' બોલવાનું? આ મારું બેટુ કેવું કે જેને ક્યારે જોયો નથી, મળ્યા નથી એ રામનું નામ 'સત્ય' ને જે પરિવાર સાથે રહ્યો, લોકો માટે જીવ્યો એનું નામ અસત્ય?

'જુઓ બાપુ, કહી દઉં કે મારા મરણ વખતે રામની જગાએ 'સુભાષ નામ સત્ય હૈ' બોલાવજો.'

'જો બેટા, એક વાત સમજી લે' બાપુ બોલ્યા 'આ પ્રતિષ્ઠા ને નામનાનું ગુમડું જીવનના અંત સુધી નથી ફૂટતું કે નથી મટતું. અરે જે નામ આગળ સ્વર્ગસ્થ લખાઈ જવાનું છે એને તું તારું માની અડ્ડો જમાવી બેઠો છે એ ભ્રમમાંથી ક્યારે બહાર આવીશ?'

'વાહ બાપુ, તમે તો મારી આંખ કાયમ માટે મીચાઈ જાય એ પહેલાં ખોલી દીધી.'

શું કહો છો ? ■

હું ભારત પાછો આવીશઃ મેસી

જય શાહે વર્લ્ડકપ મૅચની ટિકિટ, ટીમ ઈન્ડિયાની ઑટોગ્રાફ સાથેનું બૅટ ભેટ આપ્યું

નવી દિલ્હીઃ આર્જેન્ટિનાના ફૂટબોલનો સુપરસ્ટાર લિયોનેલ મેસીની ભારતની યાત્રા નામોશીભરી રીતે ભલે શરૂ થઈ હોય, પરંતુ એનો અંત ગૌરવપ્રદ રહ્યો હતો. ફૂટબોલના આઈકોને તેના ચાહકોને વચન આપ્યું હતું કે હું પાછો આવીશ. મેસીએ આ પહેલાં સોમવારે ૩૦ મિનિટમાં ચાહકોને યાદગાર સંભારણાં આપ્યાં હતાં. તેણે સ્પેન ભાષામાં બોલતા કહ્યું હતું કે મારી યાત્રા ટૂંકી અને સઘન હતી, પરંતુ મને સતત ચાહના મળી હતી. હું જાણતો હતો કે એ પ્રેમ શાશ્વત છે. જોકે ચાહના સીધી મળતા મને સારો અનુભવ થયો હતો. ચાહકોએ આટલા દિવસોમાં જે કર્યું એ યાદગાર અનુભવ છે. હું આ પ્રેમ મારી સાથે લઈ જાઉ છું. હું ચોક્કસ પાછો આવીશ. મને આશા છે કે હું મૅચ રમવા કે બીજા કોઈ પ્રસંગમાં ચોક્કસ પાછો આવીશ. થેન્ક યુ વેરી મચ.આર્જેન્ટિનાનો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસી 'ગોટ ઈન્ડિયા ટૂર'ના ભાગરૂપે કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈની મુલાકાત લીધા પછી દિલ્હી પહોંચ્યો હતો. મેસીએ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મેસીને જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા. મેસી પોતે તેમના ચાહકોના પ્રેમથી અભિભૂત થઈ ગયો હતો. આર્જેન્ટીનાના સ્ટાર રોડ્રિગો ડી પોલ અને ઉરુગ્વેના દિગ્ગજ લુઈસ સુઆરેઝ પણ તેમની સાથે હાજર હતા. દરમિયાન આઈસીસી ચેરમેન જય શાહે મેસીને ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૬ની આમંત્રણ ટિકિટ ભેટમાં આપી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેસીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ભેટમાં આપવામાં આવી હતી. શાહે મેસીને ૨૦૨૪ ટી-૨૦ વર્લ્ડ કપ ટીમનું ઓટોગ્રાફવાળું બેટ પણ ભેટમાં આપ્યું હતું.અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ જય શાહ, દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ રોહન જેટલી સાથે મુલાકાત કરી હતી.

પ્રદૂષણ વિલનઃ મેસીની મોદી સાથે મુલાકાત ન થઈ શકી

નવી દિલ્હીઃ આર્જેન્ટિનાનો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસી હાલ ભારતના પ્રવાસ પર છે. કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ બાદ મેસી આજ દિલ્હી પહોંચ્યો છે. દિલ્હીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મેસીની મુલાકાત થવાની હતી, જેની ચાહકો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ મુલાકાત થઇ ન શકી. આ મુલાકાત રદ થવા પાછળનું કારણ દિલ્હીનું વાયુ પ્રદૂષણ રહ્યું.

દિલ્હીમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે, જેને કારણે મેસીની ફ્લાઇટ મોડી પડી. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ચાર દિવસની મુલાકાત માટે રવાના થઇ ગયા. અગાઉના શેડ્યુલ પ્રમાણે સોમવારે મેસી સોમવારે સવારે દિલ્હી પહોંચવાનો હતો, તે વડા પ્રધાનના નિવાસસ્થાને મોદી સાથે ૨૦ મિનિટની વાતચીત કરવાનો હતો. સોમવારે સવારે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે શેડ્યુલ ખોરવાઈ ગયું.

૮,૧૦૦ કરોડના ડાબા પગના વીમાને લીધે મેસી ભારતમાં મેચ ન રમ્યો

મુંબઈઃ વર્લ્ડ ચેમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી ભારતના ત્રણ દિવસના પ્રવાસ દરમ્યાન ઔપચારિકતા માટે કેટલીક ફૂટબોલ મેચો (ખાસ કરીને બાળકો સાથે) રમ્યો હતો, પરંતુ એક્ઝિબિશન મેચમાં રમવાનું તેણે ટાળ્યું હતું જેનું કારણ જાણવા જેવું છે.

મેસીએ શનિવારે ભારતમાં આગમન કર્યું હતું અને ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન તેની કોઈ આંતરરાષ્ટ્રીય કે ક્લબ સ્તરની મેચ ન રમાવાની હોવાથી જ તેણે આ સમયગાળામાં ભારતનો પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું.

જોકે મેસી ભારતમાં એકેય પ્રદર્શનીય મેચ ન રમ્યો એ પાછળ તેનો વીમો સૌથી કામ મોટું કારણ છે.

વિશ્વભરમાં સ્પોર્ટ્સને લગતી વીમા પોલિસીઓમાં મેસીની પૉલિસી સૌથી મોંઘી ગણાય છે. તેણે ડાબા પગનો ૮,૧૦૦ કરોડ રૂપિયા (૯૦૦ મિલ્યન ડોલર)નો વીમો ઊતરાવ્યો છે.

મેસીની વીમા પૉલિસીમાં તેને કરીઅર દરમ્યાન શારીરિક રીતે કોઈ પણ પ્રકારની હાનિ થાય તો એ સામે તેને વળતર મળે એવી જોગવાઈ છે. જોકે એમાં એક શરત એવી પણ છે કે આ પૉલિસીને લાગુ પડે ત્યાં સુધી તે આંતરરાષ્ટ્રીય મેચ કે ક્લબ સ્તરની મેચ સિવાય કોઈ પણ અન્ય મેચ ન રમી શકે. બીજી રીતે કહીએ તો તેની પોલિસીમાં એક્ઝિબિશન મેચનો સમાવેશ ન હોવાથી તે ભારતમાં એ મેચ રમ્યો નહોતો. ■

આજે આઈપીએલનું મિનિ ઑક્શન

ગ્રીન, વેંકટેશ, લિવિંગસ્ટોન પર નજર

૨૩૭.૫૫૫ આટલા કરોડની બોલી બોલાશે

૩૫૦ આટલા ક્રિકેટરો રિંગમાં છે

૭૭ આટલા ક્રિકેટરોની ખરીદી થશે

અબુ ધાબીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ (આઈપીએલ) માટે ખેલાડીઓની હરાજી આજે યોજાવાની છે. અબુ ધાબીમાં યોજાનારી આ હરાજી પર ખેલાડીઓ અને ચાહકો બંને ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે. આ હરાજીમાં ૩૫૦ ખેલાડીઓ હશે, જોકે વધુમાં વધુ ૭૭ ખેલાડીઓ ખરીદી શકાય છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન પર આ હરાજીમાં તમામની નજર રહેશે. કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માટે મોટી બોલી લગાવી શકે છે.

હરાજીમાં દસ ટીમો ૭૭ ખેલાડીઓ ખરીદશે અને બધી ટીમો પાસે કુલ ૨૩૭ કરોડ ૫૫૫ લાખ રૂપિયા છે. જોકે, મુંબઈ ઇન્ડિયન્સની હરાજીમાં બહુ મોટી ભૂમિકા રહેશે નહીં, કારણ કે તેમની પાસે ફક્ત બે કરોડ ૭૫ લાખ રૂપિયા ઉપલબ્ધ છે અને તેઓ કેટલાક અનકેપ્ડ ખેલાડીઓ (જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યા નથી) તેમના બેઝ પ્રાઈસ પર ખરીદી શકશે.

કેમરુન ગ્રીન, ભારતીય ક્રિકેટર વેંકટેશ ઐયર અને ઇંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન નોંધપાત્ર બોલી લાગી શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી વધુ ૬૪ કરોડ ૩૦ લાખ રૂપિયા ઉપલબ્ધ છે અને તેઓ તેમની ટીમને ફરીથી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટીમે ૧૩ ખેલાડીઓ ખરીદવા પડશે અને હરાજીમાં મુખ્ય પડકાર સુપર કિંગ્સ તરફથી આવવાની અપેક્ષા છે, જેની પાસે ૪૩ કરોડ ૪૦ લાખ રૂપિયાની રકમ ઉપલબ્ધ છે.

ફાસ્ટ-બોલિંગ ઓલરાઉન્ડરો પર હંમેશાં ઊંચી બોલી લાગી છે પરિણામે કેમરુન ગ્રીન, વેંકટેશ ઐયર અને વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડર બે કરોડ રૂપિયાની સૌથી વધુ બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓમાં સામેલ છે. આઈપીએલમાં ગ્રીને ૨૯ મેચોમાં ૭૦૪ રન કર્યા છે અને ૧૬ વિકેટ લીધી છે. તે નિયમિતપણે ઓસ્ટ્રેલિયા માટે તમામ ફોર્મેટમાં રમે છે, જેના કારણે તે હરાજીમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.

ટીમે આન્દ્રે રસેલને પણ રિલીઝ કર્યો છે, જે નાઈટ રાઈડર્સના નવા "પાવર કોચ" હશે. તેથી નાઈટ રાઈડર્સને બે સારા ટોપ-ઓર્ડર બેટ્સમેન અને એક ઓલરાઉન્ડરની જરૂર છે. તે આક્રમક બેટિંગ ઉપરાંત અસરકારક બોલિંગ કરવા સક્ષમ છે અને મર્યાદિત વિકલ્પો સાથે ટીમો તેના માટે ભારે બોલી લગાવી શકે છે.

કઈ ફ્રેન્ચાઈઝ પાસે કેટલા પૈસા?

ટીમ	કેટલા પૈસા (₹. કરોડમાં)	કુલ સ્લૉટ બાકી	વિદેશી સ્લૉટ
સીએસકે	૪૩.૪	૯	૪
ડીસી	૨૧.૮	૮	૫
જીટી	૧૨.૯	૫	૪
કેકેઆર	૬૪.૩	૧૩	૬
એલએસજી	૨૨.૯૫	૬	૪
એમઆઈ	૨.૭૫	૫	૧
પીબીકેએસ	૧૧.૫	૪	૨
આરસીબી	૧૬.૪	૮	૨
આરઆર	૧૬.૦૫	૯	૧
એસઆરએચ	૨૫.૦૫	૧૦	૨

મિનિ હરાજીમાં રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવાનો કોઈ વિકલ્પ નથી. તેથી જો નાઈટ રાઇડર્સ વેંકટેશને રિટેન રાખવા માગતા હોય તો તેમને કેટલાક સમજદાર નિર્ણયો લેવા પડશે. ઇંગ્લેન્ડના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર લિવિંગસ્ટોન અને દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક પણ નવ કરોડ રૂપિયાનો આંકડા સુધી પહોંચી શકે છે.

અનકેપ્ડ ભારતીય પ્રશાંત વીર અને મુકુલ ચૌધરી બોલી લગાવનારાઓને આકર્ષિત કરશે, જ્યારે પૃથ્વી શો અને સરફરાઝ ખાન પણ ૭૫ લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદદારો શોધવાની આશા રાખશે. મથિશા પથિરાનાને સુપર કિંગ્સે રિલીઝ કર્યો છે અને લખનઊ સુપર જાયન્ટ્સ (૨૨.૯૫ કરોડ) જેવી ટીમ આક્રમક બોલી લગાવી શકે છે, કારણ કે મોહમ્મદ શમી અને મયંક યાદવની હાજરી છતાં તેમની ઝડપી બોલિંગ આક્રમણ નબળો છે. ન્યૂ ઝીલેન્ડનો ફાસ્ટ બોલર જેકબ ડફી પણ આ યાદીમાં છે. અનકેપ્ડ ઈન્ડિયન્સમાં અશોક શર્માને પણ સારી બોલી લગાવવાની અપેક્ષા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ■

વર્લ્ડકપ ફાઈનલની નાયિકા શૈફાલી વર્મા પ્લૅયર ઑફ ધ મન્થ

દુબઈઃ ગયા મહિને યોજાયેલા મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ઓપનર શેફાલી વર્માને નવેમ્બર માટે આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) પ્લેયર ઑફ ધ મન્થનો અવૉર્ડ મળ્યો છે.

પ્રતિકા રાવલ ઈજાગ્રસ્ત થયા બાદ સેમિફાઇનલમાં વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરનાર શેફાલીએ દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં ૭૮ બોલમાં ૮૭ રન કર્યા હતા. મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં આ ભારતીય ઓપનર દ્વારા સૌથી વધુ સ્કોર છે. સાઉથ આફ્રિકાના સ્પિનર સાઈમન હાર્મરને ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બોલિંગ પ્રદર્શન માટે પુરુષ કેટેગરીમાં અવૉર્ડ મળ્યો હતો. ■

ફક્ત વિરાટ-રોહિત નહીં દરેક ખેલાડીએ વિજય હઝારે ટ્રોફીની બે મેચ તો રમવી જ પડશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ૨૪ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી વિજય હજારે ટ્રોફીની ઓછામાં ઓછી બે વન-ડે મેચમાં તમામ વર્તમાન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓએ રમવું ફરજિયાત કરી દીધું છે. જ્યારે અનુભવી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટૂર્નામેન્ટ માટે તેમની ઉપલબ્ધતાની જાણ કરી દીધી છે, ત્યારે શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા અન્ય સિનિયર સ્ટાર્સને પણ તેમની સંબંધિત ટીમો માટે ઓછામાં ઓછી બે મેચ રમવાનું કહેવામાં આવ્યું છે. ■

ત્રીજી એશિઝ ટેસ્ટ માટે ઈંગ્લિશ ટીમમાં જોશ ટંગનો સમાવેશ

એડીલેડઃ ઇંગ્લેન્ડે બુધવારથી શરૂ થઈ રહેલી ત્રીજી એશિઝ ટેસ્ટ માટે ગુસ એટકિન્સનના સ્થાન પર જોશ ટંગને ટીમમાં સામેલ કર્યો છે પરંતુ ધીમા બોલરોને અનુકૂળ પિચ હોવા છતાં નિષ્ણાત સ્પિનર શોએબ બશીરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. ટંગની વાપસી એ ઇંગ્લેન્ડની ટીમમાં એકમાત્ર ફેરફાર છે, જેને ગાબા ખાતે આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

પાંચ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ ૦-૨થી પાછળ છે અને શ્રેણીમાં ટકી રહેવા માટે એડીલેડમાં જીત મેળવવી આવશ્યક છે. ટીમમાં બશીરની પસંદગી કરી હોવા છતાં પસંદગીકારોએ સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર વિલ જેક્સને પસંદ કર્યો છે. ■

'મુંબઈ સમાચાર'ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ...

ગુજરાતી - અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A	B
ખીંટી	VALLEY
ખીજ	CROWDED
ખીણ	FERMENTED LIQUID
ખીરું	PEG
ખીચોખીચ	ANGER

માતૃભાષાની મહેક

કોઈ વ્યક્તિ કે વસ્તુ અલગ કયા કારણસર તરી આવે છે એ આપ બળે એકલ ખૂણે, ધૂપ બધે પ્રસરત, જગમાં એવા જનમિયા, અગરબત્તી ને સંત સુભાષિતમાં સુપેરે પ્રગટ થયું છે. અગરબત્તી અને સંત, એક નિર્જીવ અને એક સજીવ, પણ બંનેના કાર્ય, વૃત્તિ સરખા. એકલપંડે કોઈ ખૂણામાં રહે, પણ આસપાસના વિસ્તારને પોતાની સુવાસથી કે પછી જ્ઞાનથી મઘમઘતો કરી નાખે.

ગુજરાત મોરી મોરી રે

કોઈ વ્યક્તિ SCOLIONOPHOBIA અનુભવે છે એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?

અ) સાવજ બ) સમાજ
ક) શિક્ષણ ડ) સહવાસ

ઈર્શાદ

ભમે તે ભૂખે ન મરે, રમે તે રળી ન ખાય, ઊંઘેથી આયુષ્ય ન વધે, આળસથી દેવાદાર થાય.
-- લોક રચના

શબ્દલાલિત્ય

૧	૨		૩	૪	■	૫		૬	૭
૮		■	૯				■	૧૦	
	■	૧૧			■	■	૧૨		
૧૩			■	■	૧૪	૧૫	■	■	
	■		■	૧૬			૧૭	૧૮	■
■	૧૯		૨૦			■	૨૧		૨૨
૨૩	■	■	૨૪		■	■	૨૫		
૨૬	૨૭		■	■	૨૮	૨૯		■	
૩૦		■	૩૧				■	૩૨	
૩૩				■	૩૪				

આડી ચાવી

૧. આવતા કાળનું જાણનાર (૫)
૫. મોટા મનનું (૪)
૮. ક્રોધ, ગુસ્સો (૨)
૯. સાર, સત્ત્વ (૪)
૧૦. ઘરકી મુરઘી --- બરાબર (૨)
૧૧. બાંધેલો લોટ (૩)
૧૨. તૃપ્તી, સંતોષ (૩)
૧૩. પૃથ્વીનું બહુ ઊંડું તળ (૩)
૧૪. વાર્તા, કહાણી (૨)
૧૬. રાજા (૫)
૧૯. દુનિયામાં બધે જાણીતું (૫)
૨૧. આશ્ચર્ય, નવાઈ (૩)
૨૪. જ્ઞાતિ, જાત (૨)
૨૫. ભોંય (૩)
૨૬. ઓઢવાની એક પ્રકારની રૂની ગોદડી (૩)
૨૮. પાપી (૩)
૩૦. કેફ (૨)
૩૧. દશેરા પહેલાંની આસો માસની નવતિથિઓ (૪)
૩૨. ચરબી (૨)
૩૩. માખણ (૪)
૩૪. જરૂરિયાતમંદ (૫)

ઊભી ચાવી

૧. વિશ્વાસ લાયક (૫)
૨. ઝેર (૨)
૩. વેરભાવ રાખનારી (૩)
૪. રકાબી (૩)
૫. દુપટ્ટો, ખભે નાખવાનું વસ્ત્ર (૨)
૬. સ્વરૂપ, કાંતિ (૩)
૭. કપાળ, લલાટ (૪)
૧૧. અધર્મનો સમય (૪)
૧૪. પ્રેમ ન જુએ જાત --- (૩)
૧૫. કંકુવાળા પંજાની છાપ (૨)
૧૬. પ્રસિદ્ધ, જાણીતું (૩)
૧૭. સ્વાદ, રસ (૪)
૧૮. નસીબદાર (૩)
૨૦. વગર (૨)
૨૨. જીવજાન (૫)
૨૩. અભિલાષા, ઉમેદ (૪)
૨૭. જદુનો વંશજ (૩)
૨૮. ફૂલમાંની રજ (૩)
૨૯. એક પક્ષી (૩)
૩૧. નમેલું (૨)
૩૨. સેવા કરો તો --- મળે (૨)

ગયા વખતનો ઉકેલ

૧ દી	ર્ઘ	૨ કા	૩ લી	ન	■	૪ અ	પ	૫ શ	બ્દ
પ	■	૬ વે	લ	■	૭ જ્યો	ત	■	તા	■
■	૮ ચ	રી	■	૯ વ	ત્સ	લ	■	૧૦ યુ	ગ
૧૧ જ	લ	■	■	૧૨ મ	ના	■	૧૩ સુ	■	■
હા	■	૧૪ ત	■	ળ	■	૧૫ ક	ભે	વ	૧૬ ર
૧૭ જ	જ	મા	ન	■	૧૮ ના	■	હ	■	કા
■	■	મ	■	૧૯ અ	મ	■	■	૨૦ વા	સ
૨૧ ખ્વા	૨૨ બ	■	૨૩ સા	ધ	ના	■	૨૪ સુ	દ	■
■	બ	■	૨૫ હ	ર	■	૨૬ ત	પ	■	૨૭ જ
૨૮ બ	લી	ય	સી	■	૨૯ અ	વ	ર્ણ	ની	ય

ઓળખાણ પડી?

Ironwood તરીકે પણ ઓળખાતું વિચિત્ર આકારનું Tembusu Tree તરીકે વધુ જાણીતું આ વૃક્ષ મુખ્યત્વે કયા દેશમાં જોવા મળે છે?

અ) જાપાન બ) મલેશિયા ક) સિંગાપોર ડ) અફઘાનિસ્તાન

ચતુર આપો જવાબ — અર્થ જણાવો

'વહેમનું ઓસડ કોઈ નથી' પંક્તિમાં 'ઓસડ' શબ્દનો અર્થ જણાવો.

અ) આવાસ બ) ઈલાજ ક) ભય ડ) શંકા

માઈન્ડ ગેમ

વિવિધ પ્રકારના ફળ દેશ-વિદેશમાં જોવા મળે છે. વિશ્વમાં કયું ફળ સૌથી વધારે વજનવાળા ફળની ખ્યાતિ ધરાવે છે એ જણાવો.

અ) Eggplant બ) Gourd ક) Strawberry ડ) Pumpkin

સુડોકુ-૯૧૬૯

	૪		૩			૧	૫	
		૬	૨	૫				૭
			૪		૯			
૩	૨							
	૫						૨	
							૭	૪
			૮		૧			
૭				૯	૩	૫		
	૧	૯			૫		૪	

અહીં એક ચોરસ આપ્યું છે જેમાં નવ બોક્સ છે અને દરેકમાં નવ ખાનાં છે.૧) દરેક બોક્સમાં એકથી નવ સુધીનો આંક આવવો જોઈએ. ૨) દરેક આડી અને ઊભી હરોળમાં આંક આવવો જોઈએ. અહીં પણ કોઈ આંક

સુડોકુ-૯૧૬૮

૮	૧	૫	૭	૨	૪	૬	૩	૯
૬	૨	૭	૩	૯	૫	૮	૧	૪
૪	૯	૩	૮	૧	૬	૨	૭	૫
૫	૭	૮	૧	૩	૨	૪	૯	૬
૧	૪	૯	૫	૬	૭	૩	૮	૨
૨	૩	૬	૪	૮	૯	૭	૫	૧
૩	૫	૧	૨	૪	૮	૯	૬	૭
૭	૬	૨	૯	૫	૩	૧	૪	૮
૯	૮	૪	૬	૭	૧	૫	૨	૩

ગયા મંગળવારના જવાબ

A	B
ખોખરું	HOARSE
ખોગીર	SADDLE
ખોજ	SEARCH
ખોટ	DEFICIT
ખોડ	DEFECT

ગુજરાત મોરી મોરી રેઃ
નંબર
ઓળખાણ પડી?
ઈકેબાના
માઈન્ડ ગેમ :
Fern
ચતુર આપો જવાબ માથું ખંજવાળો :
અસાવધ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મુલરાજ કપૂર (૪) સુભાષ મોમાયા (૫) શ્રીમતી ભારતી પ્રકાશ કટકિયા (૬) હર્ષા મહેતા (૭) શ્રદ્ધા આશર (૮) પુષ્પા પટેલ (૯) લજિતા ખોના (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) મીનલ કાપડિયા (૧૨) કિરીટ છેડા (૧૩) ચેતના છેડા (૧૪) નયના ગિરીશ મિસ્ત્રી (૧૫) જયશ્રી બુચ (૧૬) નિખિલ બંગાળી (૧૭) અમીશી બંગાળી (૧૮) તાહેર ઔરંગાબાદવાલા (૧૯) શીરીન ઔરંગાબાદવાલા (૨૦) અબ્દુલ્લા એફ. મુનીમ (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) ભરત કજરિયા (૨૪) જયવંત પદમશી ચિખલ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) અરવિંદ કામદાર (૨૭) ભાવના કર્વે (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) વિણા સંપટ (૩૦) પુષ્પા ખોના (૩૧) ડાયના સંતોકે (૩૨) રશીક જુથાણી - ટોરંટો - કેનેડા (૩૩) મહેશ સંઘવી (૩૪) કમલ માતલિયા (૩૫) નિતિન જયંતિલાલ બજરિયા (૩૬) પ્રવીણ વોરા (૩૭) ડો. પ્રકાશ કટકિયા (૩૮) પ્રતિમા પમાણી (૩૯) ધીરેન્દ્ર મુલરાજ (૪૦) ગીતા ઉદેશી (૪૧) મહેશ દોશી (૪૨) અલકા વાણી

હમ સાથ સાથ હૈં

પાલિકા ચૂંટણી વિશે ફડણવીસની સ્પષ્ટતા

શિવસેના પહેલી પસંદગી, અજિત પવાર સાથે મૈત્રીપૂર્ણ હરીફાઈ

પુણેઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે ભાજપ અને શિવસેના મોટાભાગના સ્થળોએ આગામી નગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે અને એનસીપી સહિત મહાયુતિના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની વ્યવસ્થા પર મહોર મારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પુણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી વચ્ચે મૈત્રીપૂર્ણ મુકાબલો થશે. રાજ્ય ચૂંટણી પંચે ૨૯ નગરપાલિકાઓની ચૂંટણી માટે સમયપત્રક જાહેર કર્યા બાદ ફડણવીસે કહ્યું હતું કે પ્રશાસકોનું લાંબું શાસન લોકશાહી સિદ્ધાંતોની વિરુદ્ધ છે.' મુંબઈ સહિત ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ યોજાશે અને ૧૬ જાન્યુઆરીએ

(જુઓ પાનું ૪)

રાજ્યના મહાનગરોમાં ૧૫ લાખ ડુપ્લિકેટ મતદારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ચૂંટણી પંચે સોમવારે રાજ્યની કુલ ૨૯ નગરપાલિકાઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો, જે મુજબ ૨૮૬૯ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ૨૮૬૯ બેઠકોમાંથી ૧,૪૪૨ બેઠકો મહિલાઓ માટે અનામત છે, જ્યારે ૩૪૧ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે, ૭૭ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જ્યારે ૭૫૯ બેઠકો ઓબીસી માટે અનામત છે.

વાઘમારેએ માહિતી આપી હતી કે આ શહેરી કેન્દ્રોમાં લગભગ ૧૫ લાખ શંકાસ્પદ ડુપ્લિકેટ મતદારો હતા, જેમાંથી ૧૧.૫ લાખ એકલા મુંબઈમાં છે.જોકે, ક્ષેત્ર નિરીક્ષણ અને સોફ્ટવેર

(જુઓ પાનું ૪)

સ્માર્ટ એટીએમ ચોરોએ તો પોલીસ અને નિષ્ણાતોને પણ ગોટે ચડાવ્યા

એટીએમ મશીનના પાવર સોકેટમાં પોતાનું એડોપ્ટર નાખી રોકડ મશીનમાં અટકાવી દેતા ને કસ્ટમરના ગયા પછી કેશ-બૉક્સનું કવર તારથી કાઢીને રૂપિયા લઈ લેતા

યોગેશ સી પટેલ

મુંબઈઃ મુંબઈના માહિમ વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીયકૃત બૅન્કના એટીએમ સેન્ટરમાં સ્માર્ટ ચોરોએ ગજબનું કરતબ કર્યું કે પોલીસ અને નિષ્ણાતો પણ ગોટે ચડી ગયા હતા. કેશ ડિપોઝિટ મશીનના પાવર સોકેટમાં પોતાનું એડોપ્ટર નાખીને ચોરો એવું કંઈક કરતા હતા કે મશીનમાં ભરવામાં આવતી રોકડ અટકી જતી અને કસ્ટમરના ગયા પછી ચોરો તારનો ઉપયોગ કરી કેશ બૉક્સનું કવર કાઢીને રોકડ લઈ લેતા હતા. આશ્ચર્યની વાત એટલે પોલીસ અને મશીનના નિષ્ણાતો પણ ચોરોની તરકીબ જાણી શક્યા નથી.

પોલીસ ફરિયાદ અનુસાર ૮ ડિસેમ્બરે બે ખાતાધારક કેશ ડિપોઝિટ મશીનમાં ભરેલી રકમ તેમના ખાતામાં જમા થઈ ન હોવાની ફરિયાદ કરવા રાષ્ટ્રીયકૃત બૅન્કની માહિમ શાખામાં ગયા પછી ચોરોની ચાલાકીનો ખુલાસો થયો હતો. એક ખાતાધારક શનિવારની સાંજે મશીનમાં ૬૦,૫૦૦ રૂપિયા ભરવા ગયો, જ્યારે બીજો રવિવારની વહેલી સવારે ૪૫ હજાર રૂપિયા ભરવા ગયો હતો. બન્નેની રોકડ

(જુઓ પાનું ૪)

થાણેમાં પાણીના ધાંધિયા

ત્રીજી વખત ૫૦ ટકા પાણીકાપ લંબાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણેઃ એક તરફ થાણે મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે થાણેના રહેવાસીઓની પાણીની સમસ્યા પૂરી થવાનું નામ નથી લઈ રહી. છઠ્ઠી ડિસેમ્બરથી (જુઓ પાનું ૪)

કૅગના અહેવાલમાં સરકારનાં કામકાજની ઝાટકણી

સહાય મેળવવા માટેના સર્ટિફિકેટ રજૂ કરવામાં મહારાષ્ટ્ર સરકારના કેટલાક વિભાગની લાપરવાહીઃ કૅગ

નાગપુરઃ મહારાષ્ટ્ર સરકારના કેટલાક વિભાગો હજારો કરોડની સરકારી સહાય (ગ્રાન્ટ-ઇન-એઇડ) મેળવવા માટે જરૂરી યુટીલાઈઝેશન સર્ટિફિકેટ (યુસી) રજૂ કરવામાં નિષ્ફળ ગયા હોવાની સ્પષ્ટતા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કૅગ) દ્વારા કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ માર્ચ મહિનામાં વિભાગો દ્વારા મોટાભાગનો ખર્ચ કરવા માટે દોડાદોડી જોવા મળી હતી એમ પણ કૅગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાઉસિંગ ડિપાર્ટમેન્ટનો ઉલ્લેખ આ બંને બાબતો પર મુખ્યત્વે જોવા મળ્યો છે.

રવિવારે રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે રજૂ કરાયેલા કૅગના અહેવાલમાં જણાવાયું છે કે બોમ્બે ફાઇનાન્સિયલ રૂલ્સ, ૧૯૫૯ હેઠળ યુસી રજૂ ન થાય તો ફાઇનાન્સ એકાઉન્ટ્સમાં પ્રતિબિંબિત રકમ ઇચ્છિત લાભાર્થીઓ સુધી ન પહોંચે એવું જોખમ છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં ૫૨ હજાર ૮૭૬ કેસને લગતા રૂ. ૧,૭૭,૩૧૯.૮૪ કરોડના સર્ટિફિકેટ નહોતા મળ્યા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૪-૨૫ દરમિયાન, સરકારે લગભગ ૪૦ હજાર ૪૭ કેસમાં ૧,૩૭,૨૨૨.૨૫ કરોડ રૂપિયાના યુસીને મંજૂરી આપી હતી.

શહેરી વિકાસ વિભાગ ૧૧ હજાર ૪૦ કરોડ રૂપિયા, યોજના વિભાગ ૫ હજાર ૮૦૫ કરોડ રૂપિયા, જળ સંસાધન વિભાગ ૩ હજાર ૬૦૨ કરોડ રૂપિયા, હાઉસિંગ ડેવલપમેન્ટ વિભાગ ૨ હજાર ૮૩૯ કરોડ રૂપિયા અને સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગ (૨ હજાર ૬૪૦ કરોડ રૂપિયા) ના સર્ટિફિકેટ મળવાના બાકી છે.

ઓડિટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કેવળ માર્ચમાં ૧૮ વિભાગોએ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે, જે તેમના કુલ વાર્ષિક ખર્ચના ૨૫ ટકાથી વધુ છે. કૅગે જણાવ્યું હતું કે આવાસ વિભાગે માર્ચમાં કુલ ખર્ચના ૯૦ ટકા સાથે વર્ષના અંતમાં સૌથી તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો, ત્યારબાદ પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ (૭૭ ટકા), આયોજન વિભાગ (૬૫ ટકા), લઘુમતી વિકાસ વિભાગ (૫૩ ટકા) અને પર્યટન અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ (૫૦ ટકા) આવે છે. (પીટીઆઈ)■

યુતિ સરકારની મોટી લહાણી

મહાલક્ષ્મી રેસકોર્સ પર ભવ્ય સેન્ટ્રલ પાર્ક બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ કરે અને આચારસંહિતા તાત્કાલિક લાગુ પડી તે પહેલા મુંબઈ મહાનગરપાલિકા પર કબજો કરવા આતુર મહારાષ્ટ્ર સરકારે સોમવારે મુંબઈમાં મહાલક્ષ્મીમાં ભવ્ય સેન્ટ્રલ પાર્ક ઊભો કરવાને લગતી જાહેરાત કરી હતી. એટલું જ નહીં પણ મુંબઈગરાને પોતાની તરફ વાળવાના પ્રયાસરૂપે મુંબઈ સેન્ટ્રલ પાર્કથી લઈને મે, ૨૦૨૬ સુધીમાં રસ્તાનું કોંક્રીટીકરણ પૂર્ણ કરવાનું અને છ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી

(જુઓ પાનું ૪)

મુખ્ય પ્રધાનના પીએ અને ડીસીપીના પતિના સ્વાંગમાં ૭૪ લાખની છેતરપિંડી

મુંબઈઃ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) અને ડીસીપીના પતિના સ્વાંગમાં ઠગે સાંતાક્રુઝના ગુજરાતી પાસેથી ૭૪ લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

સાંતાક્રુઝ પોલીસના જણાવ્યા મુજબ અલ્પેશ રતિલાલ પટેલની ફરિયાદને આધારે આરોપી વૈભવ પરેશ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર આ વર્ષના ફેબ્રુઆરીમાં પટેલ ઠક્કરના સંપર્કમાં આવ્યો હતો. ઠક્કરે દાવો કર્યો હતો કે તે મુખ્ય પ્રધાનનો પીએ છે અને તેની પત્ની મુંબઈમાં ડેપ્યુટી પોલીસ કમિશનર પદે છે. પટેલ વિરુદ્ધ નોંધાયેલા ચાર કેસમાં મદદરૂપ થવાની ખાતરી ઠક્કરે આપી હતી. આ કામ માટે તેણે પટેલ પાસેથી ૭૪ લાખ રૂપિયા લીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઠક્કર લક્ઝુરિયસ એસયુવીમાં બૉડીગાર્ડ્સ સાથે ફરતો હોવાથી પટેલને તેના પર કોઈ શંકા ગઈ નહોતી. જોકે બાદમાં તેની વિરુદ્ધના એકેય કેસમાં કોઈ પ્રગતિ ન જણાતાં પટેલે ઠક્કરની પૂછપરછ કરી હતી. ઉડાઉ જવાબ આપનારા ઠક્કરે વધુ ૭૬ લાખ રૂપિયાની માગણી

(જુઓ પાનું ૪)

પાર્થ પવારની કંપનીના ભાગીદાર દિગ્વિજય પાટીલની પોલીસે પૂછપરછ કરી

પુણેઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે જોડાયેલી કંપનીનો ભાગીદાર દિગ્વિજય પાટીલ પુણેમાં વિવાદાસ્પદ જમીન સોદાના કેસમાં સોમવારે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પુણે શહેર પોલીસે પાટીલ, તેજવાની અને તહેસીલદાર સૂર્યકાંત યેવલા વિરુદ્ધ જમીન સોદા સંદર્ભે બીજો કેસ નોંધ્યો છે અને તેની તપાસ આર્થિક ગુના શાખા કરી રહી છે. બાવધન પોલીસે પૂછપરછ માટે પાટીલને સમન્સ પાઠવ્યા હતા. આથી પાટીલ સોમવારે બાવધન પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને પોલીસે તેની પૂછપરછ કરી હતી. પિંપરી ચિંચવડના ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-૨) વિશાલ ગાયકવાડે કહ્યું હતું કે પાટીલની સોમવારે પૂછપરછ કરીને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

પુણે પોલીસની આર્થિક ગુના શાખાએ ૩ ડિસેમ્બરે શીતલ તેજવાનીની ધરપકડ કરી હતી, જેની પાસે જમીનની પાવર ઑફ એટર્ની હતી. બાવધન પોલીસે ગયા સપ્તાહે રવીન્દ્ર તરુની ધરપકડ કરી હતી. ■

થાણેવાસીઓને શિંદેની મોટી ભેટ

ભારતનો સૌથી ઊંચો વ્યૂઈંગ ટાવર અને ઍમ્યુઝમેન્ટ પાર્ક

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ થાણે મહાનગરપાલિકા પર ફરી કબજો કરવા આતુર શિંદે-શિવસેનાની સરકારે થાણેવાસીઓ માટે સોમવારે જુદી જુદી લોભામણી જાહેરાત કરી હતી, જેમાં થાણે ખાડી કિનારે ૫૦ એકરમાં ભારતનો સૌથી ઊંચો ટાવર ઊભો કરવામાં આવવાનો છે. આ ટાવર ૨૬૦ મીટરના ઊંચો હશે. એ સિવાય ૨૫ એકરમાં ટાઉન પાર્ક, મત્સ્યાલય, સાયન્સ સેન્ટર, એમ્યુઝમેન્ટ પાર્ક, એડવન્ચર પાર્ક, બર્ડ પાર્ક સહિત મ્યુઝિકલ કોન્સર્ટ સેન્ટર વગેરે જુદા જુદા પ્રોજેક્ટની પણ જાહેરાત

(જુઓ પાનું ૪)

આચારસંહિતા પહેલા ૧૦ હજાર કરોડના ટેન્ડર

અઠવાડિયાની અંદર નાનાં મોટાં ૫૦૦ ટેન્ડર બહાર પાડ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મુંબઈમાં હાલ અનેક મહત્ત્વના અને કરોડો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. આ પ્રોજેક્ટનું કામ અટવાઈ ના જાય તે માટે આચારસંહિતા અમલમાં આવે તે પહેલા જ મુંબઈ મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ માટેના કરોડો રૂપિયાના ટેન્ડર અને વર્ક ઓર્ડર બહાર પાડી દીધા હતા. તેથી હવે આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ પણ આ પ્રોજેક્ટના કામ અટકશે નહીં. આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના થવાની છે. તે માટે સોમવારે સાંજના ચાર વાગે આચાર સંહિતા અમલમાં અમલમાં આવી ગઈ હતી. તે પહેલા જ જોકે પાલિકા પ્રશાસન દ્વારા પોતાના મહત્ત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટના ટેન્ડર અને વર્ક ઓર્ડર બહાર પાડી દેવામાં આવ્યા હતા. તેથી આ પ્રોજેક્ટના કામમાં કોઈ અડચણ આવશે નહીં અને પ્રોજેક્ટનું કામ

(જુઓ પાનું ૪)

ચૂંટણીની જાહેરાત પહેલાં ઉદ્ધવને ઝટકો શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ નગરસેવક તેજસ્વી ઘોસાળકર ભાજપમાં

મુંબઈઃ શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ નગરસેવક તેજસ્વી ઘોસાળકર મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ચૂંટણી પહેલા સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ઉત્તર મુંબઈના દહિસર વિધાનસભા મત વિસ્તારમાં શિવસેના (યુબીટી) મહિલા પાંખના પ્રમુખ તરીકે ફરજ બજાવનારાં તેજસ્વી ઘોસાળકર માજી વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરનાં પુત્રવધૂ છે.

તેજસ્વીના પતિ અભિષેક ઘોસાળકરની ૨૦૨૪ના પ્રારંભમાં સ્થાનિક રહેવાસી મોરિસ નોરોન્હા દ્વારા ફેસબુક લાઇવ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અભિષેક બીએમસીના માજી નગરસેવક પણ હતા. તેજસ્વી સોમવારે ભાજપના મુંબઈ પ્રમુખ અમિત સાટમ અને પક્ષના વિધાન પરિષદના સભ્ય પ્રવિણ દરેકરની હાજરીમાં જોડાયાં હતાં.

સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં તેજસ્વી ઘોસાળકરે જણાવ્યું

(જુઓ પાનું ૪)

આ ફક્ત લાપરવાહીઃ ઉદ્ધવ સેનાનો આકરો પત્ર

મુંબઈઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની સોમવારે જાહેરાત કરવામાં આવી. ચૂંટણી પંચે કહ્યું છે કે રાજ્યની ૨૯ નગરપાલિકાઓની ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ જાહેરાત કરી હતી કે મતદાન ૧૫ જાન્યુઆરીએ અને મતગણતરી ૧૬ જાન્યુઆરીએ થશે. દરમિયાન, અંતિમ મતદાર યાદી પ્રકાશિત થાય તે પહેલાં જ, ઉદ્ધવ સેનાએ મ્યુનિસિપલ ચૂંટણીઓની જાહેરાત અંગે રાજ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો હતો.

ઉદ્ધવ સેનાના સાંસદ અનિલ દેસાઈએ રાજ્ય ચૂંટણી કમિશનરને લખેલા પત્રમાં કહ્યું હતું કે, ''એક તરફ, મતદાર યાદી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, બીજી તરફ, રાજ્ય ચૂંટણી પંચે સોમવારે ચૂંટણીઓની જાહેરાત કરી. આ માત્ર વહીવટી બેજવાબદારી નથી, પરંતુ મતદારોના અધિકારોનું ઉલ્લંઘન અને લોકશાહી પ્રક્રિયાની મજાક પણ છે.''

''રાજ્ય ચૂંટણી પંચે મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે સોમવારે અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવાનું વચન આપ્યું હતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ અખબારોમાં જાહેરાતો આપીને આવો જ દાવો કર્યો હતો. જો કે, આ અંતિમ મતદાર યાદી ન તો કમિશનની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, ન તો મ્યુનિસિપલ કોર્પોરેશનની હેડ ઓફિસમાં તેની છાપેલી નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સંદર્ભમાં, કમિશનને અમારો સીધો પ્રશ્ન એ છે કે જ્યારે વહીવટી તૈયારીઓ પૂર્ણ ન હતી ત્યારે ચૂંટણીઓની જાહેરાત કરવાની આટલી ઉતાવળ કેમ કરવામાં આવી? આવી અપૂરતી અને ખામીયુક્ત તૈયારીઓ સાથે ચૂંટણીની જાહેરાત કરવી કાયદેસર અને નૈતિક રીતે ખોટી છે. આનાથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે,'' પત્રમાં કહેવામાં આવ્યું હતું. ■

રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

૧૦ કિલો મેફેડ્રોન, કેમિકલ્સ સહિત ૧૦૦ કરોડ રૂપિયાની મતા જપ્ત

થાણેઃ મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) રાજસ્થાનના ઝુનઝુન ખાતે ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને ૧૦ કિલો મેફેડ્રોન ડ્રગ્સ, ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો તથા કેમિકલ્સ સહિત ૧૦૦ કરોડ રૂપિયાની મતા જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એએનસીના અધિકારીઓએ રવિવારે અનિલ વિજયપાલ સિહાગની ધરપકડ કરી હતી. એએનસીની ટીમે ૪ ઑક્ટોબરે પેટ્રોલિંગ દરમિયાન શંકાને આધારે છ જણને તાબામાં લીધા હતા, જેમની પાસેથી એક કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ, ૧.૮૬ લાખની કિંમતના આઠ મોબાઇલ તેમ જ ચાર મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન એએનસીની ટીમે બીજા ચાર આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી એક મોટરસાઇકલ, બે કાર અને છ મોબાઇલ જપ્ત કરવામાં આવ્યાં હતાં. પૂછપરછમાં ફરાર આરોપી વિશે માહિતી મળ્યા બાદ પોલીસની ટીમને રાજસ્થાન રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમે રાજસ્થાનમાં તપાસ કર્યા બાદ રવિવારે ઝુનઝુન ખાતે ડ્રગ્સની ફેક્ટરીમાં રેડ પાડી હતી. ■

મુંબઈની ઈમારતો પાઘડી મુક્ત કરવાની સરકારી યોજના અંગે આદિત્ય ઠાકરેની તીવ્ર ટીકા

મુંબઈઃ શહેરની જૂની બિલ્ડિંગોને પાઘડી સિસ્ટમ માટે નિયમનકારી માળખું લાવવા પાછળનો મહારાષ્ટ્ર સરકારનો અસલી હેતુ એ ઘરના કબજેદારોને મુંબઈમાંથી હાંકી કાઢવાનો અને મકાનમાલિકો અને બિલ્ડરોને લાભ આપવાનો છે એવો આરોપ શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ સોમવારે કર્યો હતો. આ ઇમારતો અથવા ફ્લેટમાં રહેતા તમામ ભાડુતોને કાયદેસર પ્રોપર્ટી ધારક જાહેર કરી તેમનું રક્ષણ કરવામાં આવે એવી માગણી તેમણે કરી હતી.

ગયા અઠવાડિયે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈમાં પાઘડી સિસ્ટમ હેઠળ સંચાલિત ઇમારતોના પુનર્વિકાસ માટે નવા નિયમનકારી માળખાની જાહેરાત કરી આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો.

આ સંદર્ભે આદિત્ય ઠાકરેએ આરોપ કર્યો હતો કે 'એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં ઇમારતો જર્જરિત હાલતમાં છે અને એમાં રહેતા લોકોને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે. આવાસ પ્રધાન દ્વારા આ જાહેરાત જમીન માલિકો અને બિલ્ડરો માટે કરવામાં આવી હતી. પાઘડીના ઘરોમાં રહેતા લાખો

(જુઓ પાનું ૪)

કાલબાદેવીના ઝવેરી સાથે ૧.૭૮ કરોડની ઠગાઈ

સિકંદરાબાદના વેપારીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં ગોલ્ડ અને ડાયમંડના દાગીનાનો વ્યવસાય ધરાવતા ઝવેરી સાથે ૧.૭૮ કરોડ રૂપિયાની કથિત ઠગાઈ કરવાના કેસમાં પોલીસે સિકંદરાબાદના વેપારીની ધરપકડ કરી હતી.

એલ. ટી. માર્ગ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ શિવ સિંહ ઘનશ્યામ સિંહ ટાંક (૪૯) તરીકે થઈ હતી. ગુનો નોંધાયો ત્યારથી પોલીસ તેની શોધ ચલાવી રહી હતી.

(જુઓ પાનું ૪)

કાર્યવાહી કરવા ગયેલી પોલીસની પીટાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ કાંદિવલીમાં દંગલ મચાવનારાં બે જૂથ પર કાર્યવાહી કરવા ગયેલા પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કરી તેમની મારપીટ કરાઈ હતી. આ પ્રકરણે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. કાંદિવલી પશ્ચિમમાં લાલજી પાડા ખાતે રવિવારની રાતે ૮.૪૫ વાગ્યાની આસપાસ બનેલી ઘટના પ્રકરણે કાંદિવલી પોલીસે પપ્પુ ઝા, ચંદ્રકાંત ઝા, સુમન ઝા, ગુડ્ડુ ઝા અને વિકી સિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસની મારપીટ કરનારા આરોપીઓનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ■

ઉદ્ધવનો પક્ષ ઘમંડી છે, મુંબઈ પાલિકાની ચૂંટણીમાં એનાં સૂપડાં સાફ થશેઃ શિરસાટ

છત્રપતિ સંભાજી નગરઃ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) આગામી મુંબઈ નગરપાલિકા ચૂંટણીમાં હારી જશે કારણ કે પાર્ટીમાં કોઈ કાર્યકર બચ્યા નથી અને જનતા સાથે તેઓ સંપર્કમાં પણ નથી એમ મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટએ સોમવારે જણાવ્યું હતું.

સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં એકનાથ શિંદેની શિવસેનાના સભ્ય શિરસાટએ પણ સ્વીકાર્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક મહાયુતીમાં ઉમેદવારીની માંગ વધારે છે અને અસંતુષ્ટ નેતાઓ પાટલી બદલે એવી સંભાવના છે.

ઉદ્ધવ ઠાકરે દરેક સાથે ઉદ્ધતાઈથી વર્તે છે. શિવસેના (યુબીટી) બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હારી જશે. તેમની પાસે કોઈ કાર્યકર બચ્યા નથી, તેઓ લોકોના સંપર્કમાં નથી અને પક્ષના કાર્યકરોને ટેકો નથી આપતા. ચૂંટાયેલા લગભગ ૫૫-૫૭ નગરસેવકો (અગાઉની ચૂંટણીઓમાં) અમારી સાથે છે. એટલે તેમણે

(જુઓ પાનું ૪)

ફરિયાદોની 'ફુરસદથી' તપાસ કરવા બદલ હાઈ કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી, કેન્દ્રને પણ સવાલો

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે કાયદાની જોગવાઈઓ પ્રત્યે ''સંપૂર્ણ અવગણના'' અને ''ફુરસદી'' પૂછપરછ બદલ પોલીસની ઝાટકણી કાઢી છે અને આ સંદર્ભમાં કેન્દ્ર સરકારને પણ પ્રશ્ન પૂછ્યા છે.

ગયા અઠવાડિયે જસ્ટિસ અજય ગડકરી અને રણજીતસિંહ ભોંસલેની બેન્ચે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે કાયદામાં ફરિયાદોની પ્રાથમિક તપાસ ૧૪ દિવસની અંદર ફરજિયાત પૂર્ણ કરવાની હોવા છતાં, પોલીસ મહિનાઓ સુધી તપાસ કરે છે.

કોર્ટ કુંદન પાટીલ દ્વારા તેમના વકીલ ઉદય વરુણજીકર દ્વારા ઓક્ટોબરમાં મુંબઈ નજીક મીરા રોડ સ્થિત કાશીમીરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદ પર પોલીસને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપવાની અરજી પર સુનાવણી કરી રહી હતી. કાશીમીરા પોલીસે તેના સોગંદનામામાં કોર્ટને જાણ કરી હતી કે તપાસ હજુ પણ ચાલુ છે.

બેન્ચે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ ૧૭૩(૩)(શ) નો ઉલ્લેખ કર્યો, જે પોલીસને ૧૪ દિવસની અંદર પ્રાથમિક તપાસ પૂર્ણ કરવાની સત્તા આપે છે જેથી ખાતરી કરી શકાય કે આ કેસમાં આગળ વધવા માટે પ્રથમ દૃષ્ટિએ કોઈ કેસ છે કે નહીં. પરંતુ પોલીસ પ્રારંભિક તપાસના નામે મહિનાઓ સુધી આવી તપાસ કરે છે.

બેન્ચે કહ્યું કે પોલીસ કાયદાને ''સંપૂર્ણપણે અવગણી'' રહી છે. ''અમને નિયમિતપણે એવા કેસ જોવા મળે છે જેમાં પોલીસ પોતાની ફુરસદે અને મનસ્વી રીતે આરામથી પ્રારંભિક પૂછપરછ કરી રહ્યા છે.'' કાં તો પોલીસને જાણ નથી કે ભારત સરકારે જુલાઈ ૨૦૨૪માં બીએનએસએસ લાગુ કર્યો છે અથવા તેઓ જાણી જોઈને કાયદાની ફરજિયાત જોગવાઈઓનું પાલન કરી રહ્યા નથી, જેના કારણે તેમને ખબર, એમ બેન્ચે અવલોકન કર્યું. કોર્ટે આદેશ આપતા કહ્યું કે,''અમે ભારત સરકારના ગૃહ વિભાગનો અભિપ્રાય મેળવવાનું યોગ્ય માનીએ છીએ કે શું બીએનએસએસની જોગવાઈઓ બધા પોલીસ સ્ટેશનોને લાગુ પડે છે અને જો એમ હોય તો, તેનું કડક અને નિષ્ઠાપૂર્વક પાલન કેમ કરવામાં આવ્યું નથી.'' બેન્ચે આ મામલાની વધુ સુનાવણી ૧૯ ડિસેમ્બરે મુલતવી રાખી, વધારાના સોલિસિટર જનરલને કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ■

લાતુરના દેવાદાર રહેવાસીએ વીમાના એક કરોડ મેળવવા માટે દારૂડિયાની હત્યા કરી

લાતુરઃ લાતુરના દેવાદાર રહેવાસીએ વીમાના એક કરોડ રૂપિયા મેળવવા માટે પોતે મૃત્યુ પામ્યો હોવાનું બતાવવા માટે દારૂડિયાની હત્યા કરીને કારમાં તેનો મૃતદેહ સળગાવી દીધો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચે શંકાને આધારે તપાસ કરતાં આરોપી જીવતો હોવાનું જાણવા મળ્યું હતું અને તેને સિંધુદુર્ગ જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીના માથે ૫૭ લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું, જેને પગલે તેણે આ યોજના બનાવી હતી, એમ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અમોલ તાંબેએ જણાવ્યું હતું. ઔસા તહેસીલના વનવાડા પાટી-વનવાડા રોડ પર સળગતી કાર અંગે શનિવારે પોલીસને માહિતી મળતાં અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાં એક વ્યક્તિનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પગલે એડીઆર દાખલ કરાયો હતો.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર ઔસા તાંડાના બલિરામ ગંગાધર રાઠોડની છે અને તે કાર તેનો સાળો ગણેશ ગોપીનાથ ચવાણ વાપરી રહ્યો હતો. ચવાણની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે ચવાણ મિત્રને લેપટૉપ આપવા માટે ૧૩ ડિસેમ્બરે રાતના ૧૦ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો અને પાછો ફર્યો નહોતો. ઘટનાસ્થળે મળેલા બ્રેસલેટ પરથી કારમાંથી મળેલો મૃતદેહ તેની પત્નીએ ઓળખી કાઢ્યો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમને શંકા જતાં તેમણે તપાસ કરી હતી અને ચવાણ જીવતો હોવાનું સામે આવ્યું હતું. (પીટીઆઇ)■

અમેરિકા સાથે વ્યાપાર સોદાની અનિશ્ચિતતા વચ્ચે એફઆઈઆઈની એકધારી વેચવાલીને કારણે વેલ્યુ બાઈંગનો ૪૫૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ ગયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને વિદેશી ભંડોળના સતત આઉટફ્લોને કારણે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી નજીવા ઘટાડા સાથે બંધ થયા હતો. ઉપરાંત, ભારત-અમેરિકા વેપાર સોદા અંગેની અનિશ્ચતતા રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરતી હોવાનું વિશ્લેષકોએ જણાવ્યું હતું. સત્ર દરમિયાન યુએસ ફ્યુચર્સના સુધારા સાથે સ્થાનિક સ્તરે વેલ્યુબાઇંગને કારણે એક તબક્કે સેન્સેક્સ નીચી સપાટી સામે લગભગ ૪૫૦ પોઇન્ટ રિકવર થયો હતો, પરંતુ અંતે આ તમામ સુધારો ધોવાઇ ગયો હતા. દિવસ દરમિયાન, ૪૨૭.૩૪ પોઈન્ટ અથવા ૦.૫૦ ટકા ઘટીને ૮૪,૮૪૦.૩૨ની નીચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ ૫૪.૩૦ પોઈન્ટ અથવા ૦.૦૬ ટકા ઘટીને ૮૫,૨૧૩.૩૬ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૯.૬૫ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૨૬,૦૨૭.૩૦ પર બંધ થયો હતો.

સેન્સેક્સ કંપનીઓમાંથી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, ટાઇટન અને એચડીએફસી બેંક સૌથી વધુ ઘટનારા શેરોમાં સામેલ હતા. જ્યારે, હિન્દુસ્તાન યુનિલિવર, ટ્રેન્ટ, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્સ અને ટાટા સ્ટીલના ભાવમાં વધારો નોંધાયો હતો. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એએમસીનો ઇશ્યૂ બીજા દિવસે બપોર સુધીમાં જ લગભગ બે ગણો ભરાઇ ગયો હતો. કોરોના રેમેડીઝના શેર તેના રૂ.૧૦૬૨ના ઇશ્યૂ ભાવ સામે ૩૮ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૧૪૫૨ના ભાવે લિસ્ટેડ થયા હતા. જ્યારે વેકફીટ ઇનોવેશનના શેર તેના ઇશ્યૂભાવથી ૪૬ પૈસા નીચા ભાવે લિસ્ટેડ થયા હતા. મીરાઇ એસેટ મ્યુચ્યુઅલ ફંડે ઇન્ડિયા આઉટલૂક વિષયની પરિચર્ચામાં એવો મત વ્યકત કર્યો હતો કે ભારતીય શેરબજાર ૨૦૨૬માં મજબૂત પાયા સાથે પ્રવેશ કરી રહ્યું છે. અર્થતંત્રની મજબૂતી અને આર્થિક વિકાસના મજબૂત સંકેતકો જોતા લાંબા ગાળા માટે શેરબજાર સારુ વળતર આપી શકે છે. એસઇપીસી લિમિટેડે મધ્યપ્રદેશ ઓપનકાસ્ટ કોલ માઇનીંગ પ્રોજેક્ટના સંદર્ભમાં જેએઆરપીએલ - એટી કન્સોર્ટિયમ સાથે કરાર કર્યા છે. કંપનીએ સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સના ખાણકામ પ્રોજેક્ટ માટે મેસર્સ જય અંબે રોડલાઈન્સ અને મેસર્સ અવિનાશ ટ્રાન્સપોર્ટ સાથે કરાર કર્યા છે. વિવિધ કરારો હેઠળ કુલ કરાર મૂલ્ય રૂ. ૩,૨૯૯.૫૧ કરોડ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આગામી અમુક વર્ષોમાં બેટી સહિતના ઇલેક્ટ્રિક વ્હીકલના અન્ય ભાગો સ્વદેશી ધોરણે ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૧,૧૧૪.૨૨ કરોડના ઇક્વિટી વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૩,૮૬૮.૯૪ કરોડના શેર ખરીદ્યા હતા.

એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ, શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ નીચા સ્તરે બંધ રહ્યો હતો. યુરોપિયન બજારો ઊંચા વેપાર કરી રહ્યા હતા. શુક્રવારે યુએસ બજારો નીચા સ્તરે બંધ થયા હતા. યુએસ ફ્યુચર્સમાં સુધારો જોવા મળ્યો હતો જે વોલસ્ટ્રીટના આગામી સત્રમાં સુધારાની શક્યતા સૂચવે છે. બજારના સાધનો અનુસાર સતત વિદેશી ભંડોળના આઉટફ્લો અને નબળા રૂપિયાને કારણે બજારો સાંકડી રેન્જમાં અથડાતાં રહ્યા છે, જ્યાં સુધી ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા અંગે સ્પષ્ટતા ન આવે અને એફઆઇઆઇનું વલણ ના બદલાય ત્યાં સુધી બજારમાં અસ્થિરતા અને અફડાતફડી ચાલુ રહેવાની શક્યતા છે.

ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ, ૦.૧૫ ટકા વધીને ૬૧.૨૧ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. શુક્રવારે, સેન્સેક્સ ૪૪૯.૫૩ પોઈન્ટ અથવા ૦.૫૩ ટકા વધીને ૮૫,૨૬૭.૬૬ પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૪૮.૪૦ પોઈન્ટ અથવા ૦.૫૭ ટકા વધીને ૨૬,૦૪૬.૯૫ પોઈન્ટ પર બંધ થયો હતો. ટોચની માર્કેટ એનાલિસ્ટે કહ્યું હતું કે, બજારની આગામી ચાલનો આધાર ઇકોનોમકિ ડેટા અને વિદેશી ફંડોના વલણ પર રહેવાની ધારણાં છે. વિશ્લેષકો જણાવે છે કે, વિદેશી રોકાણકારોની ટ્રેડિંગ પ્રવૃત્તિ અને વૈશ્વિક સંકેતો આ અઠવાડિયે શેરબજારના વલણોને નિર્ધારિત કરશે. આ ઉપરાંત, રોકાણકારો દ્વારા યુએસ ડોલર અને ક્રૂડ ઓઇલ સામે રૂપિયાની હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે, એમ તેમણે નોંધ્યું હતું. પાછલા સપ્તાહે બજારમાં ભારે અફડાતફડી જોવા મળી હતી અને છેવટે સાપ્તાહિક અંત નકારાત્મક ક્ષેત્રમાં રહ્યો હતો. ગયા અઠવાડિયે, બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ૪૪૪.૭૧ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકાનો ઘટાડો થયો હતો. ભારત-યુએસ વેપાર ચર્ચાઓ સંબંધિત સમાચારો પણ માર્કેટને ઝોલા ખવડાવી શકે છે. સરકાર પાછલા અનેક મહિનાથી માત્ર ટૂંક સમયમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલની વાતો કરે છે પરંતુ તેની તારીખ જાહેર કરી શકતી નથી. આ ઉપરાંત મુખ્ય આર્થિક સચિવે માર્ચમાં તેની શક્યતા હોવાનું કથન પણ કર્યું હતું.

આ ઉપરાંત એફઆઇઆઇની એકધારી વેચવાલી મોટી ચિંતાનો વિષય છે. નવેમ્બર મહિનાના પહેલા બે અઠવાડિયામાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટીમાંથી ૧૭,૯૫૫ કરોડ રૂપિયા (બે અબજ ડોલર) પાછા ખેંચી લીધા છે, જેના કારણે ૨૦૨૫માં કુલ આઉટફ્લો રૂ. ૧.૬ લાખ કરોડ (૧૮.૪ અબજ ડોલર) થયો છે. વિદેશી ભંડોળના સતત આઉટફ્લો અને રૂપિયાના મૂલ્યમાં તીવ્ર ઘટાડાથી રોકાણકારોના વિશ્વાસ પર ભારે નકારાત્મક અસર પડી છે. આ સપ્તાહમાં ઇક્વિટી બજારો ખૂબ જ અસ્થિર રહેવાની શક્યતા છે કારણ કે વૈશ્વિક ફુગાવાના ડેટાના ભારેભરખમ ડેટા, રોકાણકારોનું ધ્યાન ફરી એકવાર નાણાકીય નીતિના ભાવિ તરફ દોરશે.

અમેરિકા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન, રીટેલ સેલ્સ અને નોન ફાર્મ પેરોલ્સના ડેટા સહિત મુખ્ય મેક્રો રિલીઝ અર્થતંત્રની મજબૂતાઈ અને ફુગાવાના અંદાજમાં ઊંડી સમજ આપશે તેવી અપેક્ષા છે. એકંદરે, વિશ્લેષકો એવું અનુમાન બાંધી રહ્યા છે કે વ્યાપક સૂચકાંકોમાં અસ્થિરતાના આંચકા સાથે બજારોમાં અફડાતફડી અને ઊથલપાથલનો દોર ચાલુ રહેશે. અલબત્ત, ભારત-યુએસ કરાર પર કોઈપણ ઔપચારિક પ્રગતિના સમાચાર બજારને મક્કમ આગેકૂચ તરફ દોરી શકે છે.

એફઆઇઆઇના એકધારા આઉટફ્લોને સંદર્ભે જાણીતા માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે યુએસ વ્યાજ દરમાં વધારો, તરલતાની કડક સ્થિતિ અને સુરક્ષિત અથવા વધુ ઉપજ આપતી ડેવલપ્ડ માર્કેટ એસેટની પસંદગી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો છે. ઉપરાંત, ભારતના પ્રમાણમાં વધુ પડતાં ઊંચા ઇક્વિટી મૂલ્યાંકને તેને અન્ય ઉભરતા બજારોની તુલનામાં ઓછું આકર્ષક બનાવ્યું છે જે હાલમાં વધુ સારું મૂલ્ય પ્રદાન કરે છે.

આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં ચાર નવા જાહેર ભરણાં અને ૧૫ કંપનીઓ લિસ્ટ થવાની તૈયારીમાં હોવાથી પ્રાથમિક બજાર સક્રિય રહેશે. મેઇનબોર્ડ અને એસએમઇ બંને સેગમેન્ટમાં ભારે ગતિવિધિ જોવા મળશે. નવા ઇશ્યૂઓમાં, કેએસએચ ઇન્ટરનેશનલ એકમાત્ર મેઇનબોર્ડ આઇપીઓ ઓફરિંગ છે જે આ સપ્તાહે ખુલશે, જ્યારે એસએમઇ સેગમેન્ટમાં ત્રણ આઇપીઓ ખુલશે. ચાર નવા આઇપીઓ ખુલશે અને પંદર જેટલી કંપનીઓ શેરબજારમાં પ્રવેશ કરશે. બુધવાર, ૧૭ ડિસેમ્બરે, નેફ્રોકેર હેલ્થ સર્વિસીસ અને પાર્ક મેડી વર્લ્ડ એનએસઇ તથા બીએસઇ પર લિસ્ટિંગ કરશે, જ્યારે યુનિસેમ એગ્રીટેક અને શિપવેવ્સ ઓનલાઇન એસએમઇ સેગમેન્ટમાં ડેબ્યૂ કરશે. એ જ રીતે, ૧૮ ડિસેમ્બરે પેજસન એગ્રો ઇન્ડિયા અને એચઆરએસ એલ્યુગ્લેઝ સાથે લિસ્ટિંગ મેળવશે, ત્યારબાદ ૧૯ ડિસેમ્બરે સ્ટેનબિક એગ્રો, એક્ઝિમ રૂટ્સ અને અશ્વિની કન્ટેનર મૂવર્સ આવશે.

દરમિયાન, ભારતની નિકાસ નવેમ્બરમાં ૧૯.૩૭ ટકા વધીને ૩૮.૧૩ અબજ ડોલરની સપાટીએ પહોંચી છે, જ્યારે આયાત ૧.૮૮ ટકા ઘટીને ૬૨.૬૬ અબજ ડોલરની સપાટીએ પહોંચી હોવાનું સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં જણાવાયું છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે નવેમ્બરના આઉટબાઉન્ડ શિપમેન્ટે આ વર્ષે ઓક્ટોબરમાં થયેલા નુકસાનને સરભર કર્યું છે. તેમણે કહ્યું કે નવેમ્બરમાં ૩૮.૧૩ બિલિયન ડોલરની નિકાસ પાછલા દસ વર્ષમાં સૌથી વધુ આંકડો દર્શાવે છે.

નવેમ્બરમાં વેપાર ખાધ ૨૪.૫૩ અબજ ડોલર હતી. સંયુક્ત રીતે, એપ્રિલ-નવેમ્બર દરમિયાન નિકાસ ૨.૬૨ ટકા વધીને ૨૯૨.૦૭ અબજ ડોલર થઈ હતી, જ્યારે આઠ મહિનામાં આયાત ૫.૫૯ ટકા વધીને ૫૧૫.૨૧ અબજ ડોલર નોંધાઇ હતી. સંયુક્ત રીતે, એપ્રિલ-નવેમ્બર દરમિયાન નિકાસ ૨.૬૨ ટકા વધીને ૨૯૨.૦૭ અબજ ડોલર થઈ હતી, જ્યારે આઠ મહિનામાં આયાત ૫.૫૯ ટકા વધીને ૫૧૫.૨૧ અબજ ડોલર થઈ હતી.

ડૉલર સામે રૂપિયો વધુ ૨૯ પૈસા ખાબકીને નવા તળિયે

મુંબઈઃ અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલીના દબાણ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો અને આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલીને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ૨૯ પૈસા ખાબકીને ૯૦.૭૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૯૦.૪૯ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૯૦.૫૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૯૦.૮૦ અને ઉપરમાં ૯૦.૫૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૨૪ પૈસાનાં કડાકા સાથે ૯૦.૭૮ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો ૧૭ પૈસા તૂટ્યો હતો. ગત નવેમ્બર મહિનામાં દેશની નિકાસમાં ૧૯.૩૭ ટકાનો વધારો અને આયાતમાં ૧.૮૮ ટકાનો ઘટાડો થતાં વેપાર ખાધ ૨૪.૫૩ અબજ ડૉલરના સ્તરે રહી હોવાના પ્રોત્સાહક અહેવાલ છતાં ગબડતા રૂપિયાને ટેકો ન મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલરમાં આયાતકારોની પ્રબળ માગ અને મૂડીગત્ બાહ્ય પ્રવાહ પણ વધુ રહેતાં માગ અને પુરવઠા વચ્ચેનું સમતુલન ખોરવાતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો છે. ડૉલર સામે રૂપિયામાં ૯૦.૫૦ની સપાટી ટેકાની સપાટી અને ૯૦.૯૫ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શકયતા જણાય છે. વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૦૮ ટકા ઘટીને ૯૮.૩૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૨૧ ટકા વધીને બેરલદીઠ ૬૧.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલો અનુક્રમે ૫૪.૩૦ પૉઈન્ટનો અને ૧૯.૬૫ પૉઈન્ટનો ઘટાડો અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ૧૧૧૪.૨૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વૈશ્વિક સોના-ચાંદીમા ઘટ્યા મથાળેથી સુધારોઃ સ્થાનિક ચાંદીમાં ₹ ૧૭૬૩ની પીછેહઠ, સોનામાં ₹ ૫૩૯નો સુધારો

મુંબઈઃ ગત શુક્રવારે વૈશ્વિક ચાંદીમાં વધ્યા મથાળેથી ત્રણ ટકા જેટલો કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી નીકળલી સલામતી માટેની અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે બાઉન્સબૅક જોવા મળ્યું હતું. તેમ જ સોનાના ભાવમાં પણ સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩૬થી ૫૩૯નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૧૭૬૩નો ઘટાડો આવ્યો હતો. આજે વૈશ્વિક ચાંદીમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવા છતાં ગત શુક્રવારના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ આગલા બંધ સામે કિલોદીઠ રૂ. ૧૭૬૩ના ઘટાડા સાથે રૂ. ૧,૯૩,૪૧૭ના મથાળે બંધ રહ્યા હતા. વધુમાં આજે સોનાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે ડૉલર સામે રૂપિયો વધુ ૨૫ પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરો

વધવાથી વેરારહિત ધોરણે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩૬ વધીને રૂ. ૧,૩૨,૭૧૫ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩૯ વધીને રૂ. ૧,૩૩,૨૪૯ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટીને બે મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ અમેરિકી ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૪૩૪૩.૯૬ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૧ ટકા વધીને ૪૩૭૪.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી ૨.૮ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૬૩.૭૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે રોકાણકારોની મજબૂત માગ અને સતત ત્રણ મહિનાથી કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું છે અને આગામી વર્ષ ૨૦૨૬માં પણ મક્કમ અન્ડરટોન જળવાઈ રહે તેવી શક્યતા યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો અને ભવિષ્યમાં રેટકટનો આધાર રોજગાર તથા ફુગાવાના ડેટા પર અવલંબિત રહેશે તેવો નિર્દેશ આપ્યો હતો. તેમ છતાં બજાર વર્તુળો વર્ષ ૨૦૨૬માં ફેડરલ રિઝર્વ બે વખત રેટકટ કરે તેવી ધારણા મૂકી રહ્યા છે. આજે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પે રૉલ ડેટા પર સ્થિર થઈ છે. વધુમાં ગત શુક્રવારે રશિયન સેન્ટ્રલ બૅન્કે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન દ્વારા યુક્રેનને લોન આપવા માટે રશિયન સંપત્તિનો ઉપયોગ કરવાની યોજના ગેરકાયદેસર છે અને તે તેના હિતોનું રક્ષણ કરવા માટે ઉપલબ્ધ તમામ માધ્યમનો ઉપયોગ કરવાનો અધિકાર અનામત રાખે છે. આમ રશિયાના આ નિવેદનને ધ્યાનમાં લેતા સોના-ચાંદીમાં અમુક અંશે સલામતી માટેની માગનો પણ ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કોપર, બ્રાસ, એલ્યુમિનિયમ અને ઝિન્કમાં બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપર અને બ્રાસની વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં ગત શનિવારે જોવા મળેલા ઘટાડા પશ્ચાત્ સ્ટોકિસ્ટોની નીચા મથાળેથી લેવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ૧૦ સુધીનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, તેની સામે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. પંચાવનનો ઘટાડો આવ્યો હતો, જ્યારે નિરસ માગે નિકલ અને લીડ ઈન્ગોટ્સમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ત્રણ અને રૂ. એકનો ઘટાડો જોવા મળ્યો હતો અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે જે ધાતુઓના ભાવમાં બાઉન્સ બૅક જોવા મળ્યું હતું તેમાં કોપર આર્મિચર અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને અનુક્રમે રૂ. ૧૦૨૧ અને રૂ. ૧૧૩૭, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. નવ વધીને રૂ. ૯૨૯, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૧૦૩૮, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને રૂ. ૧૦૫૦, બ્રાસ શીટ કટિંગ્સ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૭૨૦ અને રૂ. ૬૩૫ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૨૮૭ અને રૂ. ૩૨૯ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. પંચાવનના ઘટાડા સાથે રૂ. ૩૮૩૧ના મથાળે રહ્યા હતા, જ્યારે નિકલ અને લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૧૩૩૦ અને રૂ. એક ઘટીને રૂ. ૧૮૫ના મથાળે રહ્યા હતા.

સ્મોલ ગ્રેડની ખાંડમાં નરમાઈ

નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં નિરસ માગ અને સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦થી ૨૨નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારોની માગ અને માલની ગુણવત્તાનુસાર સ્મોલ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો અને ઉપલા મથાળેથી રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહેતા ખાસ કરીને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૯૧૨થી ૪૦૨૦માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે સ્મોલ ગ્રેડની ખાંડમાં માગ તથા માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ અને ઉપલા મથાળેથી રૂ. ૨૨ના ઘટાડા સાથે રૂ. ૩૮૩૨થી ૩૯૦૦માં થયા હતા. વધુમાં આજે નાકા ડિલવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ અનુસાર સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૭૫૦થી ૩૭૭૦માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૮૦૦થી ૩૮૭૦માં થયા હતા.

ખપપૂરતા કામકાજે દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ

૧થી ૧૫ ડિસેમ્બરમાં મલયેશિયાની પામતેલની નિકાસમાં ૧૫.૮૯ ટકાનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૨ રિંગિટનો ઘટાડો આવ્યાના અહેવાલ તેમ જ સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેસરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં હાજર બજારમાં દેશી-આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત પહેલી ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા નવેમ્બર મહિનાના સમાનગાળાના ૭,૨૮,૯૯૫ ટન સામે ૧૫.૮૯ ટકા ઘટીને ૬,૧૩,૧૭૨ ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે ૧૦ કિલોદીઠ ઈમામીના આરબીડી પામોલિનના રૂ. ૧૨૪૫.૭૫ અને સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૭૦, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. ૧૨૩૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૭૦ અને સન રિફાઈન્ડના રૂ. ૧૫૨૦, રિલાયન્સ કન્ઝ્યુમરના આરબીડી પામોલિનના રૂ. ૧૨૨૧ અને સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૫૮, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૫૫ અને પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. ૧૨૫૦થી ૧૨૫૩ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.

ગુજરાતમાં આજે ગોંડલ મથકે મગફળીની ૭૫,૦૦૦ ગૂણીની અને ગઈકાલની શેષ ૧૦,૦૦૦ ગૂણી મળી કુલ ૮૫,૦૦૦ ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. ૧૦૫૦થી ૧૪૦૦માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે મગફળીની નવી કોઈ આવક નહોતી, પરંતુ ગઈકાલની શેષ અનુક્રમે નવ હજાર ગૂણીના વેપાર મણદીઠ રૂ. ૧૦૫૦થી ૧૩૩૦માં થયાના અહેવાલ હતા. હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૨૫૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૮૦, સન રિફાઈન્ડના રૂ. ૧૪૯૦, સિંગતેલના રૂ. ૧૫૩૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૧૦ અને સરસવના રૂ. ૧૫૧૫ના મથાળે રહ્યા હતા.

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. એક લાખથી વધારે કટ્ટાથી યાર્ડ છલકાયું હતું. (તસ્વીરઃ પ્રવીણ સેદાણી, રાજકોટ)

બમણા આર્થિક લાભની લોભામણી સ્કીમ વડે લોકોને લૂંટવાનું કારસ્તાન માંડવીના કોડાયમાંથી પકડાયું

(અમારા પ્રતિનિધિ દ્વારા)

ભુજ: બજાર ભાવ કરતાં ઓછા ભાવે શુદ્ધ સોનું, ઓછા વળતર સામે બમણો આર્થિક લાભ આપવાના નામે ફેસબુક,ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ભોળા લોકો સાથે છેતરપિંડી આચરવાના સેંકડો બનાવો બહાર આવતા રહે છે તેવામાં સરહદી કચ્છના માંડવી તાલુકાના કોડાય ગામ પાસેથી એકના પાંચ ગણા નાણાં કરી આપવાની લોભામણી સ્કીમના નામે નકલી ચલણી નોટોના બંડલ દ્વારા ઠગાઈ આચરતી રહેતી ગેંગનો સાગરીત સ્થાનિક ગુન્હાશોધક શાખાના હાથે ઝડપાઇ ગયો હતો.

આ ઘટનાક્રમ અંગે સ્થાનિક ગુનાશોધક શાખાના ઇન્ચાર્જ પી.આઇ એચ.આર.જેઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રૂટિન પેટ્રોલિંગ દરમ્યાન મળેલી પૂર્વબાતમીના આધારે કોડાય પુલ ખાતેથી તલવાણામાં રહેનાર મજીદ અબ્દુલ્લા શેખ નામના દ્વિચક્રી વાહનમાં જઈ રહેલા શખ્સને આંતરવામાં આવ્યો હતો. તેની તલાશી લેવાતાં વાહનની ડેકીમાંથી ભારતીય ચલણી નોટોના બંડલો મળી આવ્યાં હતાં, જેમાં ઉપર અને નીચે સાચી ચલણી નોટ અને વચ્ચે ચિલ્ડ્રન બેંકની નોટો જોવા મળી હતી. આ ચલણી નોટોના બંડલ ભુજના અલીશા શેખડાડા નામના શખ્સને આપવા માટે રાખ્યાં હોવાની તેણે કેફિયત આપી હતી.

ઝડપાયેલો મજીદ ભારતીય ચલણી નોટના બંડલના વીડિયો બનાવી ભુજના અલીશા શેખડાડાને મોકલતો હતો, અલીશા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક આઈ.ડી બનાવીને ભારતીય ચલણી નોટોના શોર્ટ વીડિયો બનાવતો હતો જેમાં તે અલગ-અલગ પેટીઓમાં ભારતીય ચલણની નોટોના બંડલો રાખતો હતો, જેમાં ઉપરની નોટ સાચી અને બાકીની 'ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા' લખેલી નકલી નોટો હતી.આ પ્રકારના વીડિયો દ્વારા એક લાખના પાંચ લાખ આપવાની લલચામણી સ્કીમ વડે લોકો સાથે ઠગાઈ કરતો રહેતો હતો.

અલીશા અગાઉ પણ નકલી નોટના આધારે છેતરાપિંડીના ગુનામાં સામેલ રહી ચૂક્યો હતો. આ કાર્યવાહીમાં ૫૧ લાખના મૂલ્યના દર્શાવેલા ૧૯ નકલી ચલણી નોટોના બંડલ કબજે કરવામાં આવ્યાં હતાં.

આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીએ અગાઉ કેટલા લોકોને છેતર્યા છે તથા તેમની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે જાણવા રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ એચ.આર.જેઠીએ ઉમેર્યું હતું. ■

મુંબઈમાં ખોટું પાવરનામુ બનાવી, અંજારના વરસામેડીમાં આવેલું વૃદ્ધાનું મકાન બારોબાર વેંચી દેવાયું

(અમારા પ્રતિનિધિ દ્વારા)

ભુજ: અઢી દાયકા અગાઉના મહાવિનાશક ભૂકંપ બાદ વિકાસના માર્ગે આગેકૂચ કરી રહેલા સીમાવર્તી જિલ્લા કચ્છમાં મિલકત સંબંધી ગુનાઓનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે એ વચ્ચે પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલા એક મકાનને પચાવી પાડવાના હેતુથી મુંબઇ શહેરમાં બોગસ લોકો અને પાવરનામા બનાવીને મકાનને બારોબાર વેચી દેનારા વરસામેડીના નિલકંઠ હોમ્સમાં રહેનાર મંદાબેન મધુસૂદન દાવડાએ ધુણઇ-માંડવીના સતીશ દયાલ ભાનુશાળી, હમીરપર અબડાસાના નારણ માધવજી તથા મુંબઇના મહેન્દ્ર મણિલાલ મહેતા તથા બે મહિલાના ખોટા નામ ધારણ કરનાર વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો હતો.

વરસામેડીની બાગેશ્રી ટાઉનશિપ-૧માં વર્ષ ૨૦૧૦માં મંદાબેન દાવડાએ તેમના સાસુ ધનલક્ષ્મીબેન તથા નણંદ દક્ષાબેનનાં નામે ખરીદેલું મકાન લાંબા સમયથી ભાડે આપ્યું છે. વર્ષ ૨૦૧૨માં સાસુ તથા વર્ષ ૨૦૧૮માં નણંદનું અવસાન થયું હતું તેમજ તેમના સાસુને પગમાં તકલીફ હોવાથી તથા નણંદ માનસિક અસ્વસ્થ હોવાથી મુંબઇ પણ ગયાં નથી.

મંદાબેન ભાડૂઆત પાસે ભાડું લેવા જતાં કેટલાક માથાભારે માણસો વારંવાર ત્યાં આવતા હોવાનું અને તેમને મકાન તાત્કાલિક ખાલી કરવા દબાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું આથી તેઓએ ખાનગી રાહે તપાસ કરતાં સતીશ ભાનુશાળી નામના શખ્સે પોતાના મળતિયાઓ સાથે મળી તેમના સાસુ, નણંદની જગ્યાએ અન્ય કોઇ મહિલાઓ ઊભી કરી, ખોટી ઓળખ બતાવી તેમાં ખોટી સહીઓ કરી મુંબઇમાં પોતાના નામનું પાવરનામું-વીલ બનાવી લીધું હતું, જેમાં સાક્ષી તરીકે નારણ માધવજી અને મહેન્દ્ર મહેતા રહ્યા હતા. બાદમાં આ ખોટા પાવરનામાના આધારે સતીશે આ મકાન બારોબાર અન્ય વ્યક્તિને વેચી તેની પાસેથી રૂપિયા લઇ લીધા હોવાનો પર્દાફાશ થયો હતો.

મિલકતધારકો માટે આંખ ઉઘાડનારા આ બનાવ અંગે અંજાર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ■

ખાવડા પાસે માદક પદાર્થ પોષડોડાનાં પાઉડર સાથે બે રાજસ્થાની યુવક ઝડપાયા

(અમારા પ્રતિનિધી દ્વારા)

ભુજ: કચ્છમાં ભૂકંપ બાદ થયેલા ઔદ્યોગિકીરણને પગલે પરપ્રાંતીયોની વસ્તીમાં સતત થઇ રહેલા ઈજાફા વચ્ચે નશાખોરીનું દૂષણ પણ સતત વધી રહ્યું છે ત્યારે ભુજ તાલુકાના સીમાવર્તી ખાવડા નજીકથી માદક પદાર્થ એવા પોષડોડાનાં પાઉડર સાથે રિન્યુએબલ એનર્જી પાર્કમાં રહેતા અને વ્યવસાયે ડ્રાઈવર એવા રામપ્રતાપ બિશ્નોઈ અને નિહાલચન્દ રામપ્રસાદ બિશ્નોઈ નામના બે રાજસ્થાની યુવકને ખાવડા પોલીસે ઝડપી પાડ્યા હતા.

પી.આઈ.વી.બી.પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પૂર્વબાતમીના આધારે ભુજથી ખાવડા તરફ આવી રહેલી ટોયોટા ફોર્ચ્યુનર એસયુવી કારને રોકવામાં આવી હતી. જીપકારની તલાશી લેવાતાં ડેશબોર્ડ અંદર છુપાવેલો કિં.રૂા. ૬૮,૭૦૦નો માદક પદાર્થ પોષડોડાનો ૪.૫૮૦ ગ્રામ પાઉડર મળી આવ્યો હતો. આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ આ પાઉડર ભુજના માધાપરમાં રહેતા શિવલાલ બિશ્નોઈ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હોવાનું અને આર.ઈ. પાર્કમાં કામ કરતા કેટલાક શ્રમિકોને આપવા માટે લઇ જતા હોવાનું જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં ખાવડા પોલીસે ૬૮,૭૦૦નો પોષડોડાનો પાઉડર, ફોર્ચ્યુનર કાર નંબર આર.જે-૦૭-યુબી-૫૫૫૭ કિં. રૂા. ૧૦ લાખ અને બે મોબાઈલ કિં. રૂા. ૧૦,૦૦૦ના મુદ્દામાલને જપ્ત કરી, આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે કાર્યવાહી આદરવામાં આવી છે. ■

કડોલમાં વન વિભાગની ટુકડી પર હુમલો, સ્વબચાવમાં ઈન્ચાર્જ ઓફિસરનું હવામાં ફાયરિંગ

(અમારા પ્રતિનિધિ દ્વારા)

ભુજ: નાપાક પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડકીને આવેલા સરહદી કચ્છના નાનાં રણમાં મીઠાંની જમીન પર ગેકાયેદસર કબજા મુદ્દે અગાઉ અનેક વાર ગોળીબાર કે હત્યાના પ્રયાસ સહિતના ગંભીર બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે ત્યારે ભચાઉના કડોલનાં રણમાં ગેરકાયેદેસર રીતે મીઠાંનાં પાળા બનાવી રહેલા શખ્સોએ વન વિભાગની પેટ્રોલિંગ ટુકડી પર હુમલો કરવાની કોશિશ કરતાં વન વિભાગના અધિકારી દ્વારા સ્વબચાવ માટે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હોવાનો વધુ એક બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી હતી.

ભચાઉ પોલીસ મથકે જાણવાજોગ નોંધાવનારા ઈન્ચાર્જ ફોરેસ્ટ ઓફિસર કડવાભાઈ ભુરા ભરવાડ અને અન્યો ધોળાવીરા બાજુ પેટ્રોલિંગમાં હતા,એ દરમ્યાન એ.સી.એફ. ભરતકુમાર પ્રેમજી ચૌધરીને મળેલી બાતમીના આધારે વન વિભાગ દ્વારા વિવિધ ટુકડી બનાવીને કડોલનાં રણમાં ગયા હતા.

રક્ષિત જગ્યા પર ટ્રેકટર વડે મીઠાના પાળા બનાવી રહેલા કેટલાક શખ્સોએ વન વિભાગની ટુકડીને જોઈને પોતાનાં વાહનોની લાઈટો બંધ કરી નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ અફરાતફરીમાં એક ટ્રેક્ટરચાલકે પોતાનું ટ્રેકટર વન વિભાગની ટુકડી પર ચઢાવી દેવાના આશયથી રિવર્સમાં લેતાં કોઈ અઘટિત ઘટના ન બને તે હેતુથી ઈન્ચાર્જ ફોરેસ્ટ ઓફિસરે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

તેવામાં પાછળ આવી રહેલા ટ્રેક્ટરચાલકે પોતાનું વાહન અન્યત્ર વાળી લીધું હતું અને બાદમાં અંધારા તથા રણમાં કાદવ-કીચડનો લાભ લઈને તમામ શખ્સો નાસી ગયા હતા. હાલ ભચાઉ પોલીસે આ સમગ્ર મામલે તપાસ આદરી છે. ■

ગળપાદર જિલ્લા જેલમાંથી અમદાવાદની જડતી સ્ક્વોડને ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા

(અમારા પ્રતિનિધિ દ્વારા)

ભુજ: કચ્છના ગાંધીધામની ભાગોળે આવેલી, હાઈ સિક્યોરિટી ગળપાદર જિલ્લા જેલમાંથી અમદાવાદની જડતી સ્ક્વોડની આકસ્મિક તપાસ દરમ્યાન બેરેકમાંથી ત્રણ બિનવારસુ મોબાઇલ ફોન મળી આવતાં જેલતંત્ર દોડતું થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદની પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની ઝડતી સ્ક્વોડની ટુકડીએ ગત સમીસાંજે ગળપાદર જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં આ ટુકડીએ યાર્ડ નંબર-૧ તથા બેરેક નંબર-૨ના પ્રથમ શૌચાલયમાં તપાસ કરી હતી, જેમાં સંડાશના પોખરાની અંદર પ્લાસ્ટિકમાં રાખવામાં આવેલો ચાઈનીઝ ફીચર મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ બેરેકમાં ૧૯ કાચા અને ૧ પાકા કામના બંદિવાનોની પૂછતાછ હાથ ધરવામાં આવી હતી.

યાર્ડ-૨ના બેરેક નંબર ૮માં પાછળની દીવાલના ઉપરના ભાગે આવેલી બારીમાંથી પ્લાસ્ટિકમાં રખાયેલો ફીચર મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

આ મોબાઈલ કોનો છે તે ૧૬ કાચા અને ૧ પાકા કામના કેદીએ કબલ્યું નહોતું. બાદમાં યાર્ડ-૩ની બેરેક ૧૧માં સંડાશના પોખરાની અંદર પ્લાસ્ટિકમાં વિંટાળેલ ત્રીજો મોબાઈલ શોધી કાઢવામાં આવ્યો હતો. આ ત્રણેય મોબાઈલમાં બે સીમ રાખવાની જગ્યા છે. ત્રણેય બેટરી સાથે ચાલુ હાલતમાં જણાયા હતા.

ત્રણેયની બેટરીવાળી જગ્યાએ સ્ટીકર ઘસી નાખવામાં આવ્યા છે તેમજ બેમાં લોક હતા અને એકમાં લોક ન હોવાથી તેના આઈ.એમ.ઈ.આઈ. નંબર જાણી શકાયા હતા. આ ત્રણેય મોબાઈલ કોના છે? કોણ અંદર લાવ્યું? અંદર ઘૂસાડવામાં જેલના કયા કર્મચારીએ મદદ કરી હતી, તે સહિતની વિગતો જાણવા માટે મોબાઈલ એફ.એસ.એલ.માં મોકલવા તજવીજ હાથ ધરાઈ હોવાનું ઝડતી સ્ક્વોડના જેલર દેવશી રણમલ કરંગિયાએ જણાવ્યું હતું. ■

અલંગમાં ડીમોલેશન ન કરવાની માગ સાથે અલંગ સોસિયામાં જહાજ કટીંગ અચોક્કસ મુદત સુધી બંધ

(અમારા પ્રતિનિધિ દ્વારા)

ભાવનગર: જિલ્લાના અલંગ મણાર સ્થિત સરકારી ખરાબા અને ગૌરચણની જમીન પર થયેલા વર્ષો જૂના દબાણો ને દૂર કરવા માટે ડિમોલેશન પાર્ટ-૨ના ભાગરૂપે તંત્ર દ્વારા દબાણકર્તાઓને દબાણ દૂર કરો નહિતર તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની કરેલ તાકીદને સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે. અહીં વસવાટ કરતા સ્થાનિક, પર પ્રાંતિય શ્રમિકો, અને તેના પરિવાર જનોને, ધંધાર્થિઓ ને ક્યાં જવું તેવા પ્રશ્નોને પગલે ડિમોલીશન કાર્યવાહી બંધ રાખવામાં આવે તેવી માંગ સાથે અલંગ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ રવિરાજસિંહ ગોહિલ દ્વારા અલંગથી તળાજા ડે. કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરી આવેદનપત્ર પાઠવવાના અને જહાજ કટિંગ માટે એકપણ વ્યક્તિ એ મજૂરી કામ અર્થે ન જવા અંગે કરેલા એલાનને જબરદસ્ત સમર્થન મળ્યું છે.

ડે. કલેક્ટર જે.આર.સોલંકી એ આગેવાનો ને સ્પષ્ટ જણાવ્યું હતુ કે અમો કોર્ટ એ જે લોકોને દોષિત માન્યા છે, ગેરકાયદેસર દબાણ થયેલ હોવાનું માન્યું છે ત્યાં જ અમો ડિમોલેશન કરવા માગીએ છીએ. જે શિપ બ્રેકરો એ દબાણ કર્યાની વાત છે તે મેટર પણ કોર્ટમાં ચાલી રહી છે. સરકાર કોઈના હિતનું હનન કરવા માગતી નથી. ડે. કલેક્ટરે સવાલો કરનારને કડક કાર્યવાહીનો સંકેત આપતા કહ્યું હતું કે અમોએ ગ્રાઉન્ડ લેવલનો અભ્યાસ અને કામગીરી કરેલ છે. બધા જ પાસાનો અભ્યાસ કરેલ છે. સરકાર પરપ્રાંતીય શ્રમિકોને રહેવાની સગવડો આપવા કટિબદ્ધ છે. શ્રમિકોને રહેવા માટે આપેલ ખોલીઓના ઠેકા કોણ લે છે તે પણ ખબર છે. શ્રમિકોને ખોટા ઉશેકરો નહિ તેમ કહી ડિમોલેશન કાર્યવાહી તા.૧૭ના રોજ થશે જ તેમ ચોખ્ખું જણાવી દીધું હતું. આ સાથે જ ડે. કલેક્ટરે ગ્રાઉન્ડમાં બેસેલ જન સંખ્યાને પણ ડિમોલેશન થશે જ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી તાકીદ કરી હતી. જે લોકોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા જોઈએ તેઓને અહીં ઊભી કરાયેલ કોલોની ઉપરાંત શિપ બ્રેકરો દ્વારા પણ તૈયારી હોવાની વિગતો સાંત્વના આપતા કહી હતી. ■

માંડવીના વિજયસાગર ડેમની કેનાલના ખાડામાં ટ્રક પલટતાં ક્લીનરનું મોત

(અમારા પ્રતિનિધિ દ્વારા)

ભુજ: કચ્છના બંદરીય માંડવી પંથકના પુનડી ગામના સીમાડે આવેલા પ્રસિદ્ધ વિજયસાગર ડેમની કેનાલ નજીકથી પસાર થયેલી ટ્રક પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતમાં બાઉખા ગામના ૨૫ વર્ષીય સમદ દાઉદ ઓઢેજા નામના ક્લીનરનું તોતિંગ ટ્રક હેઠળ કચડાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, વિજયસાગર ડેમની મુખ્ય કેનાલ પાસે વન વિભાગ દ્વારા ફેન્સિંગ તારના થાંભલા નાખવાના ચાલી રહેલા કાર્ય અંતર્ગત ગત શનિવારે સવારે થાંભલા ભરીને આવેલી ટ્રક રિવર્સ લેતી વેળાએ કેનાલ આસપાસના ખાડામાં ખાબકીને પલટી ખાઈ ગઈ હતી. આ વેળાએ ભરતસિંહ જેમલજી સોઢા નામનો ટ્રક ચાલક સમયસૂચકતા બહાર નીકળી આવ્યો હતો, પરંતુ ટ્રકની ડાબી બાજુ બેઠેલો ક્લીનર સમદ ઓઢેજા તોતિંગ વાહન નીચે દબાઈ જતાં બનાવસ્થળે જ મોતને ભેટ્યો હતો. બનાવ સંદર્ભે કોડાય પોલીસે ભરતસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. ■

ભાવનગરમાં વોરાબજારમાં દોરીવાલા ચેમ્બરમાં એક સાથે ત્રણ દુકાનમાં ચોરી

(અમારા પ્રતિનિધિ દ્વારા)

ભાવનગર: શહેરમાં વોરાબજારમાં આવેલી દોરીવાલા ચેમ્બર ગ્રાઉન્ડ ફ્લોરની ત્રણ દુકાનોના તાળા તોડી અજાણ્યા શખસો રોકડ તથા મોબાઈલની ચોરી કરી નાસી છૂટ્યાની પોલીસમથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હરિયાળા પ્લોટ, તેલઘાણી કેન્દ્ર ભાવનગર ખાતે રહેતા અને વોરાબજાર દેસાઈ શેરીમાં આવેલ દોરીવાલા ચેમ્બરમાં નરેશ કટલેરી નામની રમકડાની દુકાન ધરાવતા નરેશભાઈ પરમાણંદદાસ રામવાણીએ ગંગાજળીયા પોલીસમથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે રાત્રીના તેઓ પોતાની દુકાન બંધ કરી ગયા બાદ સવારે દુકાને આવતા અને અંદર તપાસ કરતા વસ્તુઓ વેરવિખેર હોવા ઉપરાંત ગલ્લામાં રાખેલા રૂપિયા પણ ન હોય અને બહાર જઈ તપાસ કરતા તાળું તૂટેલું હોવાનું જણાતા તેમની દુકાનમાંથી રૂપિયા ૧૭૦૦૦ રોકડ ચોરી થયાનું જાણવા મળેલ. આ ઉપરાત તેમની બાજુમાં જીતુભાઈ શાહની જીતેન્દ્ર એન્ડ કંપની કરિયાણાની દુકાનનું પણ તાળુ તોડી તેની દુકાનમાંથી રૂપિયા ૫૦૦નું પરચુરણ ચોરી થયાનું જાણવા મળેલ, અન્ય જીગરભાઈ કપાસીની પી.એમ. આંગડિયા પેઢીની દુકાનના પણ તાળા તોડી તેમાંથી બે મોબાઈલ કિ. રૂા. ૨૫૦૦૦ તથા રૂપિયા ૨૦૦૦ રોકડાની ચોરી થયેલ આમ ત્રણ દુકાન મળી કુલ રૂપિયા ૧૯૫૦૦ રોકડા અને બે મોબાઈલ કિ. રૂા.૨૫૦૦૦ કુલ રૂપિયા ૪૪૫૦૦ અજાણ્યા શખ્સો ચોરી ગયાની ફરિયાદ નોંધાવતા ગંગાજળીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ■

અમરેલીમાં ફરી સાવજે હુમલો કરી એક યુવકને લોહીલુહાણ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: સૌરાષ્ટ્રના અમરેલીના વિઠ્ઠલપુર ગામ નજીક ખેતરમાં કામ કરતી વખતે સિંહના હુમલામાં ૨૭ વર્ષીય ખેડૂત ઘાયલ થયો હતો.

મધ્ય પ્રદેશનો વતની કરમ નાયક તેના પરિવારના સભ્યો સાથે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની. પોલીસ અને વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિંહ અચાનક ખેતરમાં દેખાયો અને નાયક પર હુમલો કર્યો હતો. ત્યાં હાજર લોકો પણ ફફડી ગયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે નાયકને કમરમાં ઇજા પહોંચાડ્યા બાદ સાવજ ભાગી ગયો હતો. બાદમાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરી હતી. પોલીસે નજીકના ગામોના રહેવાસીઓને સતર્ક રહેવા ચેતવણી આપી. નાયકને અમરેલીની શાંતાબા જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. ■

ભાવનગર જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટના આયોજન અંગે બેઠક યોજાઇ

(અમારા પ્રતિનિધિ દ્વારા)

ભાવનગર: રાજકોટ ખાતે આગામી તા.૧૦ થી ૧૨ જાન્યુઆરીના રોજ યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉપલક્ષ્યમાં ભાવનગર ખાતે તા.૧૯ ડિસેમ્બરના રોજ ઇસ્કોન ક્લબ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલનો કાર્યક્રમ યોજાશે, જેને અનુલક્ષીને આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરે કાયદો અને વ્યવસ્થા, સ્ટેજ અને સ્ટોલ બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો જાળવવા, આરોગ્ય, સ્ટોલ ફાળવણી, સેમિનાર એક્ઝિબિશન સુપરવિઝનની કામગીરી, ક્રેડિટ સેમિનાર, ટ્રાન્સપોર્ટેશની કામગીરી સહિત કુલ-૧૪ જેટલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત બીટુબી અને બીટુજી જેવી મહત્ત્વની બેઠકો, એમઓયુ, સ્ટોલ પ્રદર્શન ચર્ચા કરી હતી તેમ જ ભાવનગર જિલ્લામાં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થાય તે દિશામાં કામ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સતીષભાઈ ભાટિયાએ જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટના કાર્યક્રમની સમગ્ર રૂપરેખા રજૂ કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ■

રાજકોટમાં રોગચાળો વકર્યો, તાવ-શરદીના ૨,૧૩૨ દરદી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતના મોટાભાગના શહેરોમાં રોગચાળો વકરી રહ્યો છે. શરદ-તાવ અને ઉધરસના દરદી લગભગ ઘરે ઘરે છે અને સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં દરદીઓ ઊભરાઈ રહ્યા હોવાનું દેખાઈ આવે છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના દરદીઓ દિવસે દિવસે વધી રહ્યા છે. ગયા અઠવાડિયે શરદી-ઉધરસનાં લગભગ ૧,૨૭૧ અને સામાન્ય તાવના ૮૬૧, ડેન્ગ્યૂનાં ૨ અને કમળાનાં ૨ તેમજ ટાઇફોઇડનો ૧ સહિત વિવિધ રોગનાં લગભગ ૨,૩૨૮ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સક્રિય બન્યું છે. જો ખાનગી હૉસ્પિટલોના દરદીઓનો આંકડો ધ્યાનમાં લેવામાં આવે તો શહેરમાં આઠથી દસ હજાર જેટલા દરદી હોવાનું સૂત્રો જણાવે છે.

મનપાએ સ્વચ્છતાના તમામ પગલાં લેવામાં આવતા હોવાનો દાવો કર્યો હતો. પાણીમાં ક્લોરિનની ગોળીઓ નાખવામા આવે છે, ગંદકી હોય તેવી ઈમારતોને નોટિસો આપવામાં આવી છે, મચ્છરનો ઉપદ્રવ ઘટે તે માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે. રહેણાક અને વ્યાવસાયિક વિસ્તારો સાથે સ્કૂલ, કોલેજો આસપાસ પણ સ્વચ્છતાનો ખ્યાલ રાખવામા આવે, તેવા પ્રયાસો મનપા કરી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ■

જૂનાગઢ બાદ જેતપુરમાંથી પણ મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતભરમાં સાયબર ફ્રોડના મોટા ગુનામાં જાણ્યે અજાણ્યે સંડોવાયેલા મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સને સાયબર પોલીસ પકડી રહી છે. જૂનાગઢ અને જામનગર બાદ હવે જેતપુરમાંથી ૧૦ જેટલા અકાઉન્ટ હોલ્ડર્સને પોલીસે પકડી પાડ્યા હતા. દુબઈ સાથે જોડાયેલા આ કૌભાંડમાં આ દસ અકાઉન્ટ દ્વારા રૂ. ૯૫ લાખની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું હતું.

આ કૌભાંડમાં એકલા જેતપુરના આઠ શખ્સો અને અમદાવાદન એક તથા દુબઈના સૂત્રધાર મળી ૧૦ની સંડોવણી માલુમ પડી હતી. આ પ્રકરણમાં મહત્ત્વના પુરાવા તરીકે રૂ. અઢી લાખની કિંમતના ૧૦ મોબાઈલ ફોન કબજે કર્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર દૂબઈસ્થિત મનખુશ એરિયામાં રહેતો અને મૂળ અમરેલી જિલ્લાના વાવડીનો વતની રાહુલ પટેલ હોવાનું મનાય છે. તેની અટક કરવાની હજી બાકી છે. જોકે આ કૌભાંડના કથિત મુખ્ય આરોપી અમરેલીના રાહુલની હજુ અટક થઈ નથી.

આ મ્યુલ અકાઉન્ટ માટે ગરીબ અને મજૂર વર્ગના લોકોને લલચાવવામાં આવ્યા હતા. તેમને ખાતામાં આવતા નાણાના એક ટકા રકમ આપવાની લાલચ આપવામાં આવી હતી. તેમના ખાતામાં આ કૌભાંડના નાણાં જમા થતા હતા ત્યારબાદ આંગડિયા દ્વારા રોકડ રકમ જ્યાં ત્યાં પહોંચાડવામાં આવતી હતી. જેતપુર હેડ કોન્સ્ટેબલ ધવલ ગાજીપરાએ સરકાર તરફે ફરિયાદી બની આ ગુનો દાખલ કરાવ્યો છે. ■